

અલનલો કુણી રામયાળ

જસ્મીન છેડા



b

અવનવો કર્ચી રસથાળ

અવનવો કર્ચી રસથાળ Avnavo Kutchhi Rasthal

© શ્રીમતી જસ્મીન જ્યંત છેડા

All rights reserved with the Publisher. No part of this publication may be reproduced, stored in a retrieval system, or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording, or otherwise, without the prior written permission of the publisher.

પ્રથમ આવૃત્તિ : ૭ ફેબ્રુઆરી ૨૦૦૯

દ્વિતીય આવૃત્તિ : ૧ એપ્રિલ ૨૦૧૦

પ્રકાશક : મુલુંડ ટાઈમ્સ પબ્લિકેશન સેન્ટર
૧૮, મોનાણી સદન, ગૌરવ હોટલ સામે,
જે. એન. રોડ, મુલુંડ (વેસ્ટ),
મુંબઈ - ૪૦૦ ૦૮૦.
ફોન : ૨૫૬૮ ૮૨૬૭
E-mail : gurjarmat@gmail.com

પ્રાપ્તિ સ્થાન :

ગુજરાત કાર્યાલય
C/o. મુલુંડ ટાઈમ્સ પબ્લિકેશન સેન્ટર,
૧૮, મોનાણી સદન, ગૌરવ હોટલ સામે,
જે. એન. રોડ, મુલુંડ (વેસ્ટ),
મુંબઈ - ૪૦૦ ૦૮૦.
ફોન : ૨૫૬૮ ૮૨૬૭
E-mail : gurjarmat@gmail.com



‘કરછી વાનગી’ લખવાની પ્રેરણાના અંકુરનો સંચાર થયો. રોજ સવારે કાનોમાં અવાજ ગુંજતો અને પ્રશ્નો પૂછાતાં, મમ્મી આજે ઢોકળા બનાવવા છે, ઊંઘિયું બનાવવું છે, શ્રીખંડ અને લેળ બનાવવા છે, તે કેવી રીતે બનાવવા? તે જરા કહે અને લખી આપજે એમ મારી દિકરી કેતકી કહેતી.

જ્યારે વિવિધ વાનગીઓ, ફરસાણા, શાક, સામગ્રી અને બનાવવાની રીત પહેલા છૂટા છૂટા પાના પર પછી નોટ-બુકમાં લખતી ત્યારે તો સ્વખે પણ જ્યાલ ન હોતો કે મારી આ નોંધપોથીને એક દિવસે પુસ્તકાકારે પ્રગટ થવાનું સૌભાગ્ય સાંપડશે. પણ કોઈ એક શુલ ક્ષાણો મારા પતિ જ્યાંત છેડાએ પ્રેમ ભરેતી પ્રેરણા આપી કે, તું ભલે કવિ નથી, લેખક નથી, ચિંતક નથી, છતાં તારી પાસે કંઈક ઉપયોગી થવાની સહૃદાવના છે અને વિવિધ વાનગીઓ બનાવવાનો જો અનુભવ છે, કુદરતી સૂજ છે અને ઈશ્વરની બક્ષિસ છે, તે માત્ર તારી પાસે જ ન રાખતાં દીકરીઓને, બહેનોને અને મિત્રોને આપીને ગમતાનો ગુલાલ કરીએ તો કેમ?

આ વાનગીઓ કેટલા માણસો માટે કેટલી બનાવવી કે કઈ કઈ સામગ્રી કેટલી જોઈએ તેનું માપ આપ્યું નથી. તે દરેક વ્યક્તિની સામાન્ય સૂજ પર છોડી દીધું છે એનું મુખ્ય કારણ એ છે કે ચયચી/ચયચા, નાના મોટા હોય, મીઠું પણ સ્વાદ મુજબ વધુ-ઓછું નાખવું, મરચાની તીખાસ પ્રમાણે નાખવા હોય અને ઘણીવાર Wasteમાંથી બેસ્ટ પણ બનાવી શકાય, વધેલી વસ્તુમાંથી સારી વાનગી પણ બની શકે અને પૈસાની બચત પણ થાય, અનાજ Waste ન જય અને ઉપયોગ થઈ જય એટાં માપ નથી લખ્યું. રસોઈની થોડીક કુદરતી સૂજ દરેક બહેનને હોય જ છે.

રસોઈ કરતી વખતે માપ યા વજનને કાંટલે જોખી જોખીને નથી લેવાતું. એ તો અંદાજે વાડકી અને મૂઠીનો માપ લઈ આશરે લેવાય.

મારા સર્વ મંગલ કર્યોના પ્રેરક, પોખડ અને પ્રોત્સાહક ગ્રાણ મારા પતિદેવ જ્યાંત અને બાળકો કેતકી અને યશ છે. એમના સાથ અને સહકારથી આજે આ પુસ્તિકા કરછી વાનગી આપના હાથમાં છે.

- જસ્મીન જ્યાંત છેડા



માની ભમતા અને પિતાનું વાત્સત્ય અને એ ઉલય હદ્યનું અખંડ વહેતું પ્રેમરસ, માધુર્ય તો એજ સમજુ જાણી શકે જે એ હદ્યની ભાવના અનુભવી શકે. જગતના કોઈ પણ ખૂણે એવી મા નહીં મળે જે પોતાના બાળકોને બધી કળામાં પારંગત કરવાની ભાવના ન સેવતી હોય અને તેમા થ વળી દીકરીની માને તો દીકરી પોતાના કરતા પણ ગૃહકાર્યમાં વધારે નિપુણ થાય એવી અનેકાનેક અપેક્ષા હોય. અભ્યાસ, સાહિત્ય, સંગીત, સીવણ, ભરત-ગુંથણ એ બધું તો જાણે શાળામાં શીખવા મળે. પણ ઘરની વ્યવસ્થા રસોડાનો વૈભવ અને તેનો આનંદ, સંતોષ અને રસપુષ્ટિ તો મા સ્વચ્છ પોતે જ શીખવે. દીકરીને કેળવાડી આપવી એટલેથી જ માના હદ્યને સંતોષ થતો નથી. પરંતુ ગૃહઆંગણે આવતી દીકરી સમોવડી વહુ-બેટીને પણ કેળવીને પારંગત કરવાની એટલી જ તમના હોય છે.



પ્રાથમિક સમજ



આધુનિક જમાનામાં તો નીચે પાટલા પર બેસીને જમવાનો રિવાજ લગભગ અદરશ્ય જ થયો છે. ટેબલપર થાળીમાં કે પ્લેટમાં જમવાનું હોય અથવા બુઝે હોય. છતાં ટેબલપર થાળીની અથવા પ્લેટની વ્યવસ્થિત ગોઠવણી અને ભોજનની વાનગીઓનું વ્યવસ્થિત પીરસવું એ જાળવું પણ આવશ્યક છે. ગમે તેમ ખાવાનું ગોઠવીને ખવડાવી દેવું એના કરતા વાનગીઓની કલાત્મક ગોઠવણી કરી હોય તો ભોજન સમારંભ દીપી ઉઠે. અસલના વખતમાં પાટલા પર ભોજન સમારંભ પણ બહુ જ સુંદર રીતે પોજયામાં આવતા અને પવિત્ર વાતાવરણ સર્જાતું કોઈ વખત ઈચ્છા થાય તો એવો ભોજન સમારંભ કેવી સુંદર રીતે ગોઠવી શકાય.

કરણી લોકો અસલમાં પાટલા અને ગુડીયો અને આસનીયો લઈને જમવા બેસે ને મોજ લે અને તે જમણનો સંતોષ કંઈક અલગ જ હોય.

પાટલા એક સરખા રંગેલા અને એક જ માપના હોય તો સારું બે પાટલાની વચ્ચે યોગ્ય અંતર રાખવું. પાટલાની સામે થાળી મૂકવી. થાળીમાં જડરિયાત પ્રમાણે વાટકા-વાટકી, રકાબી મૂકવી. પાણીનો લોટો મુકવો (કળશીયો). નેપકિન જમાણી બાજુએ મુકવો.




થાળીમાં ડાબી બાજુથી ક્રમવાર વ્યવસ્થિત પીરસવાની પણ એક રીત છે. પહેલા મીઠું પછી લીંબુ, ચટણી, અથાળાં, કચુંબર, રાયતું, કોરું શાક અથવા કઠોળ, વાટકીમાં કઢી, શ્રીખંડ, દૂધપાક, રસ જે વસ્તુ બનાવી હોય તે પીરસવી. પછી મીઠાની પાસેથી પૂરી, રોટલી, ભાખરી કે ચોપડા મૂકવા. થાળીની વચ્ચમાં ફરસાણ અને શીરો, સેવ, બીરંજ - જે કાંઈ બનાવ્યું હોય તે પીરસવું. દહીંવડા, પકોડી વગેરે રકાબીમાં અથવા બાઉલમાં પીરસવી. પાપડ ડાબી બાજુ અડધો થાળીમાં અને અડધો બહાર એમ મૂકવો. વડી ફરફર જો તખ્યાં હોય તો તે વચ્ચમાં મૂકવા. શાક, કઠોળ, કઢી, વગેરે બધી વાનગી થોડી થોડી પીરસવી. થાળીમાં ઢગલો કરવો નહીં. રોટલી એક જ મૂકવી. પછી બે ત્રણ થી વધારે મૂકવી નહીં. ભાત છેલ્ટે પીરસવો.

f

અવનવો કરણી રસથાળ




મીઠું, તીંબુ, ચટણી, છૂંદો, તીંબુનું અથાણું, કેરીનું અથાણું, મરચું, કચુંબર, રાયતું, સંભારિય
ભીડા, કારેલા-બટાકા, કોરા મઠ, પૂરી, ખમણા ઢોકળા, કઢી, દૂધપાક, પાપડ



પાન અથવા ધાણાદાળનો પેકેટ, સુવા-વરીયાળી, સોપારી વગેરે.





ફાયપેન - તવી

નટકટર - સૂક્ષ્મ મેવાનો ભૂકો કરવાનું સાધન

ચીલીડટર - મરચા વાટવાનું સાધન

ચોપ એન્ડ ચર્ન - શાકભાજુને ઝીણું સમારવાનું સાધન

બાઉલ કેસરોલ - વસ્તુ ગરમ રાખવા માટેનું સાધન

બોશ કે હેન્ડ મિક્સર - ફીશવા કે પટ્ય બનાવવા માટેનું સાધન

પીલર - છોલવાનું ચઘ્પુ

કિચનમાસ્ટર - સૂપ અથવા ફળોનો રસ ગાળવા માટેનું સાધન

લીકવીડાઇઝર - કોઈપણ વસ્તુને રસાળ બનાવવા વાટવાનું સાધન

મિક્સર - વસ્તુને વાટવાનું કે પીસવાનું સાધન

h

અવનવો કરછી રસથાળ



- સર્વ કરવું - પીરસવું
કશ કરવા - વાટવું
કોટિંગ - પડ કરવું
બીટ કરવું - ફીણવું
બીન્સ - દાણા
સ્ટાર્ટસ - જમતા પહેલા લેવાનો નાસ્તો / વાનગી
દૂધપિક - વાનગીને પકડવાની સળી
ગ્રીજ - સાનમાં ધી લગાડી તેના પર મેંદો ભભરાવવો
કન્ફેન્સ મિલ્ક - ઘરૂ ગળ્યું દૂધ
રેપર - કાગળ વીટાળવો
થર્ન કરવું - મિક્સરમાં ધીમે ધીમે ફેરવવું
પલ્ય - ટમેટા, કુટ કે શાકનો માવો
સ્ટોક વોટર - વેજિટેબલ બાઈને બનાવવાનું પાણી
સોસ - ટામેટાનો જડો રસ
કોઈલ - ગોળા કર વીટવું

ટુંકાં ટુંકાં Tips

૧. કાચા કેળાનો માવો નરમ થયો હોય તો પૌઅં નાખીને ભૂસવું તેનાથી કટલેટ, વડા વગેરે તેલ ઓછું પીએ.
૨. દાળ પતલી થઈ હોય ને ઘણું કરવી હોય યા તો અચાનક મહેમાન આવી જાય તો ચણાનો લોટ પાણીમાં ઓગળી નાખવું તો દાળ વધારે પણ થઈ જાય ટેસ્ટી લાગે.
૩. હર રસોઈમાં પીસેલો ભરચો નાખવો એટલે તમારા ભરચા પણ Waste ન જાય.
૪. બાજરાની કટી વધી હોય તો થેપલા અથવા મૂઢિયામાં નાખવું કટી પણ વપરાઈ જાય અને કુણા અને પોચા થેપલા / મૂઢિયા બને.
૫. નાળિયેરની સૂકી ખમણ ધરમા રાખવી. અચાનક મહેમાન આવે તો દાળમાં, શાકમાં, કેળાવડામાં, કચોરીમાં, લસણાની ચટણીમાં અને નાળિયેરની ચટણી બનાવી શકાય.
૬. મિષ્ઠાન ધરમાં ન હોય અને મહેમાન આવી જાય તો ઘઉંનો શીરો ફટાફટ થઈ જાય ઉપર બદામને ડાજુની કાતરી નાખી ડેકોરેશન કરવું.
૭. લીંબુ ના હોય તો એના બદલામાં આમચૂર પાવડર નાખી શકાય.
૮. શાક લાલ કરવા હોય તો વધારમાં લાલ ભરચું નાખવું અને બીટ ખાતા હોય તો બીટને બાંધીને કીસ યા કશ કરી નાખવું.
૯. પાલકના શાકમાં હળવર ન નાખવી તો શાક Green કલરનું પડચું હોય.
૧૦. પરોઠામાં જુરો નાખવો અને ત્રીકોણ શૈપ આપી કણક સેજવવા તો વેરાઈટી થઈ જાય.
૧૧. ખાખરા ઉપર દૂધની મલાઈ લગાડીને ખાવ, તો ચરબી ન થાય.
૧૨. કોથમરી મોંધી હોય તો પાલકની ભાજ મીક્સ કરી ચટણી બનાવી એમાં દાળિયાને બદલે ભાબનગરી ગાંઢિયા નાખવા ચટણી ઘટ થાય અને Quantityમાં પણ વધુ થાય.
૧૩. આજનો મોટો ચાઈનીઝમાં ન નાખવાને બદલે ખાવાના સોડા નાખો તો ચાલે.
૧૪. સંભાર મસાલામાં ધી યા તેલ નાખી Urgent ચટણીની જેમ ખાવા કામ આવે.
૧૫. કાચા કેળાની પેટીસ બનાવી હોય તો માવામાં આરાંટનો લોટ નાખી મસળવું એક સરખું થઈ જાય એમાં મસાલો ભરી વાળીને સીધું તળવું.

j

અવનવો કરણી રસથાળ

૧૬. ઢોસાના આથામાં થોડું રવો નાખો તો ઢોસા કડક થાય.
૧૭. કોઈક શાકમાં શીંગને શેકી એના છલતાં કાઢી ભૂફો કરી શાકમાં વાપરવું.
૧૮. કોથમરી અને નાળિયેરની ચટણીમાં દાળિયા ન હોય તો શીંગદાણા નાખી શકાય.
૧૯. તીજા ગાંધિયામાં મોણ ન નાખો તો પણ ગાંધિયા કીપસી બને છે.
૨૦. આદુને પીરી રાખવું, હર રસોઈમાં નાખવાથી ગેસ પણ ન થાય.
૨૧. ચોમાસામાં મીઠું થોડું શેકીને રાખવું તો મીઠામાં લેજ નહીં થાય.

સવારે ઉઠી દરેક સ્વીને ગેસને છાંટવું કે જીવાત હોય તો નીકળી જાય અને ઘરમાં વાસી ઝડુ કાઢવું અને માટલે પાણી કાઢી માટલું ધોઈ ભરવા મૂકવું, બહેનો એક વાત ન ભૂલતા. જે ફીજ આપણે ખાવાની ચીજેનો સંગ્રહાલય છે એની દરરોજ સફાઈ કરવી જરૂરી છે.

સવારે ઉઠી પહેલા ફીજમાંથી વધેલું, આગલા દિવસોનું જે હોય દૂધ, મલાઈ, માખણ, ચટણીઓ, શાકભાજનો ટોપલો ટેમેની ટ્રે, Fruitની ટ્રે, પાણીની બોટલ, કાંઈ રંધેલા શાક, ફરસાણા, લોટ બાંધેલા, લીનું કાપેલા, કોઈ બરણીમાં પીકલ્સ, ખાટી છાસ, ઉશા Freezerમાં Icecream, Choclates, Dry Fruit, લસણ પીસેલો, ભરચા પીસેલા, નાળિયેરના ટુકડા, ખમણ, આ બધી ચીજે લગભગ હર ઘરે ફીજમાં જોવા મળે. આ બધી ચીજેની સફાઈ અને જોવું બહુજ જરૂરી છે. કારણ ખાવાની વસ્તુમાં અમુક કલાક પણી Bacteria ઉત્પન્ન થાય છે. અને વાસી ખાવાતી ગેસ Problem બહુજ થાય છે. આથો તાજે ખાઈ એ દિવસે પૂર્ણ કરી સોડોવાળો હોવાથી બીજે દીવસે ડબલ આથો આવી જાય છે. એના લીધે ખટાશ પકડી લે છે અને શરીરમાં પિત્ત યા acidity ઉલ્લિ કરે છે. જેટલું બને એટલું Pack ડબ્બામાં બધી ચીજે રાખવાથી એક બીજાની Smell જાય નહીં. કોથમરી યા હર ભાજુ તુરન્ત સાફ કરી છૂટા પાન કરી ફીજમાં મૂકવા ઘણીવાર અંદર ઈયળ અથવા અળસીયા હોય તો સરીસરીને ખાવાની વસ્તુમાં જાય તો પણ ખબર ન પડે. Waste કાંઈ જતું હોય તો Wasteમાંથી Best વાનગી થઈ જાય.

અનુકમણિકા

પેજ નં.	પેજ નં.
<u>થેપલા, રોટલી, પરોઠા, પડલા</u>	
<ul style="list-style-type: none"> ● મોગરદાળની ખીચડીના થેપલા ૨ ● મેથીના થેપલા ૨ ● ખીચડીનો રોટલો ૨ ● બાજરાનો રોટલો ૨ ● ગોળવાળો બાજરાનો રોટલો ૩ ● જુવારનો રોટલો ૩ ● મકાઈનો રોટલો ૩ ● રોટલી ૩ ● ગોળવાળી ઘઉંની રોટલી ૩ ● કોબીના પરોઠા ૪ ● ભાત-પાલક પરોઠા ૪ ● ઘઉંના લોટના પરોઠા (દશમી) ૪ ● મેથીની ભાજાના ઢેબરા ૫ ● મોગરદાળ ખીચડી (સાદી, મસાલા) ૫ ● છીલટા મગની દાળની ખીચડી ૫ ● ચાણાના લોટના પૂર્લા ૬ ● મગની છીલટી દાળના પૂર્લા ૬ ● મીઠા પૂર્લા (મધા ચલ્લા) ૬ 	
<ul style="list-style-type: none"> ● કંદાનો બ્રાઉન ભાત ૮ ● વટાણા ગાજર ભાત ૮ ● બીરયાની ૮ ● સ્ટીમ ભાત (સાદા ભાત) ૮ 	
<p style="text-align: center;">□□□</p> <ul style="list-style-type: none"> ● તુવેરની દાળની ખીચડી ૯ ● મગની ફોતરાવાળી દાળની ખીચડી .. (કાળી ખીચડી) ૧૦ ● મસાલા ખીચડી ૧૦ ● કાળી ખીચડી (મસાલાવાળી) ૧૦ 	
<u>દાળ, કઢી</u>	
<ul style="list-style-type: none"> ● દાળ, ટોકળી ૧૨ ● અડદ દાળ ૧૨ ● ઓસામણ લચકો ૧૨ ● તુવેર દાળ ૧૩ ● ત્રિભાગી દાળ ૧૩ ● કઢી ૧૩ ● ભીડાની કઢી ૧૩ ● વધારેલી છાસ ૧૪ ● છાસ ૧૪ 	
<u>શાક</u>	
<ul style="list-style-type: none"> ● બટેટાનું શાક (સુંદ) ૧૭ ● બટેટાનું રસવાળું શાક ૧૭ ● મૂળ ના પાનનું શાક ૧૭ 	

પેજ નં.	પેજ નં.
● કુરકુરી ભીડા	● તૂરીયાનું શાક ૨૫
● ફ્લાવરનું ભજ્યાવાળું શાક ૧૮	● સરગવજ શીંગનું શાક ૨૫
● ફ્લાવરનું શાક ૧૮	● ગુંદે જો શાક (ગુંદાનું શાક) ૨૫
● કોબીનું કાચુપાકું શાક ૧૮	● પાલક બટેટાનું શાક ૨૫
● કોબીનું લીલું શાક ૧૮	● પાલક તુવેર દાળનું શાક ૨૬
● કોબીનું શાક ૧૮	● કાચી કેરીનું શાક ૨૬
● ટમેટાનું સુકું શાક ૧૮	● ફણસીનું શાક ૨૬
● સેવ-ટમેટાનું શાક ૧૮	● શાકના સંભારિયા
● કારેલા શીંગ શાક ૧૯	.. (ચણાના લોટના) ૨૬
● કારેલાનું શાક ૨૦	● પાકા કેલાનું શાક ૨૭
● દૂધી દાળનું શાક ૨૦	● પાકા કેલાનું ખારો શાક ૨૭
● ગુવારનું શાક ૨૦	● કાચા કેળાનું સુકું શાક ૨૭
● વડીનું શાક ૨૦	● કાચા કેળાનું તળેલું શાક ૨૭
● પાપડ મેથીનું શાક ૨૧	● પરવળનું શાક ૨૭
● કંટોલાનું શાક ૨૧	● પરવળનું ભરેલું શાક ૨૮
● તાંદળની ભાજાનું ટોકળીવાળું શાક ૨૧	● કાળી મોગરીનું શાક ૨૮
● તાંદળની ભાજાનું શાક ૨૧	● લીલી મોગરીનું શાક ૨૮
● ખાટિયો (મેથીની ભાજ) ૨૨	● લીલા કાંદાનું શાક ૨૮
● રીંગણાનું ભરથો ૨૨	● કાંદા બટેટાનું શાક ૨૮
● ઉંધીયો ૨૨	● ગ્રીન વટાણાનું શાક ૨૮
● રીંગણા બટેટાનું શાક ૨૩	● બટેટા વટાણાનું શાક ૨૯
● જૈન ગ્રીન ઉંધીયું ૨૩	● વાલપાપડી ગટાનું શાક ૨૯
● ટીડોળાનું શાક ૨૩	● કોઈમિલેં જો શાક ૩૦
● ફ્લાવર વટાણા ગ્રીન શાક ૨૪	● પાપડનું શાક ૩૦
● ડાંગરનું શાક ૨૪	● ભરેલા મરચા ૩૦
● ચીભડાનું શાક ૨૪	● બટેટાનું ગ્રીન શાક ૩૦
● સૂકી મેથીનું શાક ૨૪	● બેસનના ગહ્નાનું શાક ૩૧

પેજ નં.	પેજ નં.
કઠોળ	
● નરમ મગ 33	● ગગન ગાંધિયા (કચ્છી મીઠાઈ) ૪૦
● મઠ 33	● પકવાન (કચ્છી મીઠાઈ) ૪૦
● ચાણા 33	● તલના લાડુ ૪૧
● વાલ 33	● શ્રીખંડ ૪૧
● મસુર 38	● કુટ સલાડ ૪૧
● મસુરની દાળ 38	● સુખડી (ગોળ પાપડી) ૪૧
● રાજમા 38	● મોહનથાળ ૪૨
● વટાણા (લીલા, સફેદ) રસવાળા ... 38	● શીરો ઘઉંના લોટનો ૪૨
● રગડો (સફેદ વટાણા) 34	● મગની દાળનો શીરો ૪૨
● તુવેર 34	● ઘઉંની ઘૂધરી ૪૨
	● પૂરણપોળી (ચાણાની દાળ) ૪૩
	● દારેજો શીરો ૪૩
	● ઘઉં-ચાણાના લાડુ ૪૩
મિઠાઈ	
● લપદી લાપસી (મીઠો ભાત) 37	● કાંટરાના લાડુ ૪૪
● કોપરાપાક 37	● ઘાબાવાળા લાડુ ૪૪
● મેસૂર 37	● બાજરાનો ગોળવાળો રોટલો ૪૪
● શીંગનો મેસૂર 37	● ખજૂરપાક ૪૪
● લાડુ 38	● ખીર (ચોખાની) ૪૫
● માલપૂઢા 38	● સેવનો શીરો ૪૫
● ઓસરેલી સેવ 38	● બરફી ચૂરમો ૪૫
● હૃદપાક 38	● ગુંદરપાક ૪૫
● રવાનો શીરો 38	● મગજ ૪૬
● ચીકુનો હલવો 38	● તલસાંકળી ૪૬
● ગાજરનો હલવો 38	● અડદીયાપાક ૪૬
● દૂધીનો હલવો ૪૦	● કયરીયું ૪૬
	● આદુપાક ૪૭

પેજ નં.	પેજ નં.
ફરસાણા	
● સાબુદાણા વડા ૪૯	● બટેટાના સમોસા ૫૬
● ખાંડવી ૪૯	● ભાતના ભજ્યા ૫૬
● પનીર સેન્ડવીચ ૪૯	● ગોટા ૫૭
● દહીવડા ૪૯	● મગની દાળની કચોરી ૫૭
● મેંદૂવડા ૫૦	● હંડવો ૫૭
● બટેટા વડા ૫૦	● પૌંચા વધારેલા ૫૮
● કેળા વડા ૫૦	● ચોખાનું ખીચું ૫૮
● આલુ પરોઠા ૫૦	
● કાચા કેળાના મૂઠિયા ૫૧	સૂકા નારતા
● કોબીજ મૂઠિયા ૫૧	● ચેવડો (શ્રીણા પૌંચાનો) ૬૦
● પાતરા ૫૧	● તીખા ગાંઠિયા ૬૦
● કાંઝ વડા ૫૧	● ચકરી (૧) ૬૦
● બીટ વટાણાની કટલેટ ૫૨	● ચકરી (૨) ૬૦
● વટાણાની કચોરી ૫૨	● મેથી મસાલા પૂરી ૬૦
● ભાખરવડી ૫૨	● ભેલની પૂરી ૬૧
● દૂધીના મૂઠિયા ૫૩	● ગોપા પૂરી ૬૧
● કાચા કેળાની પેટીસ ૫૩	● કાચા કેળાની વેફર ૬૧
● ફરાળી બટેટાની પેટીસ ૫૩	● તળેલી ચણાની દાળ ૬૧
● મોનીટા કોન (કેનેપ્સ) ૫૪	● (જાડા પૌંચાનો) ચેવડો ૬૧
● મગની દાળના ભજ્યા ૫૪	● ગાંધા સંક્રચપારા ૬૨
● બકાલાના ભજ્યા ૫૪	● સલોની ૬૨
● લીલી મેથીના ભજ્યા ૫૪	● મકાઈનો ચેવડો ૬૨
● ત્રણ ભાગી દાળના ટોકળા ૫૫	● બાજરીના વડા ૬૨
● મગની છલટી દાળના ટોકળા ૫૫	
● શ્રીન પાનના ભજ્યા ૫૬	રોજિંદા ગરમ પીણા
● બેડ રોલ ૫૬	● ઉકાળો ૬૪
	● મસાલાવાળો દૂધ ૬૪

પેજ નં.	પેજ નં.
<ul style="list-style-type: none"> ● અલચીવાળો દૂધ ૬૪ ● હળદરવાળો દૂધ ૬૪ ● કોઝી ૬૪ ● ગુંડરની રાબ ૬૪ ● મગનું પાણી ૬૫ ● બાજરાના લોટની દૂધવાળી રાબ ... ૬૫ ● બાજરાના લોટની છાસવાળી રાબ . ૬૫ ● ગોળવાળી ઘઉંના લોટની રાબ ૬૬ ● અસેરિયાવાળી રાબ ૬૬ ● તજ લવિંગનો કાળો ૬૬ ● ચાય ૬૬ ● અજમાનો કાળો ૬૭ ● આરાઝના લોટની કંઝ ૬૭ ● સુંધની રાબ ૬૭ 	<ul style="list-style-type: none"> ● ચાણાના લોટવાળા લીલા મરચા ૭૧ ● સીમલા મરચાના સંભારીયા ૭૨ ● ખમણ મરચા ૭૨ ● સાંતગેલા મરચા ૭૨
બારમાર્તી અથાણાં	
	<ul style="list-style-type: none"> ● ગૂંધાનું અથાણું ૭૪ ● ગળ્યું અથાણું ૭૪ ● કેરીનું અથાણું..... ૭૪ ● કેરીનો છુંદો ૭૫ ● આદું, હળદર અને લીબુનું અથાણું ૭૫
ચટણી	
	<ul style="list-style-type: none"> ● કોથમીરની ચટણી ૭૭ ● દાળિયા શીંગની સૂકી ચટણી ૭૭ ● ચાણાની દાળ અને અડદની દાળની ચટણી ૭૭ ● લસણાની સૂકી ચટણી ૭૭ ● કોથમીરને પાલકની ચટણી ૭૮ ● કોથમીરને ફુંદીનાની ચટણી ૭૮ ● લીલાં કોપરાની ચટણી ૭૮ ● કોપરા લસણાની ચટણી ૭૮ ● કોપરા કાંદાની ચટણી ૭૮ ● આમલી/ખજૂર ચટણી ૭૮ ● કાચી કેરીની ચટણી ૭૮
તાજ અથાણાં (Instant)	
<ul style="list-style-type: none"> ● કેરી-મેથી ૬૮ ● ટીડોમાં-મેથી ૬૮ ● કાકડી-મેથી ૬૮ ● કોબીના ડાઢા ૬૮ 	
તાજ અથાણાં (Instant)	
<ul style="list-style-type: none"> ● સામગ્રી અને રીત આશરે 	
લીલા મરચાના અથાણાં	
<ul style="list-style-type: none"> ● મરચાનો ઠેસો ૭૧ ● આથેલા મરચા ૭૧ 	

પેજ નં.	પેજ નં.
<ul style="list-style-type: none"> ● લસણાની ચટણી ૭૮ ● પાકા ટમેટાની ચટણી ૭૯ ● કાચા ટમેટાની ચટણી ૭૯ ● કોપરા અને ચાણાદાળની ચટણી ... ૮૦ ● તલ કોપરાની ચટણી ૮૦ ● દૂધીની છાલની ચટણી ૮૦ ● ગાંધિયાની ચટણી ૮૧ ● નાળિયેરની ચટણી ૮૧ ● લાલ મરયાંની ચટણી ૮૧ ● ભીડાની ચટણી ૮૧ 	<ul style="list-style-type: none"> ● બટેટાનું કચુંબર..... ૮૧ ● લીલી હળદર અને આદુ કચુંબર ૮૧ ● કાકડીનું કચુંબર ૮૧ ● વટાણાનું કચુંબર ૮૧ ● ટમેટા, કેરી, કાંદાનું કચુંબર ૮૧
સૂક્ષ્મવાણી	
<ul style="list-style-type: none"> ● મરયાંની સૂક્ષ્મવણી (૧) ૮૮ ● મરયાંની સૂક્ષ્મવણી (૨) ૮૮ ● ગુવાર-કોર્ટીબાની સૂક્ષ્મવણી ૮૮ ● શક્કરટેટીની કાચલી ૮૮ ● સાખુદાળા બટેટાની ચકરી ૯૦ ● કારેલાની સૂક્ષ્મવણી ૯૦ ● ટેટીના બી ૯૦ ● ખેરાવડી ૯૦ 	<ul style="list-style-type: none"> ● સોપારી ૮૨ ● મીઠાવાળી વરિયાળી ૮૨ ● અજમો ૮૨ ● તલ ૮૨ ● સૂવા ૮૨ ● સૂવા, વરિયાળી, તલ, ઘાણાદાળ ૮૩
મુખવાસ	
<ul style="list-style-type: none"> ● બુંદીનો રાયતો ૮૩ ● ફુટનો રાયતો ૮૩ ● કાંદાનો રાયતો ૮૩ ● બીટનો રાયતો ૮૩ ● કાકડીને ટમેટોનો રાયતો ૮૪ ● પાકા કેલાનો રાયતો ૮૪ ● કાકડીનો રાયતો ૮૪ 	<ul style="list-style-type: none"> ● કચી મુખવાસ
કચુંબર	
<ul style="list-style-type: none"> ● કચુંબરનો મસાલો ૮૬ ● ગાજરનું કચુંબર ૮૬ ● કોબી - ટમેટાનું કચુંબર ૮૬ ● ટમેટા કાંદાનું કચુંબર ૮૬ ● મોગરીનું કચુંબર ૮૭ 	<ul style="list-style-type: none"> ● સૂવા, વરિયાળી, તલ, ઘાણાદાળ ૮૩
મસાલા બનાવવાની રીત	

થેપલા, રોટલી, પરોઠા, પૂડલા

- મોગરદાળની ખીચડીના થેપલા
- મેથીના થેપલા
- ખીચડીનો રોટલો
- બાજરાનો રોટલો
- ગોળવાળો બાજરાનો રોટલો
- જુવારનો રોટલો
- મકાઈનો રોટલો
- રોટલી
- ગોળવાળી ઘઉંની રોટલી
- કોબીના પરોઠા
- ભાત-પાલક પરોઠા
- ઘઉંના લોટના પરોઠા (દશમી)
- મેથીની ભાજના ફેબરા
- મોગરદાળ ખીચડી (સાદી, મસાલા)
- છીલટા મગની દાળની ખીચડી
- ચાંચાના લોટના પૂડલા
- મગની છીલટી દાળના પૂડલા
- મીઠા પૂડલા (મઢા ચલ્લા)

બાજરાની લોટ

સામગ્રી :- મોગરદાળની ખીચડી, ઘઉનો લોટ, મીઠું, મોણ (તેલ), કોથમરી, આદુ, ભરચા પિસેલા, તલ

રીત :- ઘઉનો લોટ લેવો એમાં ઉપર આપેલ બધો મસાલો નાખવો એમાં પ્રમાણસર વધેલી ખીચડી નાખવી કે તમે વાણી શકો અને તેલ નાખી સીજવવાના આ થેપલા ૧ દિવસમાં ખાઈ લેવા કારણ અંદર ખીચડી નાંખેલી હોવાથી વધુ સમય રાખતાં ખરાબ થઈ જય.



બાજરાની લોટ

સામગ્રી :- મેથીની ભાજી, ઘઉનો લોટ, મીઠું, મોણ, હળદર, પીસેલા લીલા ભરચા, તલ, ખાદું દહી, છાસ

રીત :- મેથીની ભાજી ધોઈ ઝીણી સુધારવી એક થાળીમાં રાખી ઘઉનો લોટ લેવો એમાં ઉપર આપેલ બધી સામગ્રી નાખી લોટ બાંધવો ન નરમ, ન કડક. પછી રોટલીની જેમ વણવા અને તેલમાં સીજવવા. ગરમ ગરમ સરસ લાગે અને બહારગામ લઈ જવા હોય તો થાળીમાં છુટા છુટા રાખી કંડા કરવા પછી ડફ્ફામાં નાખી દેવા.



બાજરાની લોટ

સામગ્રી :- મગની છલટી દાળની ખીચડી, બાજરાનો લોટ, પાણી

રીત :- મગની છલટી દાળની ખીચડી વધી હોય તો બાજરાના લોટમાં પ્રમાણસર નાખી પાણી નાખી લોટ બાંધવો અને ચકલા ઉપર રોટલો વણવો હાથેથી અને તવી પર સીજવવાનું એવો કુણો ને પોચ્યો સરસ લાગે.

બાજરાની લોટ

સામગ્રી :- બાજરાનો લોટ, પાણી

રીત :- બાજરાના લોટમાં પાણી નાખી લોટ બાંધવું અને ચકલા ઉપર હાથેથી ટીપવું અને તવો અથવા માટીની તાવડી ઉપર નાખી ઉપર પાણીવાળા હાથ લગાડવો અને ઉથલાવી કપડાથી શેકવું અથવા તવો ઉતારી ગેસ પર સીજવવાનું તો રોટલો તૈયાર.



બાજરાનો લોટ

સામગ્રી :- બાજરાનો લોટ, ગોળ, ધી

રીત :- ગોળવાળો પાણી બનાવી રાખવું અને એક મોટી થાળીમાં બાજરાનો લોટ લેવો એમા ગોળવાળો પાણી નાખી લોટ બાંધવો અને રોટલો બનાવી ઉપર ધી લગાડી ખાવું.

જુવારનો લોટ

સામગ્રી :- જુવારનો લોટ, પાણી, ધી (ચોપડવા)

રીત :- જુવારના લોટમાં પાણી નાખી લોટ બાંધવું અને બાજરાના લોટની જેમજ બનાવવું અને ધી ચોપડી ખાવું.



મકાઈનો લોટ

સામગ્રી :- મકાઈનો લોટ, મીઠું, ધી, તેલ

રીત :- મકાઈનો ઝીણો લોટ લેવો અને હુંકાળા પાણીથી બાંધવો. એમા ચપટી મીઠું અને ધી અથવા તેલનું મોણ નાખવું એટલે મકાઈની રોટલી પેટમાં દુખે નહિ.



ઘઉનો લોટ

સામગ્રી :- ઘઉનો લોટ, મોણ, મીઠું

રીત :- ઘઉનો લોટ લેવો એમાં મીઠું, મોણ એટલે તેલ નાખી મીડીયમ લોટ બાંધવું અને રોટલી બનાવવી.



ઘઉનો લોટ

સામગ્રી :- ઘઉનો લોટ, ધી, ગોળ

રીત :- ઘઉના લોટનો લોટ બાંધી રોટલી બનાવી અને કોરી કોરી ભૂસવી એમાં ધી નાખવું અને ગોળ સુધારીને ભૂસવું સાથે મોળી છાસ સાથે ખાવું.



સામગ્રી :- કોબી, વાટેલા આદુ મરચા, તેલ, મીઠું, તલ, ખાંડ, લીંબુ, ગરમ ભસાલો, કોથમરી, ઘઉંનો લોટ, રાઈ જીરું



રીત :- કોબીને એકદમ જીણી સમારવી યા છીજાવી મીઠું નાખી ૧૦ મીનિટ રહેવા દેવી. એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ જીરાનો વધાર કરી કોબીમાંથી પાણી કઢી કોબી વધારવી સાંતળવી પછી ઉપર આપેલ બધો ભસાલો નાખવો. બધું બરોબર હુલાવી ગેસ પરથી નીચે ઉતારી દેવું. ઘઉંનો લોટ લેવો એમાં ૨ સ્પૂન તેલ નાખી, પાણી નાખી, રોટલી જેવો લોટ બાંધવો. લોટના લુાંદી કરી તેની નાની રોટલી વણી તેમાં કોબીનું પૂરણ ભરી કચોરીની જેમ વાળી ફીથી વણવું. નોન સ્ટિક પેન ઉપર પરોઠા મૂકવા અને તેલથી સાંતળવા.



સામગ્રી :- રાંધેલા ભાત, પાલક પીસેલી, ઘઉંનો લોટ, મીઠું, મોણા, પીસેલા મરચા, કોથમરી, લીલા મરચા



રીત :- ઘઉંનો લોટ લેવો એમાં મોણા મીઠું રાંધેલા ભાત અને પાલક કોથમરીની ચટણી બનાવી એમાં નાંખી લોટ બાંધવો અને ઘઉંના લોટનો અટામણ લઈ વણીને પરોઠા બનાવા. ગ્રીન પરોઠા સરસ લાગે.



સામગ્રી :- ઘઉંનો લોટ, મોણા (તેલ), મીઠું



રીત :- ઘઉંનો લોટ લેવો એમાં મોણા નાખવું. મીઠું નાખવું અને પાણી અથવા દૂધથી બાંધવું અને તેલથી સીજવવું. Shapeમાં ગોળ આકાર અથવા ગ્રીકોણ પણ સારા લાગે.



બાજુરીની લોટ

સામગ્રી :- મેથીની ભાજી, બાજુરીનો લોટ, ઘઉંનો લોટ, વાટેલા મરચા, અજમો, હળદર, તેલ, દહી, મીઠું

રીત :- મેથીની ભાજને ઝીણી સમારી ધોઈ નાખવી. બાજુરીના લોટમાં ઘઉંનો લોટ, બધો મસાલો, મોણ, દહી નાખી પરોઠા જેવો લોટ બાંધવો. લોટ બે ત્રણ કલાક વહેલા બાંધી રાખવું જેથી ઢેબરા પોચાં થાય. લુઆની બંને બાજુ તેલ દબાવી ઘઉના લોટનું અટામડા લઈ ઢેબરા વણવા અને નોન સ્ટિક પેનમાં તેલ મૂકી સાંતળવા. આ ઢેબરા લસણાની ચટપણીની સાથે ખાવા.



બાજુરીની પાણી (દાળ, મસાલા)

સામગ્રી :- મોગરદાળ, ચોખા, મીઠું, હીંગ, હળદર (બે જણા માટે)

રીત :- બેઉ દાળ અને ચોખા અડધો અડધ ભાગ કરવા ૧ વાટકી ખીચડી હોય તો ત્રણ વાટકા પાણી નાખવું. એમાં મીઠું, હીંગ, હળદર નાખવી અને મસાલા ખીચડી કરવી હોય તો એમા વટાણા, કાંદા, બટેટા, ટ્યેટા, લસણા, લાલ મરચા, ગરમ મસાલો, કોથમરી નાખવું તો બહુજ ટેસ્ટી લાગશે સાથે કઢી બનાવવી.



છલટી દાળ

સામગ્રી :- મગની છલટી દાળ, ચોખા, મીઠું (બે જણા માટે)

રીત :- મગની છલટી દાળ અને ચોખા બેઉ સરખે લાગે લેવા. ૧/૨ વાટકો છલટી દાળ હોય તો અડધો વાટકો ચોખા લેવા એટલે ૧ વાટકો ખીચડીનો માપ થયો. ૧ વાટકો માપ હોય તો ૩ વાટકા પાણી જોઈએ અને મીઠું નાખી કુકરમાં ૭/૮ સીટી મરાવી. બે ત્રણ કલાક પહેલા દાળ ચોખા ભરીજવી રાખીએ તો સરસ ખીચડી થાય.




મસાલા ખીચડી કરવી હોય તો અંદર હળદર, લાલ મરચાં, ધાણા જીરું નાખવું તો પણ સારી લાગે.



સામગ્રી :- ચણાનો લોટ, મીઠું, લાલ ભરયું, હળવર, ધાળા જીરું, (કાંદા, ટમેટો) નાખવા હોય તો, કોથમરી

રીત :- ચણાનો લોટ લેવું એમા ઊપર આપેલ બધી સામગ્રી નાખી પાણી નાખી ખીરું તૈયાર કરવું સાદા પૂડલા થાય અને કાંદા ટમેટો નાખવા હોય તો પણ નાખી પૂડલા સરસ થાય, ચટણી કે સોસથી ખાવા.



સામગ્રી :- મગની છલટી દાળ, પીસેલા આદુ ભરચા, કોથમરી, મીઠું

રીત :- મગ દાળને ભીજાવી. તથી ૪ કલાક પછી ઘોઈને છલટા કાઢવા થોડાક છલટા રાખવા અને પાણી નીતારી લેવું અને પછી મીક્સરમાં પીસવું. ખીરું તૈયાર થાય પછી એમાં કોથમરી આદુભરચાની પેસ્ટ અને મીઠું નાખી, પાણી નાખી પ્રમાણસર ખીરું તૈયાર કરવું અને ગરમ ગરમ પૂડલા બનાવી ખાવા, ઢા મજા નહીં આવે.



સામગ્રી :- ઘઉનો લોટ, ચણાનો લોટ, પીસેલી સાકર, ધી

રીત :- ઘઉનો લોટ અને ચણાનો લોટ બેઠું મીક્સ કરી પાણી નાખી ખીરો તૈયાર કરવું. ચણાનો લોટ ઓછું નાખવું અને તવા ઊપર પૂડલા પાડી પાડી એ થાળીમાં રાખી ગરમ ગરમ ભુસવા એની ઊપર ધી અને પીસેલી સાકર નાખી મીક્સ કરી ખાવું.



ભાત, ખીચડી

□□

- શરા ભાત
- વધારેલા ભાત
- કંદાનો બ્રાઉન ભાત
- વટાણા ગાજર ભાત
- બીરયાની
- સ્ટીમ ભાત (સાદા ભાત)

□□□□□

- તુવેરની દાળની ખીચડી
- મગની ફોતરાવાળી દાળની ખીચડી (કાળી ખીચડી)
- મસાલા ખીચડી
- કાળી ખીચડી (મસાલાવાળી)

ભાત

ચામગ્રી

સામગ્રી :- જુડુ, ચોખા, ધી, મીઠું

રીત :- ચોખાને છૂટા બાકી મીઠું નાખી બાકવા અને હંડા કરવું. એક કડાઈમાં ધી નાખી જીરાનો વધાર કરવું અને ભાત નાખી હલકે હાથે હલાવીને બાઉલમાં કાઢવું.



ચામગ્રી ભાત

સામગ્રી :- ચોખા, લાલ મરચા, હળવર, રાઈ, જુડુ, હિંગ, મીઠું, કોથમરી, કઢીપત્તો (મીઠો લીંબડો)

રીત :- ચોખાને કુકર અથવા છૂટા બાકી ભાત બનાવી અથવા ભાત વધી હોય તો એક કડાઈમાં તેલ નાખી રાઈ, જુડુ, હિંગ, કઢીપત્તો, કોથમરી નાખી ભાત છૂટા કરી વધારવી, હળવર, લાલ મરચો, ધાણા જરો નાખો.



કાંદા ભાત

સામગ્રી :- ચોખા, કાંદા, મીઠું, ધી, રાઈ, હિંગ

રીત :- ચોખા ઘોઇને થોડી વાર રાખી મૂકવા. બે ત્રણ કાંદા ઝીણા સમારવા અને ધીમાં અથવા તેલમાં રાઈ, હિંગનો વધાર કરી કાંદા નાખી ખૂબ લાલ થાય ત્યાં સુધી સાંતળવા. પછી ચોખા નાખી સાંતળવા, બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. બદામી રંગના થાય એટલે ગરમ પાણી નાખવું અને પ્રમાણસર મીઠું નાખવું અને ભાત થવા દેવો. જો આ ભાત લચકો થઈ જશો તો સારો નહિ લાગે. આ ભાતને ઓસાવવો નહિ. પાણી થોડું ઓછું નાખવું. આ ભાત વેલિટેબલ કરી અને શાકવાળી ટાળ સાથે ખાવાની ઘણી મજા આવે છે.



વટાણા ભાત

સામગ્રી :- ચોખા, વટાણા, ગાજર, કાજુના ટુકડા, કીસમીસ, મીઠું

રીત :- ચોખા ઘોઇને છૂટા રંધવા ને હંડા કરવા. વટાણાને ગાજરના ટુકડા કરી સોડા નાખી બાકવા. કાજુના ટુકડા ભાત રંધાય ત્યારે જ નાખી દેવા. કીસમીસ નાખી હોય તો કાજુની સાથે નાખી દેવા અને ગરમ કરવા એક તપેલીમાં નાખી કુકરમાં વરાળથી બાફવું અને સાથે પાપડ અને કઢીથી ખાવું અથવા ટોમેટો સુપ પણ ચાતે.



દાઢાંડા (દાઢાંડા પાંઠ)

સામગ્રી :- ચોખા, મીઠું, ધી, સોડા, બીરયાની ભસાલો, પનીર ટુકડા, કાજુ ટુકડા, ગાજર, ફિણસી, વટાણા, સીમલા મરચા, કાંદા, બેટોટા, બેબી કોરન્



રીત :- ચોખાને ઘોરી છુટા બાફી હંડા કરવા દેવા. ઉપર આપેલ બધું શાક સુધારી એક કડાઈમાં ધી મૂકી આ શાક વધારવું એમાં મીઠું ને સોડા નાખી રંધવું. શાક રંધાવા આવે ત્યારે બીરયાની ભસાલો નાખી ભાત નાખી હલકે હાથે હલાવવું અને દહી સાથે ખાવું. જૈન બનાવી હોય તો ફક્ત વટાણા, ફિણસી, સીમલા મરચી નાખવા.

દાઢાંડા (દાઢાંડા પાંઠ)

સામગ્રી :- ચોખા, મીઠું

રીત :- ચોખાને છુટા રંધીને બાફી અને હંડા કરવા અને બાઉલમાં નાખી કુકરમાં વરાળથી બાફી ને ગરમ ગરમ પીરસવું.



ખીચડી

દાઢાંડા ખીચડી

સામગ્રી :- તુવેરની દાળ, ચોખા, મીઠું, હળદર, કઢીપતો, ધી, રાઈ, જુડુ, હિંગ, તજ, લવિંગ, લાલ મરચું, કોથમરી



રીત :- એક વાટકી તુવેરની દાળ લેવી અને દોઢ વાડકી ચોખા લેવા. ગમે તો સરખું પ્રમાણ પણ લઈ શકાય. બને જુદી જુદી તપેલીમાં ધોવા, તુવેરની દાળ દિવેલવાળી હોય એટલે ચખ્યાઓ ભરી દાળ અને ચોખા ઓરવા ને બીજા ટોપ અથવા તપેલીમાં નાખી મીઠું નાખવું આમાં પ્રમાણસર પાણી નાખી એક રસ હલાવીને કુકરમાં ૫/૬ સીટી મસાલી. જેટલી માપ હોય એનાથી ત્રણ ગણું પાણી નાખી, દાખલા તરીકે એક વાટકી ખીચડી હોય તો ત્રણ વાટકી પાણી નાખવું.

છલટી દાળ ચોખા મીઠું (બાજુદા)

સામગ્રી :- મગની છલટી દાળ, ચોખા, મીઠું


રીત :- એક વાટકો છલટી દાળ અને એક વાટકો ચોખા લેવા બેઉને ભેગા કરી ધોવા ને માપસર પાણી નાખી મીઠું નાખી કુકરમાં ૫/૬ સીટી મરાવી. બે ત્રણ કલાક આગળ ભીજીવાની તો વધુ એકરસ થાય. એક વાટકો માપ હોય તો ત્રણ વાટકા પાણી નાખવું.



બાજુદા રસથાળ

સામગ્રી :- મોગરદાળ, ચોખા, મીઠું, કાંદા, બટેટા, ટમેટા, ગરમ મસાલો, હળદર, હિંગ, લાલ મરચું

રીત :- એક વાટકો મોગરદાળ અને એક વાટકો ચોખા બેઉં લઈ ધોવા ને એક કડાઈમાં થોડું તેલ નાંખી રાઈ, જીરું, હિંગ, કઢીપતો, કોથમરી, કાંદા, બટેટા, ટમેટા, ગરમ મસાલો અને મીઠું વધાર કરી દાળ, ચોખા નાખી બધું એક તપેલીમાં લેવું અને માપસર પાણી નાખવું. ૫/૬ સીટી મરાવી.



(બાજુદા) બાજુદા

સામગ્રી :- મગની છલટી દાળ, ચોખા, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા, જીરું

રીત :- એક વાટકો મગની છલટી દાળ અને ચોખા લેવા બેઉં સાથે ધોવા ને એક તપેલીમાં લઈ માપસર પાણી નાખી મીઠું અને ઉપર આપેલ મસાલો નાખવો. કુકરમાં ૫/૬ સીટી મરાવી એકરસ થાય એટલે ઘી નાખી આવું.



દાળ, કઢી

- દાળ, ટોકળી
- અડદ દાળ
- ઓસામણ લયકો
- તુવેર દાળ
- ત્રિભાગી દાળ
- કઢી
- ભર્ડાની કઢી
- વધારેલી છાસ
- છાસ



સામગ્રી :- તુવેર દાળ અડઘો વાટકો (૫ માણસો માટે) સીંગદાણા, લાલ મરચું, હળદર, મીઠું, ધાણા જુદું, ગોળ, કોકમ, તજ, લવિંગ, લીમડો, કોથમરી, ઘઉનો લોટ Minimum ૧૦ મોટી જાડી રોટલી



રીત :- તુવેરની દાળને ઘોઈને તેમાં પ્રમાણસર પાણી નાખી ફૂકરમાં બાફવા મૂકવી. દાળને તપેલીમાં કાઢી ઝેરણી ફેશવલી અને કડાઈમાં તેલ નાખી રાઈ, જુદું, તજ, લવિંગ, લીમડો, હળદરનો વધાર કરી બાફવી દાળ નાખી પ્રમાણસર પાણી નાખી દાળ તૈયાર કરવી એમાં સીંગદાણા અને ટમેટાના ટુકડા નાખવા અને ઉકળવું, ઘઉના લોટમાં હળદર, મીઠું, મોણ, લાલ મરચું નાખી લોટ બાંધવું ને મોટી મોટી રોટલી કરી ટુકડા કરી ઉકળતી દાળમાં નાખવું અને હલાવતા રહેવું. એક રસ થાય એટલે આખી કેસરોલમાં ૪/૫ કલાક રહે એમ એમાં કાઢી લેવી. જમવા બેસો ત્યારે દાળ ઢોકળી પીરસો ઊપર કાંદા, કેરીના નાના તુકડા, કોથમરી, લીંબુનો રસ અને ધી નાખી ખાવી ખૂબ ટેસ્ટી લાગે.



સામગ્રી :- અડદ દાળ અડઘો વાટકો (૫ માણસો માટે) મીઠું, લાલ મરચું, હળદર, ટમેટા - ૧, લસણા, કોથમરી



રીત :- અડદ દાળ ફૂકરમાં બાફવી અને રાઈ જીરાનો વધાર કરી આ દાળ વધારવી પ્રમાણસર પાણી નાખવું. મીઠું નાખવું, લાલ મરચું, હળદર, ધાણા જુદું, લસણા જરૂરત પર નાખવું હોય તો અને ટમેટાના ટુકડા નાખવા હોય તો અને કોથમરી ભભરાવી.



સામગ્રી :- તુવેરની દાળ (૫ માણસો માટે) પા વાટકી દાળ, તજ, લવિંગ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જુદું, ગોળ, આંબલી, ડોપરું



રીત :- તુવેરની દાળ ઘોઈ, એક તપેલીમાં પાણી નાખી દાળ બાફવી. દાળ બફાઈ જાય એટલે એક રસ કરવી. એક તપેલીમાં એક ચમચો ધી લઈ તેમાં તજ-લવિંગ નાખી દાળનું ઊપર પાણી વધારવું. તેમાં મીઠું, હળદર, મરચું, ધાણા જુદું ભૂકો, ગરમ મસાલો, આદુ મરચા અને ગોળ આંબલીનું પાણી નાખવું. બરોબર ઉકળે એટલે ઉતારી કોપરાનું ખમણ નાખવું.

લચકા રીત :- જાડી જે દાળ રહી હોય તેમાં મીઠું, હળદર અને હિંગ નાખી ગરમ કરી લચકો દાળ બનાવવી.

શ્રુતિ

સામગ્રી :- તુવેર દાળ પા વાટકો (૫ માણસો માટે) મીઠું, હીંગ, રાઈ, જીરું, હળદર, કોકમ, ગોડ, કઢીપતો, કોથમરી, ધાળા જીરો, ગ્રીન મરચો

રીત :- તુવેર દાળ કુકરમાં બાફવી. પછી બજાઈ જાય એટલે બોસ મશીન ફેરવી એમાં કોકમ, ગોડ, કઢીપતો, કોથમરી, ધાળા જીરો, ગ્રીન મરચો નાખી થોડું કડાઈમાં તેલ નાખી વધાર કરવું એમાં તેલ, જીરું, હીંગ, હળદર નાખવું પ્રમાણસર પાણી નાખી ઉકાળવી એટલે દાળ તૈયાર.



નિષ્ઠા

સામગ્રી :- છલટી દાળ અડધો વાટકી (૫ માણસો માટે) ચાણા દાળ અડધો વાટકી, તુવેર યા અડદ દાળ - પા વાટકી, કઢીપતો, મીઠું, ધાળા જીરું, હળદર, કોથમરી, લાલ મરચું



રીત :- છલટી દાળ, ચાણાદાળ, તુવેર યા અડદ દાળ નણે મિક્સ કરી ધોઈ ફૂકરમાં બાફવી. એક કડાઈમાં તેલ નાખી રાઈ જીરાનો વધાર કરી કઢીપતો નાખી દાળ વધારી દેવી. એરવી નહીં ઉપર આપેલ બધો મસાલો નાખવો, મીઠું નાખવું અને પીરસતી વખરો કોથમરી ભભરાવી. આ દાળ ભાત અને મીઠો ભાત લાપસી સાથે ખવાય.

સાંઘિક

સામગ્રી :- ૫ માણસો માટે ખાટી છાસ બે અઢી વાટકી, ચાણાનો લોટ, કઢીપતો, કોથમરી, સાકર, તજ-લવિંગ, મેથી, ચાનો મસાલો, મીઠું



રીત :- એક કડાઈમાં તેલ નાખી રાઈ, જીરું, મેથી, તજ-લવિંગ, કઢીપતો, કોથમરી નાખી ખાટી છાસ નાખવી એમાં ચાણાનો લોટ નાખી જેરવી ઉકળો એટલે સાકર, ચાનો મસાલો, મીઠું નાખવો. ચાખી લેવી ખાટી મીઠી છે કે નહીં.

ભીડા

સામગ્રી :- ભીડા, ખાટી છાસ બે વાટકી, ગોળ, ચાણાનો લોટ, હળદર, મીઠું



રીત :- ભીડાને ધોઈ કપડાથી કોરા કરવા. પછી તેના કટકા કરી તેલમાં રાઈ, હીંગ, જીરું વધાર કરી વધારવા. શાક તૈયાર થાય એટલે ખાટી છાસને વલોવી ચાણાનો લોટ મેળવી ભીડાના શાકમાં નાખવું. તેમાં મીઠું, હળદર, ગોળ નાંખી ઉકળો અને કઢી જાડી થાય એટલે ઉતારી લેવી.

છાસ રસ

સામગ્રી :- છાસ (મોળી), મીઠું, કઢીપતો, કોથમરી, પીસેલી ભરચા

રીત :- છાસમાં મીઠું નાખી ઝેરવી. વધારમાં રાઈ જીરું કઢીપતો અને પીસેલો ભરચો નાખવું અને છાસનું વધાર કરવું. ઉપર ઝીણી કોથમરી નાખવી.



દહી રસ (દહી રસ)

સામગ્રી :- દહી, જીરણું, જીરું, મીઠું

રીત :- દહીને વલોવી એટલે ઝેરણીથી ઝેરવી મીઠું નાખી છાય તૈયાર કરવી. જરા પતલી બનાવી એમાં જીરું અથવા જીરણું નાખી આપવું. હંડી છાય સરસ લાગે.



શાક

- બટેટાનું શાક (સ્કું)
- બટેટાનું રસવાળું શાક
- મૂળ ના પાનનું શાક
- કુર્કુરી ભીડા
- ફ્લાવરનું ભજ્યાવાળું શાક
- ફ્લાવરનું શાક
- કોબીનું કાચુંપાકું શાક
- કોબીનું લીલું શાક
- કોબીનું શાક
- ટમેટાનું સ્કું શાક
- સેવ-ટમેટાનું શાક
- કારેલા શીંગ શાક
- કારેલાનું શાક
- દૂધી દાળનું શાક
- ગુવારનું શાક
- વડીનું શાક
- પાપડ મેથીનું શાક
- કંટોલાનું શાક
- તાંદળની ભાજુનું ઢોકળીવાળું શાક
- તાંદળની ભાજુનું શાક
- ખાટિયો (મેથીની ભાજ)
- રીંગણાનું ભરથો
- ઉંઘીયો
- રીંગણા બટેટાનું શાક
- જૈન ગ્રીન ઉંઘીયું
- ટીંડોળાનું શાક
- ફ્લાવર વટાણા ગ્રીન શાક
- ડાંગરનું શાક
- થીભડાનું શાક
- સૂકી મેથીનું શાક
- તૂરીયાનું શાક
- સરગવજી શીંગનું શાક
- ગુંદે જો શાક (ગુંદાનું શાક)
- પાલક બટેટાનું શાક
- પાલક તુવેર દાળનું શાક
- કાચી કેરીનું શાક
- ફુગસીનું શાક
- શાકના સંભારિયા (યણાના લોટના)
- પાકા કેલાનું શાક
- પાકા કેલાનું ખારો શાક

- કાચા કેળાનું સૂકું શાક
 - કાચા કેળાનું તપોલું શાક
 - પરવળનું શાક
 - પરવળનું ભરેલું શાક
 - કાળી મોગરીનું શાક
 - લીલી મોગરીનું શાક
 - લીલા કાંદાનું શાક
 - કાંદા બટેટાનું શાક
 - ગ્રીન વટાણાનું શાક
 - બટેટા વટાણાનું શાક
 - વાલપાપડી ગટાનું શાક
 - કોઈમલેં જો શાક
 - પાપડનું શાક
 - ભરેલા મરચા
 - બટેટાનું ગ્રીન શાક
 - બેસનના ગઢુાનું શાક
-

૩૧૫

દાઢું કા

સામગ્રી :- બટેટા, હળદર, મીઠું, કોથમરી, રાઈ જીરું, કોપરું
રીત :- બટેટાને બાફવા. બટેટાના છલટા કાઢી નાના ટુકડા કરવા ને કડાઈમાં વધાર કરવું વધારમાં રાઈ, જીરું, હળદર, કોથમરી ઝીણી સુધારેલી નાખી બટેટાના ટુકડા નાખવા ને મીઠું ભભેરવું ને હલકે હાથે હલાવવું. ઉપર કોપરું નાખવું.



દાઢું ચાંદું કા

સામગ્રી :- બટેટા, હળદર, મીઠું, લાલ મરચું, ધાણા, જીરું, ટમેટો, ગરમ મસાલો, કોથમરી, લસણા

રીત :- બટેટાને બાફવા. બટેટાના છલટા કાઢી મોટા ટુકડા કરવા ને કડાઈમાં વધાર કરવું, વધારમાં રાઈ, જીરું, કદ્દીપતો, હળદર નાખવું અને બટેટાના ટુકડા નાખવા ઉપર મીઠું અને ઉપર આપેલ મસાલા નાખવા ને પ્રમાણાસર પાણી નાખવું અને રસ ઘણું જોઈએ તો ચણાનો લોટ થોડા પાણીમાં ઓગળી નાખવું. લસણાની પેસ્ટ નાખવી અને કોથમરી નાખી પીરસવું.



(કૂ) કૂંઠ કાંઠ કાંઠું કા

સામગ્રી :- મૂળાના પાન, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા, જીરું, ચણાનો લોટ

રીત :- મૂળાના પાનને ઘોઈ સુધારી મીઠું નાખી ભૂસવું અને થોડીક વાર રાખી દેવું. પછી ડાખી ડાખીને પાણી કાઢી લેવું. એક વાસણામાં તેલનો વધાર કરી એમાં રાઈ, જીરું નાંખી આ પાન નાખવા ઉપર બધો મસાલો નાખવો અને હલાવવું. આ શાક બાજરાના રોટલા આગળ સારું લાગે. આમા ચણાનો લોટ નાખીને હલાવીએ તો મૂળાના પાનનું લોટવાણું શાક થઈ જાય.



કુંઠ કાંઠ

સામગ્રી :- કુણા ભીડા, લાલ મરચું, જરાનો ભૂફો, ચાટ મસાલો, આમચૂર મસાલો, મીઠું, તેલ

રીત :- કુણા ભીડા ઘોઈને લૂછવા. તેની ઊભી પાતળી ચીરીઓ કાપવી. એક વાસણમાં તેલ મૂકવું. તેલ વધારે ગરમ થાય ત્યારે ભીડાની ચીરીઓ નાખવી અને કડક થાય ત્યાં સુધી તળવી. વધારાનું તેલ ભીડામાંથી નીકળી જાય એ રીતે ભીડાને તેલમાંથી કાઢી લેવા. ભીડામાં મરચું, જરાનો ભૂફો, ચાટ મસાલો, આમચૂરનો ભૂફો અને મીઠું નાખી બરાબર હલાવવું.



ફલાવર રસથાળ રૂપ

સામગ્રી :- ફલાવર, ટેમેટો, ચાણાનો લોટ, તલ, તજ, લવિંગ, સાકર, લાલ મરચું, કોથમરી, મીઠું

રીત :- ટમેટાને પાણીમાં વરાળથી બાફી નાખવા પછી એના છલટા ઉતારી ટમેટાને બોસમા ફેરવી સૂપ જેવું પાતળું કરવું અને રાઈ, જીરું અને તલનો વધાર કરી ટમેટાનો રસ વધારવું અને લાલ મરચું અને ગોળ અથવા સાકર નાખવું અને ચાણાના લોટમા મીઠું, હળદર, લાલ મરચું, ખીરું બનાવી ફલાવરના ભજ્યા બનાવવા. જારે જમવા બેસીએ ત્યારે બાઉલમા ટમેટાનો રસ નાખી બધા ભજ્યા નાખવા ને ગરમ ગરમ પીરસવું ઉપર કોથમરી લભરાવી.



ફલાવર રસ

સામગ્રી :- ફલાવર, મીઠું, રાઈ, જીરું, હિંગ, હળદર, લાલ મરચા, ઘાણા, જીરું, ટમેટો

રીત :- ફલાવરને થોડા ગરમ પાણીમા સહેજ મીઠું નાખી ફલાવરના ટુકડા નાખવા એટલે ઈથળ રહેવાનો સંભલ રહે નહિ. તપેલીમાં તેલ, રાઈ, હિંગ, મરચાનો વધાર કરી ફલાવર વધારી દેવું અને પ્રમાણસર મીઠું, હળદર નાખી ચડવા દેવું. ચડી જાય એટલે ઘાણા જીરા અને વાટેલા આદુ મરચા, સુકી મરચાની ભૂકી નાખી થોડી વાર સીજવા દેવું અને ટમેટાના ટુકડા નાખવા અને કોથમરી નાખવી. આ શાકમાં વટાણા પણ નાખી શકીએ.



ફલાવર રસથાળ રૂપ

સામગ્રી :- કોબી, આદુ, મરચું, લીંબુ, ખાંડ, મીઠું

રીત :- કોબી સરસ ઝીણી સમારવી. તેમાં પહેલેથી જ મીઠું વાટેલા આદુ, મરચા, ખાંડ, લીંબુ નીચોવી નાખવું. પછી થોડું તેલ મૂકી રાઈ, હિંગ, લીલા મરચાનો વધાર કરી કોબી વધારી દેવી અને સહેજ વરાળ નીકળવા માડે કે ઉતારી લેવી.



ફલાવર રસથાળ રૂપ

સામગ્રી :- કોબી, મીઠું, ચાપટી ખારો, રાઈ, જીરું, હિંગ

રીત :- કોબીનું શાક લીંબું રાખવું હોય તો ચાપટી ખારો નાખવો અને રાઈ, જીરુનો વધાર કરવું અને કોથમરી નાખવી.



બાજું રાણી

સામગ્રી :- કોબી, મીઠું, હળદર, સૂકી મરચી, ધાણા, જીરું, કોથમરી

રીત :- કોબી સમારીને ઘોવી નહિ કારણ પાણીવાળી થાય તો શાકમાં પણ પાણી છૂટે અને શાક પોચું થાય. તપેલીમાં થોડું તેલ મૂકી રાઈ, હિંગ, મરચાનો વધાર કરી કોબી વધારી દેવી. તેમાં પ્રમાણાસર મીઠું, ચપટી હળદર, ધાણા, જીરું, સૂકી મરચાની ભૂકી અથવા વાટેલા આદુ મરચા અને સાકર નાખી ધીમા તાપે ચડવા દેવી. રથી જાય પણી કોથમરી નાખવી.



ટેટાં કૂં રાણી

સામગ્રી :- ટમેટા, મીઠું, હિંગ, હળદર, ધાણા, જીરું, સુકૂં મરચું, કોપરું, કોથમીર

રીત :- ટમેટાને ઘોઇને તેના ચાર કે છ અથવા આઠ ટુકડા કરવા. પેણીમાં તેલ, રાઈ, હિંગનો વધાર કરી ટુકડા વધારી દેવા અને એ સોસવાઈ જાય એટલે તે પ્રમાણે મીઠું, ચપટી હળદર, ધાણાજીરું, સુકૂં મરચું અથવા વાટેલા આદુ મરચા, ખાંડ નાખવી અને ચડવા દેવું. ચડી જાય એટલે કોપરું, કોથમીર નાખવું.



લાલ-ટેટાં રાણી

સામગ્રી :- લાલ ટમેટા, જીરું, હળદર, ધાણા જીરું, જાડી સેવ, તેલ, લાલ મરચું, ગોળ, ગરમ મસાલો, મીઠું

રીત :- ટમેટાના મોટા ટુકડા કરવા, એક વાસણમાં તેલ મૂકી તેમાં જીરું નાખી, જીરું તત્તે એટલે ટમેટા નાખવા. બધો મસાલો નાખવો. થોડું પાણી નાખવું. ઉકળે એટલે સેવ નાખી ગરમ ગરમ પીસરવું.



કારેલા રાણી

સામગ્રી :- કારેલા, શરીંગ, મીઠું, લાલ મરચું, ધાણા જીરું, તેલ

રીત :- કારેલાને છોલીને સીધું એક કડાઈમાં તેલ નાખી ગરમ કરવું અને ગોળ ગોળ સુધારીને કડાઈમાં તળવા કડક થાય એટલે એક ડબ્બામાં રાખવા શરીંગને તળવા પણી બેઠિ મીક્સ કરી એમાં મીઠું લાલ મરચું, ધાણા જીરું, હળદર નાખી લેળવવું. આ શાક ૮/૧૦ દિવસ બગડે નહીં. એર ટાઈટ ડબ્બામાં મૂકવું. આમાં કાજુના ટુકડા તળીને નાખવા.



બાજું ગોળા

સામગ્રી :- કારેલા, ખાટી છાસ, મીઠું, કાજુ, કિસમિસ, હળદર, ગોળ, લાલ મરચું, ધાણા જીરું

રીત :- કારેલાને છોલી ગોળ ગોળ સુધારવું અને ખાટી છાસ અને મીઠું નાખી ભૂસી રાખવું. એકાદ કલાક પછી કારેલાને ડાબી ડાબીને રસ કાઢવું અને એક કડાઈમા તેલનો વધાર કરી એમા રાઈ, જીરું, કાજુના ટુકડા, કિસમિસ અને કારેલાને ગોળ નાખી રાંધવું. ઉપર પાણીવાળી થાળી રાખવી. કારેલો ગળી જાય એટલે એમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું નાખી હલકે હાથે હલાવવું.



બાજું ચાણાદાળ

સામગ્રી :- દૂધી, ચાણાદાળ, ટમેટું, મીઠું, ગોળ, લાલ મરચું, હળદર, ધાણાજીરું

રીત :- દૂધી અને ચાણાદાળને કુકરમાં બાફવી. દૂધીના ટુકડા કરવા અને થોડું પાણી નાખવું. એક કડાઈમા તેલનો વધાર કરી એમાં રાઈ, જીરું, હળદર, દૂધીદાળ નાખવી. ગોળ નાખવું. ટમેટાના ટુકડા નાખવા અને મસાલા નાખવા અને ચાણાનો લોટ થાડક પાણીમા ઓગળીને શાકમા નાખવું એટલે રસ ઘણું થાય. કઢીપતો અને કોથમરી નાખવી.



બાજું તેલ

સામગ્રી :- ગુવાર, મીઠું, તેલ, ગોળ, અજમો, લાલ મરચું, હળદર, ધાણાજીરું

રીત :- ગુવારને સુધારી ધોઈને કુકરમાં બાફવી. પછી બફાઈ જાય એટલે ચાળગુણીથી પાણી કાઢી નાખવું. એક કડાઈમાં તેલ બે ચમચી નાખી અજમાનો વધાર કરવું. એમાં ગુવાર નાખી પ્રમાણસર પાણી નાખી ઉપર આપેલ મસાલા નાખવા, ગોળ નાખવું. આ શાક ભીચડી અને બાજરના રોટલા આગળ સારું લાગે.



બાજું લીંબુ

સામગ્રી :- વડી, લાલ મરચું, ધાણા જીરું, લીંબુ, હળદર, ખાંડ, મીઠું

રીત :- એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં વડી મૂકી ગુલાબી શેકવી. પછી તેમાં ૧ કપ પાણી નાખી ધીમા તાપે ચડવા દેવી. બહુ ચઠી ન જાય તેનું ધ્યાન રાખવું. તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું ખાંડ અને લીંબુ નાખવા પાચ મિનિટ ગેસ પર રાખી નીચે ઉતારી લેવું અને તરત જ પીરસવું. વડીમાં મીઠું હોય જ છે તેથી મીઠું ઓછું નાખવું.



બાજુલાંદું વાણી

સામગ્રી :- સ્કૂડી મેથી, હિંગ, મીઠું, મરચું, તેલ, ઘાણા જું, હળદર, પાપડ, આમચૂર પાવડર, ગરમ મસાલો, ગોળ



રીત :- મેથીને ૧ કલાક પાણીમાં પલાળી આ જ પાણીમાં બાફવા મૂક્યી. પછી બધું પાણી નિતારી નાખવું એક વાસણમાં તેલ ગરમ મૂકી હિંગ નાખી હળદર, મરચું નાખી ઉપર પાણી વધારવું. તેમા મીઠું ગોળ ઘાણા જું નાખવા. પાણી ઉકળે એટલે તેમાં પાપડના ટુકડા કરીને નાખવા મેથી નાખવી. આમચૂરનો ભૂંકો અને ગરમ મસાલો નાખી બસાબર હલાવી ગરમ ગરમ પીરસવું.

બાજુલાંદું વાણી

સામગ્રી :- કંટોલા, મીઠું, ગોળ, સાકર, લાલ મરચું, હળદર, ઘાણા જું



રીત :- કંટોલાને ગોળ ગોળ સુધારીને ધોઈને વધારવું. એક કડાઈમાં તેલ લઈ એમાં રાઈ, જું, હળદર નાખી કંટોલા નાખવા એમા સાકર અથવા ગોળ નાખવું અને મીઠું નાખવું અને કડાઈ ઉપર થાળી મૂકી પાણી રાખવું. ધીમા તાપે રંધવું એમા ઉપર આપેલ મસાલા નાખવા.

બાજુલાંદું વાણી

સામગ્રી :- તાંદળની ભાજી, મીઠું, લાલ મરચું, હળદર, ઘાણાજું, બાજરાનો લોટ, મોળા

રીત :- તાંદળની ભાજીને સુધારી ધોઈને વધારવી. એમાં મીઠું, લાલ મરચું, હળદર, ઘાણા જું, પાણી સરખું નાખવું. બાજરાના લોટમા ઉપર આપેલ મસાલો નાખી લોટ બાંધવું અને નાની નાની ઢોકળી વાળવી શાક રંધાઈ જય એટલે એમા ઢોકળી નાખીને રંધવી. એમા ધી અને લિંબુનો રસ નાખી ખાવું.

બાજુલાંદું વાણી

સામગ્રી :- તાંદળની ભાજી, મીઠું, હળદર, લાલ મરચું, ઘાણા જું, ટમેટા



રીત :- તાંદળની ભાજીને સુધારી ધોઈને રાખવી પછી એક વાસણમાં તેલનો વધાર કરવું એમાં રાઈ જું હળદર નાખી ભાજી નાખીને પાણી નાખવું એમા ટમેટાના ટુકડા નાખવા એમાં મીઠું નાખવું. લાલ મરચું, ઘાણા જું નાખવું. લસણ પેસ્ટ નાખવી હોય તો નાખી શકાય.

દાઢા (દાઢાના પણા)

સામગ્રી :- લીલી મેથીની ભાજ, ખાટી છાસ, ચણાનો લોટ, ગોળ, હળદર, મીઠું, પીસેલા મરચા

રીત :- મેથીની ભાજને સુધારીને ઘોઇને રાખવી. એક તપેલીમાં ખાટી છાસ અને ચણાનો લોટ નાખી ગરણીથી ગાળી લેવું. એક કડાઈમાં તેલનો વધાર કરવું એમાં રાઈ જીરું હળદર નાખી ઉપર મેથીની ભાજ નાખી ઉપર લોટવાળી છાસ નાખી, ગોળ નાખી મીઠું નાખી એક સરખું હલાવતા રહેવું એક રસ શાક થઈ જાય પછી ગરમ ગરમ ખાવું અને કરણીમાં (ખાટિયો) કહીએ છીએ.



દાઢાના પણા

સામગ્રી :- રીંગણા, કાંદા, ટમેટો, લસણ, ગરમ મસાલો, લાલ મરચો, ધાણા જીરો

રીત :- રીંગણાને ઘોઇને ટુકડા કરી કુકરમાં બાફવા. ટુકડા ધ્યાનથી કરવા ક્યા ઈયણ છે કે નહિ. કાંદા અને ટમેટોના બારીક ટુકડા કરવા. એક કડાઈમાં તેલ સરખું લઈ રાઈ, જીરું, હળદર, લાલ મરચા, લસણની પેસ્ટ નાખી વધાર કરવું એમાં કાંદા ટમેટોના ટુકડા સાંતળવા રંધાઈ જાય ત્યારે એમાં રીંગણાના ટુકડા નાખી દેવા પછી મીઠું સાકર અને ગરમ મસાલો નાખવો અને ચમચાથી હલાવવું એકરસ થઈ જાય એટલે શાક તૈયાર.



દાઢાના પણા

સામગ્રી :- ગ્રીન શાક, કાચા કેળા, મેથી, સાકર, લીંબુ, ગરમ મસાલો, લાલ મરચો, ટમેટો, મીઠું, ખાવાનો સોડા, કોથમરી, કોપું



રીત :- ગ્રીન શાક બધા મીક્સ લેવા (અડધો કિલો યા કિલો) બધા ઘોઇ મોટા ટુકડા કરી સુધારવું. એમા વટાણા અને કાચા કેળા નાખવા. મેથીની ભાજ સુધારી એમાં ચણાના લોટ નાંખવો. સાકર, લીંબુ, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું, મોણ વધુ નાખી ગોળ બોલ નાના નાના બનાવી ધીમા તાપે તળવા અને સાઈડ મા રાખવા. મોટા કડાઈમાં તેલનો વધાર કરી એમાં આજમા નાખી બધો શાક વધારવા એમાં મીઠું અને ખાવાના સોડા નાખી ઉપર પાણીની થાળી રાખવી. શાક રંધાઈ જાય એટલે એમા મેથીના ગણા, ઉપર આપેલ મસાલો નાખવો અને હલકે હાથે હલાવવું ઉપર કોથમરી અને કોપુંના નાખી પીરસવું. જેને જે શાક લેવા હોય તે લઈ શકાય.

બાજુદાં | બાજુદાં રસ

સામગ્રી :- રીંગાણા, બટેટા, ટ્યેટા, શીંગનો ભૂકો, મીઠું, હિંગ, સાકર, હળદર, લાલ મરચું, ઘાણા જુડું, કોથમરી, કોપરું, લસણ

રીત :- રીંગાણા અને બટેટાને બાફવા અને નાના ટુકડા કરવા. એક કડાઈમાં તેલનો વધાર કરવો. એમાં રાઈ, જુડું, હિંગ, હળદર, લાલ મરચું, લસણ નાખી ટ્યેટા વધારવા અને રીંગાણા બટેટાના ટુકડા નાખવા અને પ્રમાણસર પાણી નાખવું અને શીંગનો ભૂકો નાખવું અને ઉપર આપેલ બધો મસાલો નાખી રસો ઘણું કરવું.



શાક પણા | શાક પણા રસ

સામગ્રી :- ગ્રીન શાક, કાચા કેળા, મેથી, સાકર, લીંબુ, ગરમ મસાલો, લાલ મરચો, ટ્યેટા, મીઠું, ખાવાના સોડા, કોથમરી, કોપરું, લીલા મરચા

રીત :- ઉંઘીયાની ઉપર રેસીપી આપેલ છે બધું લઈ લે ફક્ત લાલ મરચાને બદલે એમાં કોથમરીની ગ્રીન ચટની બનાવીને નાખવી એટલે જેન ગ્રીન ઉંઘીયો થઈ જાય.



એમાં કાચા કેળાને બદલે કાંદા બટેટા પણ નાખી શકાય. શાક પોતાના મન ઉપર છે જેને જે શાક નાખવા હોય તે નાખી શકાય.

ટીડોળા | (ટીડોળા) રસ

સામગ્રી :- ટીડોળા, મીઠું, ખાવાનો સોડા, સાકર, હળદર, લાલ મરચું, ઘાણા જુડું, કોથમરી, કોપરું

રીત :- ટીડોળાને લાંબી ચીરી કરી ધોઈને પાણી નીતારી લેવી. પાણી નીતરી જાય એટલે ટીડોળા ઉપર મીઠું અને પ્રમાણસર સોડા નાખવું. એક કડાઈમાં તેલ સરખું નાખવું. એમાં રાઈ, જુડું અને ટીડોળાનો વધાર કરવો ઉપર થાળી રાખી પાણી નાખવું. ૫ મિનિટમાં શાક રધાઈ જાય એટલે એમાં સાકર હળદર, લાલ મરચું, ઘાણા જુડું નાખી હલાબવું. ઉપર કોથમરી અને કોપરું ભભેરવું.



દાંગર વાણી રસથાળ

સામગ્રી :- ફ્લાવર, વટાણા, ગાજર, ફણસી, કોથમરી, કોપરું, ગરમ મસાલો, સોડા

રીત :- ફ્લાવરને ધોઈ સુધારી કટક કરવા, ગાજર, વટાણા અને ફણસીને બારીક સુધારી બધા સોડામાં બાફવા. પછી ધીનો બધાર કરવો એમાં ગરમ મસાલો નાખવો અને ગ્રીન ચટણી કોથમરી કોપરાની સાંતળવી અને શાક નાખવા અને પ્રમાણસર પાણી નાખવું. સાકરને મીઠું માપસર નાખવું અને રસ ન પટલો અને ન ઘટ રહે તે જોવું.



દાંગર વાણી (દાંગર)

સામગ્રી :- દાંગર, મીઠું, લાલ મરચું, હળદર, ઘાણા જીરું

રીત :- દાંગરને છોલી ટુકડા કરવા અને તેલનો બધાર કરી એમાં મીઠું નાખી જરા ચડવા દેવા થાંડું પાણી નાખવું ટુકડા બફાઈ જાય એટલે મસાલા નાખવા.



દાંગર વાણી સાકર

સામગ્રી :- પાકો ચીલડો, તેલ, મીઠું, લાલ મરચું, હળદર, ઘાણા જીરું, સાકર

રીત :- ચીલડો લઈ છોલીને ટુકડા કરવા અને તેલનો બધાર કરી એમાં ટુકડા નાખવા અને પાણી નાખી રાંધવું અને રંધાઈ જાય. એટલે એમાં મીઠું, સાકર અને મસાલા નાખવા. આ શાક બાજરાના રોટલા સાથે સારું લાગે.

દાંગર વાણી સાકર

સામગ્રી :- સુકી મેથી, હિંગ, મીઠું, લાલ મરચું, હળદર, ઘાણા જીરું, ચાણાનો લોટ, તેલ

રીત :- મેથીને ૨ થી ૩ કલાક પલાળી રાખવી. મેથીમાં જરૂરી પાણી નાખી બાફવા મૂકવી બફાયેતી મેથીમાં પાણી હોય તો નિતારી લેવું. એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ નાખી, ચાણાનો લોટ નાખવો. મીઠું મરચું હળદર અને ઘાણા જીરું નાખવા. લોટને ધીમા તાપે શેકાવા દેવો. તેમાં બાકેલી મેથી નાખવી બરાબર હલાવી ઢાંકીને ધીમા તાપે ૧૦ મિનિટ થવા દેવું.





સામગ્રી :- તૂરિયા, ગોળ, મીઠું, હળદર, લાલ ભરચું, ઘાણા જીરું
રીત :- તૂરિયા ચાખીને લેવા. એના છલટા છોલી ટકડા કરવા. એક કડાઈમાં તેલનો વધાર કરી એમાં રાઈ, જીરું, હળદર નાખી. તૂરિયાના કટકા નાખી પ્રમાણસર પાણી નાખી ચડવા દેવા એમાં ગોળ, લાલ ભરચા, ઘાણા, જીરું નાખવું.



સામગ્રી :- સરગવ શીંગ, ચાણાનો લોટ, ગોળ, મીઠું, હળદર, ખાટી છાશ.

રીત :- સરગવની શીંગ છોલીને પાણીમાં બાફવી. ખાટી છાસમાં ચાણાનો લોટ નાખી જેરવી જરા ઘટ કરવું. એમાં ગોળ, મીઠું, હળદર નાખવું ઉકળવા માટે એટલે એમાં બાફેલી સરગવનીશીંગ નાખવી.



સામગ્રી :- ગુંડા, ચાણાનો લોટ, મીઠું, હળદર, લાલ ભરચા, ગરમ મસાલો, ઘાણા, જીરું

રીત :- ગુંડાને અડધા કાપીને બી કાઢવા. એક થાળીમાં ચાણાનો લોટ, એમાં મીઠું હળદર, લાલ ભરચા, ગરમ મસાલો, ઘાણા, જીરું, મોડા નાખી હલકે હાથે ભેરવું અને ગુંડામાં ભરવું અને પછી ચારણીમાં બાફવા મૂકવા. બફાઈ જાય એટલે વધારવાને ઉપર ચાણાનો લોટ ભલેરવું.



સામગ્રી :- પાલકની ભાજ, બટેટા, હળદર, ઘાણા, જીરું, ગરમ મસાલો, લાલ ભરચું.

રીત :- પાલકની ભાજને ગરમ પાણીમાં છૂટી બાફવીને મીક્સરમાં પીસવી બાફકા બટેટાના ટકડા કરવા. એક કડાઈમાં તેલ નાખી રાઈ જીરુંનો વધાર કરી એમાં પીસેલી પાલક નાખવી. બટેટાના ટકડા નાખવા હળદર મીઠું, ઘાણા, જીરું, ગરમ મસાલો અને લાલ ભરચું નાખવું. પ્રમાણસર સાકર નાખવી અને પાણી નાખવું ન ઘટ અને ન પાતળો રસ થાય તે જોવું.



દૂષિત પૂર્ણાંગનું રાખ

સામગ્રી :- પાલકની ભાજી, તૂવેરદાળ, હળદર, મીઠું, લસણા, લાલ મરચું, ટ્રેટા

રીત :- પાલકની ભાજીને સુધારવી અને એક કડાઈમાં તેલ નાખી. રાઈ, જીરું, હળદર નાખી. લસણાની પેસ્ટ નાખવી. પાલક વધારવી અને તૂવેરદાળ નાખવી જરૂરત પડે પાણી નાખવું મીઠું, લાલ મરચું, ઘાણા, જીરું, ગરમ મસાલો નાખવો અને નાના નાના ટ્રેટાના ટુકડા નાખવા.



દૂષિત પૂર્ણાંગનું રાખ

સામગ્રી :- કાચી ડેરી, ગોળ, મીઠું, આખા ઘાણા, લાલ મરચો, હળદર

રીત :- કાચી ડેરી છોલીને કટકા ચારણીમાં બાફવા મૂકવો અને બફાઈ જય એટલે એક કડાઈમાં તેલનો વધાર મૂકવો. એમાં તજલાવિંગ નાખવાને ડેરીના ટુકડા નાખી પ્રમાણસર પાણી નાખી ગોળ નાખવું, મીઠું, લાલ મરચા, હળદર અને આખા ઘાણા નાખી હલાવવું.



દૂષિત પૂર્ણાંગનું રાખ

સામગ્રી :- ફણસી, મીઠું, સોડા, હળદર, લાલ મરચું, ઘાણા, જીરું

રીત :- ફણસી જીઝી સુધારવી અને તેલનો વધાર કરવું. એમાં રાઈ, જીરું નાખી સુધારેલી ફણસી નાખવી, સોડા અને મીઠું નાખી ધીમા તાપે ઉપર થાળી રાખી પાણી નાખી મૂકવું પાચ સાત મૌનિટમાં રંધાઈ જય એટલે ઉપર આપેલ બધા મસાલા નાખવા. એમાં ટ્રેટાના ટુકડા નાખવા હોય તો નખાય, બાફેલા બેટેટાની ટુકડા નાખવા હોય તો નખાય.



દૂષિત પૂર્ણાંગનું રાખ (દૂષિત રાખ)

સામગ્રી :- સીમલા મરચાં, લીંડા, બેટેટા, કાંદા, રીંગણા, ચણાનો લોટ, હળદર, લાલ મરચું, મીઠું, સાકર, લીંબુ, મોણ, શીંગનો ભૂકો, કોથમરી, કોપરું

રીત :- ચણાનો લોટ લેવો. એમાં મીઠું, સાકર, લીંબુ, મોણ, હળદર, લાલ મરચું, ઘાણા, જીરું, શીંગનો ભૂકો, કોપરું, કોથમરી બધું ભેરવી અને ઉપર આપેલ શાકમાં ભરવું અને પછી બાફવા અને તેલમાં રાઈ જીરું અને તલ અને કાશ્મીરી મીરચી નાખી વધારવું અને ઉપર લોટ ભલશાવું.



બાજુદાંના ટુકડા

સામગ્રી :- પાકા કેલા (ગરેલા), સાકર, ધી, એલચીનો ભૂંકો

રીત :- પાકા કેલાના ટુકડા કરવા. એક કડાઈમાં ધી નાખી કેલાના ટુકડા નાખવા. સાકર નાખવી અને એલચીનો ભૂંકો નાખી હલાવવી.



બાજુદાંના ટુકડાંના માંદા

સામગ્રી :- પાકા કેલા, મીઠું, લાલ મરચું, હળદર, ઘાણા, જીરું, સાકર

રીત :- પાકા કેલાના ટુકડા કરવા એના ઉપર આપેલ મસાલો નાખવો, સાકર, મીઠું નાખવું અને એક કડાઈમાં તેલ નાંખી વધાર કરવું. રાઈ જીરાથી અને પ્રમાણસર પાણી નાખવું અને રધાઈ જાય એટલે બાઉલમાં કાઢી લેવું.



કાચા કેળાના ટુકડા

સામગ્રી :- કાચા કેળા, મીઠું, સાકર, હળદર, લાલ મરચું, ઘાણાજીરું, લીંબુ, કોથમરી, કોપરું

રીત :- કાચા કેળાને બાફવા ફૂકરમાં પછી હંડા થાય એટલે છલટા કાઢી ટુકડા કરવા. તેલમાં વધાર કરવું. રાઈ જીરું, કદીપતો, તલ નાખી કેળાના ટુકડા નાખવા ઉપર આપેલ બધી સામગ્રી નાખી હલાવવું અને કોપરું અને કોથમરી ભંભેરવી.



કાચા કેળાના ટુકડાંના માંદા

સામગ્રી :- કાચા કેળા, મીઠું, હળદર, લાલ મરચું, ઘાણા જીરું, કોથમરી

રીત :- કાચા કેળા છોલીને ટુકડા કરી તળવા અને એક થાળીમાં રાખવા એની ઉપર મીઠું, હળદર, લાલ મરચું, ઘાણાજીરું અને કોથમરી નાખી હલાવવું અને ખાવા વાપરવું.

બાજુદાંના ગોળા

સામગ્રી :- પરવળ, મીઠું, સાકર, હળદર, લાલ મરચું, ઘાણાજીરું

રીત :- પરવળને ધોઈ છોલી છલટા કાઢવા અને લાંબી અથવા ગોળ ગોળ રીંગ સુધારવી અને એક કડાઈમાં તેલનો વધાર કરી એમાં રાઈ, જીરું નાખવું. હળદર નાખવું અને શાક વધારવું ઉપર મીઠું, સાકર નાખી રધવા હેવું રધાઈ જાય એટલે ઉપર આપેલ બધા મસાલા નાખવા.



બાંદું પાંદું રાંદું

સામગ્રી :- પરવળ, પૌંચા, ચણાનો લોટ, મીઠું, સાકર, લીંબુ, હળદર, લાલ ભરચુ, ઘાણાજું, કોથમરી

રીત :- પરવળ છોલી વચ્ચેમાંથી ફાડીયા પાડી પૌંચાનો મસાલો ભસાલો ભરવો. પૌંચામાં ઉપર આપેલ બધા મસાલો નાખવો અને પરવળ બાફવા મૂકુવી અને બફાઈ જાય એટલે વધારવું ઉપર કોપરું, કોથમરી ભલેરવી.



બાંદું પાંદું રાંદું

સામગ્રી :- કાળી મોગરી, મીઠું, સાકર, હળદર, લાલ ભરચુ, ઘાણાજું

રીત :- કાળી મોગરીને ધોઈ જાણી સુધારવી અને તેલનો વધારવું એમાં રાઈ, જુરું નાખી. મોગરી વધારવી રંધાઈ જાય એટલે એમાં મીઠું હળદર લાલ ભરચુ અને ઘાણાજું નાખવું અને સાકર નાખવી પછી જમવા બેસો ત્યારે ગરમ કરી, ઉપર લીંબુ નાખી ખાવું.



બાંદું પાંદું રાંદું

સામગ્રી :- લીલી મોગરી, મીઠું, લાલ ભરચું, હળદર, ઘાણાજું

રીત :- લીલી મોગરી ધોઈને મોટા ટુકડા કરવા. એક કડાઈમાં તેલ લઈ રાઈ, જીરનો વધાર કરવો. એમાં હળદર, લાલ ભરચુ, ઘાણાજું અને મોગરી નાખી કાચુ પાંડું શાક બનાવવું.



બાંદું પાંદું રાંદું

સામગ્રી :- લીલા કાંદા પાનવાળા, મીઠું, હળદર, લાલ ભરચુ, ઘાણાજું

રીત :- લીલા કાંદા પાનવાળા લઈ ધોઈને કોરા કરી, જીણા સુધારવા. એક કડાઈમાં તેલ નાખી રાઈ, જુરુંનું વધાર કરી એમાં સુધારેલા કાંદા નાખવાને ઉપર આપેલ મસાલો નાખવો અને તે ખીચડી સાથે સારું લાગે.



લાલ પાંદું રસ

સામગ્રી :- કાંદા, બટેરા, મીઠું, લાલ ભરચું, હળદર, ધાળાજીરું, ટમેંઝ

રીત :- કાંદા અને બટેરા સુધારવા અને તેલનું વધાર મૂકવું. એમાં રાઈ, જીરું, હળદર, મીઠું નાખી. કાંદા બટેરાના ટુકડા નાખવા અને પ્રમાણસર પાણી નાખી રાંધવા દેવા પછી ઉપર આપેલ બદ્ધો મસાલો નાખવો ટમેટાના ટુકડા નાખવા અને ઘટ રસવાળો શાક બનાવવું.



લાલ પાંદું રસ

સામગ્રી :- વટાણા, જીરું, મીઠું

રીત :- વટાણા સોડા નાખી બાફવા પછી એક કડાઈમાં તેલ નાખી રાઈ, જીરું નાખી. વટાણા વધારવા ઉપર મીઠું અને મસાલો નાખવો. કોથમરી ભલેરવી.



લાલ પાંદું રસ

સામગ્રી :- બટેરા, વટાણા, મીઠું, ટમેટા, હળદર, લાલ ભરચું, ધાળાજીરું, સાકર, ગરમ મસાલો

રીત :- વટાણા, બટેરાને બાઝી નાખવા એના ટુકડા કરવા અને એક કડાઈમાં તેલ નાખી રાઈ, જીરાનો વધાર કરી હળદર નાખી વટાણા, બટેરા અને ટમેટાના ટુકડા નાખવા અને પાણી નાખવું અને ઉપર આપેલ મસાલો નાખવો. રસો ઘંટ કરવું પતલો રસ હોય તો ચણાના લોટમા પાણી ઓગળી શાકમાં નાખવું અને કોથમરી નાખવી.



લાલ પાંદું રસ

સામગ્રી :- વાલ પાપડી, ચણાનો લોટ, હળદર, મીઠું, લાલ ભરચું, ધાળાજીરું, મોણ

રીત :- વાલ પાપડી લઈ બે ટુકડા સુધારીને ઘોઇને વધારવી. એક કડાઈમાં તેલ નાખી રાઈ, જીરું નાંખી વાલપાપડી નાખી, પાણી નાખી, ચડવા દેવી અને ચણાનો લોટમાં મીઠું, હળદર, લાલ ભરચું, ધાળાજીરું, સાકર, લીંબુ નાખવા અને સારું મોણ નાખી લાંબી લાંબી પાટલા ઉપર વાળી કટકા કરવા અને શાકમાં નાખવા અને રસો ઘંટ કરવો. શાકમાં હળદર, લાલ ભરચું, ધાળાજીરું નાખી હલાવવું.

બાજુદી રસ

સામગ્રી :- કોર્ટીબા, ગોળ, મીઠું, લાલ મરચું, હળદર, ઘાણા જું

રીત :- કોર્ટીબાને છોલી ને ટુકડા કરી બાફવા અને તેલનો વધાર કરી રાઈ, જું નાખી હળદર નાખી શાક નાખવા ઉપર આપેલ મસાલો નાખવો. કોર્ટીબાને સૂક્ષ્વવી નાખવા તો સૂક્ષ્વવાણીની જેને લાચરા કહેવાય.

બાજુદી રસ

સામગ્રી :- પાપડ, ખાટી છાસ, ગોળ, મીઠું, હળદર, લાલ મરચું, ઘાણાજું

રીત :- પાપડના ટુકડા કરી તળવા અને એક કડાઈમાં તેલ નાંખી રાઈ, જરાનો વધારી કરવું અને તણેલા પાપડ અને ખાટી છાસ નાખવી અને ગોળ, લાલ મરચા, ઘાણાજું નાખવું. મીઠું પ્રમાણસર નાખવું. પાપડમાં મીઠું હોય છે તેનું ધ્યાન રાખવું.



બાજુદી (બાજુદી રસ)

સામગ્રી :- ભગની દાળ, કોપરું, ગરમ મસાલો, મીઠું, લીંબુ, સાકર, લાલ મરચા, ઘાણાજું, સીમલા મરચા

રીત :- ભગની દાળને બાફી એમાં કોપરું, ગરમ મસાલો, મીઠું, લીંબુ, સાકર, લાલ મરચા, ઘાણાજું, કોથમરી બધુ મીક્સ કરી સીમલા મરચામાંથી બી કાઢી આ મસાલો ભરવો અને પછી છૂટ તેલમાં સાંતળવા અને ભરેલા મરચા ઉપર કોપરું અને કોથમરી ભંભેરવું.

બાજુદી રસ

સામગ્રી :- બટેટા, કોથમરી, લીલા મરચા, રાઈ, જું, મીઠું

રીત :- બટેટાને બાફવા બટેટા બફાઈ જાય એટલે છલટા કાઠી ટુકડા કરવા. કોથમરીની લીલા મરચા, દાળિયા, લીંબુ મીઠું નાખી ચટની બનાવવી. કડાઈમાં રાઈ, જરાનું વધાર કરી. બટેટા નાખવા પ્રમાણસર મીઠું નાખવું ઉપર ગ્રીન ચટની પતતી કરી નાખવી અને ગરમ ગરમ ખાવું.





સામગ્રી :- ચણાનો લોટ, મીઠું, લાલ ભરચું, તેલ, ખાવાના સોડા,
હળદર, લાલ ભરચું, ઘાણાજીરું, દહીં, કોથમીર

રીત :- ચણાના લોટમાં મીઠું, લાલ ભરચું, તેલ, સોડા મિક્સ કરી
થોડા પાણીની સાથે પૂરીના લોટની બેઝ ખૂબ કડક લોટ બાંધો. લોટમાંથી
અંગળી જેટલા લાંબા રોલ બનાવી એક લીટર ઉકળતા પાણીમાં નાખો
દસ મિનિટ સુધી ઉકાળી લો. પાણીમાંથી નિતારો, રોલના નાના નાના ટુકડા કાપી લો. એક
તપેલીમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં એક ચમચી રાઈ, જીરું તતડાવી મીઠું, હળદર, લાલ
ભરચું, ઘાણાજીરું મિક્સ કરો. પછી બેસનના ટુકડા નાખો થોડાક સમય સાંતળો હવે બે પાણીમાં
બેસનના રોલ ઉકબ્યા હતા તે પાણી પણ મિક્સ કરી દસ મિનિટ સુધી ચડવા હો. શાક હુંકું
પડી ગયા પછી તેમાં એક કપ દહીં બે સમારેલા લીલાં મરચા અને કોથમરી મિક્સ કરી હો.



કઠોળ

- નરમ મગ
 - મઠ
 - ચાળા
 - વાલ
 - મસુર
 - મસુરની દાળ
 - રાજમા
 - વટાણા (લીલા, સફેદ) રસવાળા
 - રગડો (સફેદ વટાણા)
 - તુવેર
-



સામગ્રી :- મગા, મીઠું, હળદર, ઘાણાજું, લીલા મરચા, કઢીપતો, કોથમીર



રીત :- મગને ટાઈમ હોય તો થોડા પલાળવા બે ત્રણ કલાક અને ત્વરીત હોય તો સીધા ગેસ પર તપેલીમા પાણી નાખી મગ રંધવા. રંધાઈ જાય એટલે હળદર, મીઠું નાખવું. ગલણીથી ગાળી પાણી કાઢી, મગ કોરા કરવા અને થોડાક તેલમાં છુંન નાખી. કઢીપતો અને કોથમીર નાખી મગ વધારવા અને ગરમ ગરમ ખાવા ફૂકરમાં પણ મગ રંધી શકાય.



સામગ્રી :- મઠ, કાંદા, લસણ, કોથમીર, ટમેટો



રીત :- મઠને સોડા નાખી બાફવા. એક કડાઈમાં તેલ નાખી. કાંદા, લસણ, ટમેટોં, રાઈ, જીરનો વધાર કરવો. હળદર અને લાલ મરચા નાખવા અને પ્રમાણસર પાણી નાખવું કોથમરી ભભરાવી.



સામગ્રી :- ચણા, ગોળ, આમલી, મીઠું, ચણાનો લોટ, હળદર, લાલ મરચું, ઘાણાજું



રીત :- ચણા રાને સોડા નાખી પલાળી રાખવા પછી ફૂકરમાં બાફવા. બફાઈ જાય એટલે કણું પાણી કાઢી નાખવું. એક કડાઈમાં તેલ નાખી. રાઈ, જીરું, હિંગ, હળદર, લાલ મરચું, ઘાણાજુરા નાખી ચણા વધારવા અને પ્રમાણસર પાણી નાખવું. ગોળ અને આમલીને બાંધી મીક્સરમાં પીસી ગાળીને નાખવું. ચણાના લોટમાં પાણી નાખી ઓગળી ચણામાં નાખવું જેથી રસો ઘણ થાય.



સામગ્રી :- વાલ, મીઠું, હળદર, લાલ મરચું, કોથમીર



રીત :- વાલને પલાળવી રાત્ર સવારે એના છલટા કાઢી એક કડાઈમાં તેલ નાખી વધારવી એમા રાઈ, જીરું, હિંગ, હળદર, લાલ મરચું અને મીઠું નાખવું. આ શાક આમરસની સીજનમાં વધુ સરસ લાગે.



સામગ્રી :- મસુર, મીઠું, હળદર, લાલ મરચું, કાંદા, લસણ
રીત :- મસુર રાતે પલાળવી અને મગમઠ કરીએ છીએ તેવી જ રીતે કરવા. ફણગાવેલા મસુર પણ એજ રીતે કરી શકાય.



રીત :- મસુરની દાળ ઘણી જ પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે. તુવેસની દાળ બનાવીએ તેવી જ રીતે મસુરની દાળ બનાવવી. એમાં થોડી તુવેસની દાળ પણ નાખો તો ઘણી સારી લાગશે. એની લચકો દાળ કે ઓસામણ ખાસ બનાવાતા નથી.



સામગ્રી :- રાજમ, મીઠું, કોથમરી, કોપરું, કાંદા, આદુ મરચા, પાકા ટમેટા, દહીં

રીત :- રાજમાને રાતે પલાળી દેવા. થોડું વધારે પાણી મૂકીને કૂકરમાં બાફવા. થોડી કોથમરી, કોપરું, સાંતળેલા કાંદા, આદુ મરચા નાખવા. એક કડાઈમાં તેલ નાખી મસાલો સાંતળવો લાલ થાય એટલે રાજમા નાખી દહી નાખવું પછી તેમાં ટમેટાના ટુકડા નાખવા. મીઠું ગરમ મસાલો નાખી ઉકાળવા દેવું. આમ કરી કાશ્મીરી પુલાવ સાથે ખાવાની મજા આવશે. આ ગોળ આમલી નાખી ચણાની જેમ ખવાય.



રીત :- સૂક્ષ્મ વટાણા રાતે પલાળી મૂકવા. સવારે વીળીને વાલની માફક જ કરવા. બધો મસાલો પણ એ પ્રમાણે જ નાખવો. માત્ર અજમો નાખવો નહીં.



ચામગ્રી (ચામણ ચામણ)

સામગ્રી :- સફેદ વટાણા, મીઠું, હળદર, કોથમીર

રીત :- વટાણાને રાતે પલાળી. ફૂકરમાં બાઝી લેવા. વધારમાં તેલ રાઈ, હિંગ અને જીણા કાંદા સમારીને નાખવા. કાંદા લાલ થાય એટલે વટાણા નાખી. ચામણનો લોટ લેણવેલું પાણી, પ્રમાણસર મીઠું, હળદર, મરચા અને ઘાણાજું નાખવા. એક ચમચી ભરીને ગરમ ભસાલો નાખવો ખટાશ જોઈતી હોય કે રસો જડો કરવો હોય તો આમલીનું પાણી નાખવું.



રીત :- આખી તુવેર જોઈતા પ્રમાણમાં રાતના પલાળવી અને રસાવાળા ચાણા જેવી રીતે કરીએ તેવી જ રીતે કરવી.



મિઠાઈ

- લપદ્ધ લાપસી (મીઠો ભાત)
- કોપરાપાક
- મેસૂર
- શીંગનો મેસૂર
- લાડુ
- માલપૂડા
- ઓસારેલી સેવ
- દૂધપાક
- રવાનો શીરો
- ચીકુનો હલવો
- ગાજરનો હલવો
- દૂધીનો હલવો
- ગગન ગાંઠિયા (કચ્છી મીઠાઈ)
- પકવાન (કચ્છી મીઠાઈ)
- તલના લાડુ
- શ્રીખંડ
- કુટ સલાદ
- સુખડી (ગોળ પાપડી)
- મોહનથાળ
- શીરો ઘઉંના લોટનો
- મગની દાળનો શીરો
- ઘઉંની ઘૂઘરી
- પૂરણપોળી (ચણાની દાળ)
- દારેજો શીરો
- ઘઉં-ચણાના લાડુ
- કાંટરાના લાડુ
- ઘાબાવાળા લાડુ
- બાજરાનો ગોળવાળો રોટલો
- ખજૂરપાક
- ખીર (ચોખાની)
- સેવનો શીરો
- બરફી ચૂરમો
- ગુંદરપાક
- મગજ
- તલસાંકળી
- અડદીયાપાક
- કચરીયું
- આદુપાક

□□□ (ઉંમણ રંગ)

સામગ્રી :- ચોખા, ગોળ, ધી, તજ

રીત :- ચોખાને ઘોર્ડ સાઈડમાં રાખવા. પછી કડાઈમાં થોડું ધી નાખી. તજનો વધાર કરવો. એમાં ચોખા નાખીને ગેસ બંધ કરવો. બાજુ પર પ્રમાણસર ગોળવાળું પાણી બનાવવું. એક વાટકી ચોખા હોય તો બે વાટકી ગોળવાળું પાણી નાખી ૩/૪ સીટી મરાવી. એટલે મહો ભાત તૈયાર આની સાથે ચાણાને મગની દાળ બનાવવી અને લાપસી કહેવાય છે.



□□□□□

સામગ્રી :- નાળિયેરનું ખમણ, ખાંડ, દૂધ, માવો, એલચી, ધી પ્રમાણસર, ચાંદીના વરખ

રીત :- નાળિયેરનું ખમણશીથી જીણું ખમણ કરવું. એક વાસણમાં બે ચમચા ધી મૂકી. તેમાં નાળિયેરનું ખમણ નાખવું. સાધારણ શેકાય એટલે તેમાં ખાંડ અને દૂધ નાંખવા. પીળા રંગનો કરવો હોય તો થોડો પીળો રંગ નાખવા. સફેદ પણ ચાલી શકે. આડનું પાણી બજે અને ઘણું થાય. એટલે ઉતારી થોડી વાર હલાવવું. સાધારણ હંડું પે એટલે તેમાં માવો અને એલચીનો ભૂકો નાખી થાળીમાં ધી લગાડી કોપરાપાક દારી દેવો ઉપર વરખ લગાડી શકાય.



નાળી

સામગ્રી :- ચાણાનો લોટ ૧ વાટકી, ધી ૩ વાટકી, ખાંડ ૧૦ વાટકી, ૨ ચમચા દૂધ, એલચી

રીત :- એક વાસણમાં ખાંડ લઈ, તે ઝૂબે તેટલું પાણી નાખી તાપ ઉપર મૂકવું. ઉકળે એટલે તેમાં દૂધ-પાણી નાખી મેલ કાઢવો. ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ ઉપર ગરમ રાખવી.



ચાણાના લોટને ધીમા બદામી રંગનો શેકવો. શેકાય એટલે તેમાં ચાસણી નાખવી અને એક ચમચો દૂધ છાંટવું. ખૂબ હલાવતા રહેવું. પછી ધીને સાંચું ગરમ કરી, તેની ધાર કરવી. લોટ છૂટો પડવા આવે, ધી છૂટું પે અને ઉભરો આવે એટલે એલચીનો ભૂકો નાખી, તરત ૪ સ્ટીલની ચાળણીમાં મેસૂર દારી દેવો. ચાળણી તપેલી ઉપર મૂકવી જેથી ધી તેમાં નીતરી મેસૂરમાં સરસ જાળી પડશે. સાધારણ હંડો પડવા આવે એટલે કટક કાપવા. સખત થયા પછી. એક સરખા કટક પડશે નહિ.



સામગ્રી :- શીંગદાણાનો ભૂકો ૧ વાટકી, ખાંડ ૧ વાટકી, ઘી ૩ વાટકી, એલચીનો ભૂકો



રીત :- શીંગદાણાને સાધારણ રેડી, તેનાં છલટાં કાઢી, સંચામાં બારીક ભૂકો બનાવવો. એક વાસણમાં ખાંડ નાખી તે દૂબે તેટલું પાણી નાખી ગરમ કરવું, ખાંડ બરાબર ઓગળે કે તરત જ તેમા ભૂકો નાખવો. ચાસણાં થવા દેવો નહિ. પછી ઘીને ગરમ કરી તેની ધાર ફરવી. ખૂબ હલાવતાં રહેવું. જ્યારે ઘી ધૂંધું પેડ ત્યારે એલચીનો ભૂકો નાખી ઉતારી, સ્તીલની અથવા પિતળની ચાળણીમાં મેસૂર ઢારી દેવો. ચાળણી તપેલી ઉપર મૂકવી, લગભગ દોઢ વાટકી જેટલું ઘી નીતરી જશે. હંડો પડતાં પહેલા કાપાં કરી દેવા.



સામગ્રી :- ઘઉનો લોટ, ઘી, ગોળ

રીત :- લોટમાં ગરમ ઘીનું મોણ નાખી કણક બાંધવી. તેને કેળવવી નહી પણ થોડો લોટ બાંધતા જવું અને મૃઠિયા વાળવા. પછી ઘીમા તાપે તળવા. બદામી રંગના થાય એટલે ઉતારી ખાડી મોટા કાળણાની ચાળણીથી ચાળી એક સરખો ભૂકો બનાવવો. ગોળ ચાપ્યુંથી જીણો કાપી અંદર નાખી, બરાબર બેળવું, પછી બાકી રહેલા ઘીને ગરમ કરી, તેમા નાંખીને તેના લાડુ બનાવવા.



સામગ્રી :- ૫૦૦ ગ્રામ ઘઉનો લોટ, ૫૦૦ ગ્રામ જીણી ખાંડ, ઘી, ખસખસ પ્રમાણસર

રીત :- ઘઉના લોટમાં દળેલી ખાંડ નાખી, સાધારણ ગરમ પાણીથી પાતળું ખીરું બાંધવું અને પાચ છ કલાક ખીરું રાખી મૂકવું. હાથથી ઝીણી હલકું કરવું. જેથી સારી જાળી પડશે.




એક છીછરી પેણીમાં ઘી મૂકી, ઘી ગરમ થાય એટલે મોટા ચમચાથી એક સરખી ધાર પાડી, માલપૂડા પાથરવા પછી બે તવેથાથી ઉંઘાં કરવા. બદામી રંગના થાય એટલે કાઢી, થાળીમાં છૂટા ગોઢવવા, થોડી ખસખસ ઉપર છાંટવાથી ચોંટી જશે નહિ.



સામગ્રી :- દૂધ, ઘઉની સેવ, ખાંડ, બદામ, એલચી

ઘઉની સેવને છુટી કરી ઘીમા સાંતળવી. એક તપેલીમાં દૂધ ઉંકળવા મૂકવું. બરાબર ઉંકળે એટલે તેમા સેવ નાખવી. તરત જ સેવ બફાઈ જાય છે પછી તેમાં ખાંડ નાખી દૂધપાક જડો થાય એટલે ઉતારી હંડો પાડવો. પછી છોલેલી બદામની કાતરી, એલચીનો ભૂકો નાખવો.





સામગ્રી :- દૂધ ૧ લિટર, ખાંડ ૮/૧૦ ચમચી, બદામ, પિસ્તા, કેસર, એલચી, જાયફળનો ભૂકું



રીત :- એક તપેલીમાં દૂધ ઉકાળવા મૂકવું. ઊભરો આવે એટલે હલાવ્યા કરવું. પછી એમાં ખાંડ નાખી. કેસરને નાનો વાટકીમાં થોડું દૂધ લઈ કેસર ભીજાવી અને ગરમ પાણીમાં બદામ ઉકાળવી. એક ઉકાળો આવે એટલે ઢાંડી કરવા દેવી. બદામના છલટા ઉતારી છીણી સુધારવી, પિસ્તાને સુધારવી એલચી, જાયફળનો ભૂકું અને પલાણેલી કેસર નાંખવી. પછી એક સરસ ચમચાથી હલાવી ચાખી લેવું ખાડ ઓછી હોય તો નાખવી દૂધપાકનો કલર પીળાશ પડતો થાય એટલે તૈયાર.



સામગ્રી :- રવો, ધી, ખાંડ, દૂધ, એલચી, ડીસમીસ



રીત :- રવાને ધીમા તાપે બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે દૂધ અને ડીસમીસ નાખવા. દૂધ બળે એટલે ખાંડ નાંખવી. શીરો થઈ જાય એટલે એલચીનો ભૂકું નાખવું.



સામગ્રી :- ૧ ડઝન પાકાં મોટા ચીકુ, ૨૫૦ ગ્રામ માવો, ૨૫૦ ગ્રામ ખાંડ, ૫૦ ચોકલેટ પાવડર, ૧ ચમચો ધી, રોક્ઝ એસેન્સ, બદામ, ગુલાબી મીઠો રંગ



રીત :- ચીકુને છોલીને, છંદી નાખવાં. એક વાસણમાં ધી મૂકી ગરમ થાય એટલે ચીકુ અને ખાંડ નાખવી. ખાંડનું પાણી બળે એટલે તેમાં ચોકલેટ પાવડર નાખવો. બરાબર હલાવી, ઉતારી તેમાં માવો લેળવવો. પછી એસેન્સ નાખી, થાળીમાં ધી લગાડી, હલવો ઠારી દેવો. ઉપર છોલેલી બદામની કાતરી છાંટવી.



સામગ્રી :- ગાજર - લાલ મોટા, ખાંડ, માવો (હોય તો), ધી, દૂધ, કાજુના ટુકડા



રીત :- ગાજરને છોલી વર્ચયેનો સફેદ ભાગ કાઢી છીણી નાખવા. એક વાસણમાં ધી મૂકી એલચીનો વધાર કરી છીણી નાખવું. પછી તેમાં દૂધ નાખી ધીમા તાપે છીણે બાફવું. બરાબર બફાય એટલે ખાંડ અને ગુલાબી રંગ નાખવો હોય તો ખાંડનું પાણી બળે એટલે નીચે ઉતારી જોવું ઢરે તેવું ઘણ થાય એટલે થાળીમાં ધી લગાડી હલવો ઠારી દેવો અંદર કાજુના ટુકડા નાખવા અને શા માટે ઉપર વરખ લગાડી શકાય.




સામગ્રી :- દૂધી કુમળી, ખાંડ, દૂધ, કેસર, ધી, માવો (જરૂરત હોય તો)

રીત :- દુધીને છોલીને છીણી નાખવી. છીણને વરાળથી બાઝી લેવું. એક વાસણમા ધી મૂકી તેમા છીણ નાખવું. થોડીવાર હલાવી તેમાં ખાંડ અને (લીલો કલર નાખવાં હોય તો પ્રમાણસર) દૂધ નાખી રંગવા દેવું. પછી ઘણું થાય એટલે થાળીમાં પાથરી એમાં કાજુ ટકડા અને બદામ ટકડા નાખી દેવા. કંદુ પે પછી વરખ લગાડવું.



સામગ્રી :- ઘઉંનો લોટ અથવા મેંદાનો લોટ, ખાંડ, ધી (મોણ માટે), કેસર, નાનું લીંબુ, તળવા માટે ડલડા ધી

રીત :- એક તપેલીમાં ખાંડ લઈ તે દૂબે તેટલુ પાણી નાખી ઉકાળવા મૂકવું. તેમાં કેસર ગરમ કરી વાટી દૂધમાં ઘૂંઠીને નાંખવું. ચાસણી બેતારી થાય એટલે ધીમા તાપ ઉપર મૂકી રાખવી જેથી ગરમ રહે. ઘઉં અથવા મેંદાના લોટમા ધીનું મોણ નાખી તેની કઠણ કણક બાંધવી. મેંદાનો લોટ હોય તો (વધારે મોણ નાખવું) તેને ખાંડી કેળવીને તેમાંથી નાના લૂંઘા બનાવવા. પછી તેની પૂરી વણવી તે પૂરીનો વીઠી વાળી તેના અઢી ઈચ્ચાના કટકા કાપવા. બંને બાજુ કાપી ભૂગળી જેવા ગાંઠિયા કરવા પછી તેને ધીમા બદામી રંગના તળી ચાસણીમાં નાખવા. બીજો ધાળ થાય એટલે પહેલા ગાંઠિયા કાઢી બીજી નાખવા, પછી ગુલાબના ફુલની પાંઢી ભભરાવવી.



સામગ્રી :- મેંદો, ચોખાનો લોટ, ખાંડ (ફળેલી-ભૂરું), ધી પ્રમાણસર, એલચીનો ભૂકો

રીત :- મેંદામાં ૫૦ ગ્રામ ધીનું મોણ, ફળેલી ખાંડ અને એલચીનો ભૂકો નાખી ખૂબ કઠણ કણક બાંધવી. એક કલાક કણકને ઢાંકીને રાખી મૂકવી. પછી તેને ખાંડી, થોડું ધી લઈ કેળવો સુંવાળી બનાવવો. ૫૦ ગ્રામ ધી અને ૫૦ ગ્રામ ચોખાનો લોટ ફીણીને સાટો બનાવવો. પછી મેંદાના લોટની પાતળી મોટી પૂરી વણવી. તેના ઉપર સાટો ચોપડવો. તેના ઉપર બીજી પૂરી મૂકવી, તેના ઉપર સાટો લગાડવો. એમ ઉપરાઉપરી પાંચ પૂરી મૂકી વચ્ચે સાટો ચોપડવો ઉપરની પૂરીને સાટો લગાડવા નહીં પછીથી તેને વીઠો વાળી તેના કટકા કાપવા વચ્ચે ગોળ ચક્કર દેખાય તેમ દાબવા. પછી થોડું ચોખાનું અટામણ લઈ નાની, જાડી પૂરી વણવી. વચ્ચે ચાર પાંચ ખાડા પાડવા. પછી ધીમા તાપે ધીમાં તળી લેવી. સરસ પતરી પડવી જેઈએ.




સામગ્રી :- તલ અડધો કિલો, ગોળ ૪૦૦ ગ્રામ ગોળ

રીત :- તલને સાફ કરવા પછી મીક્સરમા અધકચરા પીસવા અને થાળીમા કાઢવા. ગોળને સુધારીને રાખવું, પછી અધકચરા તલ અને ગોળ બેઉ મીક્સરમા પીસવા અને પછી બેઉ લેગા કરી ગોળ ગોળ લાડવા વાળવા.



સામગ્રી :- દહી, જેટલો ભસ્કો ઉત્તરે એટલી ખાંડ, કેસર, એલચી, ચારોળી

રીત :- દહીને કપડામાં બાંધી રાખવું. બધું પાણી નીતરી જાય અને દહીનો ભસ્કો તૈયાર થાય એટલે કપડામાંથી કાઢી વજન કરવું અથવા જેટલો ભસ્કો એટલી ખાંડ લેવી અને બેઉ ભેગુ કરવું. એક તપેલા ઉપર ખાદીનો કટકો બાંધી, દહી અને ખાંડ લેગા કરેલા હોય તેને છાણી નાખવા. પછી કેસરને ગરમ કરી વાટી એક થમચી દૂધમા ઘૂટી અંદર નાખવું. એલચીનો ભૂંકો અને ચારોળી નાખવું.



સામગ્રી :- કુટ (સફરજન, ચીકુ, દાડમ, મોસંબી, સંતરા, અંગુર), દૂધ, કેસર, ખાંડ

રીત :- દૂધ એક વાસણમાં લઈ ગરમ કરવું. ઠંડુ થાય પછી મલાઈ કાઢી લેવી પછી એમા ખાંડ પ્રમાણસર નાખી ઓગળવી. એમા કેસર નાખવી અને ઉપર આપેલ કુટ બધું સુધારીને એક થાળીમા રાખવું જ્યારે જમવા બેસો એના પહેલા મોસંબીને સંતરા નાખવા બીજા કુટ પહેલેથી જ નાખી ફીજમાં ઠંડુ કરવા મૂકવું.



કુરુકુશ (દહી દાડામ)

સામગ્રી :- ધઉનો લોટ, ધી, ગોળ, વરિયાળી, બદામ

રીત :- એક વાસણમા ધી ગરમ મૂકી તેમા ધઉનો લોટ નાખી ધીમા તાપે આછો ગુલાબી શેકવો. લોટ શેકાઈ જાય ત્યારે ગેસ પરથી નીચે ઉતારી ગોળનો ભૂંકો કરી નાખવો અને બરોબર હલાવી મિક્સ કરવું. તેને થાળીમાં કાઢી એની પર વાટકી ઘસી બરાબર પાથરવું. કાપા તરત જ કરવા એની ઉપર વરિયાળી જરા ચોળીને નાખવી.





સામગ્રી :- ચણાનો લોટ, સાકર, ધી, એલચીનો ભૂંકો

રીત :- પહેલા ધારો આપી ૧/૨ કલાક રાખી દેવું પછી ધી સરખું નાખી સેકવું જ્યારે સેકાઈ જાય ત્યારે દૂધ નાખી બે/પાંચ મીનીટ હલાવી નીચે રાખી દેવું અંદર એલચીનો ભૂંકો નાખવા ને એને હંડો થવા દેવું બાજુમાં થોડુંક પાણી લઈ ચાસણીને હંડી કરી પછી બેઉ મીક્સ કરી એક રસ હલાવીને થાળમાં પાથરવું ને ચોરસ ચોખટા કરવા. ઉપર બદામ પીરતાની છીાંશ છાંટી શકાય.



સામગ્રી :- ઘઉંનો લોટ એક વાટકો, સાકર, ધી, બદામ, એલચીનો ભૂંકો, પાણી પ્રમાણસર બે વાટકા

રીત :- એક કડાઈમાં ધી નાખી ઘઉંનો લોટ શેકવો જ્યારે ખાળિન રંગનો થવા આવે ત્યારે એમાં પાણી ગરમ કરેલું નાખવું અને સાકર નાખી એલચીનો ભૂંકો નાખી હલાવવું જ્યારે ઘડું થાય અને કડાઈમાં શીરો ઘૂંઠો થઈ જાય એટલે શીરો તૈયાર ઉપર બદામની કાતરી ભંસેરવી.



સામગ્રી :- મગની દાળનો લોટ, દૂધ, ધી, સાકર, ઈલાયચીનો ભૂંકો, બાફેલા બદામની કાતરી, કાજુના ટુકડા

રીત :- એક વાસાણમાં ધી ગરમ મૂકી તેમાં મગની દાળના લોટને નાખી ધીમા તાપે હલાવવો. દૂધને ગરમ કરવું મગનો લોટ ગુલાબી રંગનો થાય એટલે તેમાં દૂધ બણે ત્યારે તેમાં ખાંડ નાખવી. ધી છુંટું પે એટલે તેમાં ઈલાયચીનો ભૂંકો, બદામની કાતરી ને કાજુના ટુકડા નાખવા. શેકવા માટે અનુકૂળતા હોય એટલું ધી લેવું.



સામગ્રી :- ઘઉં (શિહોર), સોડા, પીસેલી સાકર, ધી, તલનો લાંદુ

રીત :- ઘઉં સારા લઈ સાક કરી ૧૨ કલાક ભીજવવા એમાં સોડા નાખી. પછી એ પાણી કાઢી કુકરમાં તપેલીમાં ઘઉં નાખી પાણી નાખી બાફવી. ત્રણ થી ચાર સીટી મારવી અને હંડી થાય એટલે પાણી કાઢી લેવું. પછી એમાં પીસેલી સાકર, ધી અને તલનો લાંદુ ભૂસીને ખાવું.



ફૂલપણ (ફૂલપણ પણ) ૪ વાટકો પણ

સામગ્રી :- ચણાની દાળ એક વાટકો, ખાંડ, અડધો પોણા વાટકો, એલચીનો ભૂકો, ઘઉનો લોટ (મીઠું તેવ)



રીત :- ચણાની દાળને ધોઈને તેમાં થોડું પાણી મૂકી ફૂકરમાં બાફવા મૂકવી. બફાઈ જાય એટલે પાણી કાઢી ચારણીથી કોરી કરવી પછી Crusher Crush કરી એક કડાઈમાં દી નાખી ચણાદાળનો માવો નાખવું સાકર નાખવી. હલાવવું એટલે ઘરું થઈ જાય. એમા ઈલાખચીનો ભૂકો નાખવો. ઘઉનો લોટ મીઠા વગરનો બાંધવો અને નાની રોટલી વણી તેમાં પૂરણ મૂકી તેને વાળીને ફરિથી વણીને દીમા તાપે તવી ઉપર શેકવી. શેકાઈ જાય એટલે દી ચોપડી પીરસવી. ચણાની દાળના બદલે તૂયેરની દાળ પણ વાપરી શકાય. સાકરના બદલે ગોળ પણ વાપરી શકાય.

ફૂલપણ

સામગ્રી :- ઘઉનો જડો લોટ, ગોળ, દી, એલચી, બદામ



રીત :- ઘઉનો જડો લોટ લઈ દીમાં શેકવો. બદામી રંગનો થાય એટલે એમાં ગોળવાનું પાણી નાખવું । વાટકી હોય તો ત્રણ વાટકા ગોળ વાળો પાણી નાખવું અને હલાવતા રહેવું દાણા કુટી જાય એટલે દીમે રાખી હેવું અને એલચીની ભૂકી નાખવી અને બદામની કાતરી નાખવી.

ફૂલ - ફૂલપણ પણ

સામગ્રી :- ૨૫૦ ઘઉનો લોટ (કરકરો), ૨૫૦ ચણાનો લોટ, ચારોળી, એલચી, દૂધ, ૩૫૦ દી, ૨૫૦ ખાંડ દળેલી (ખૂસું)



રીત :- ઘઉં અને ચણાના લોટમા દીનું મૂકી પુરતું મોણ નાંખી, બંસે લોટ દૂધથી જુદા જુદા બાંધવા. તેના મૂઠિયા કરી, દીમા દીમા તાપે જુદાં જુદાં તળવા. બદામી રંગ થાય એટલે કાઢી તેને ખાંડવા પછી મોટાં કાણાંની ચાળણીથી ચાળી, એક સરખો ભૂકો બનાવી લેગો કરી હેવો. તેમાં ખાંડ, ચારોળી, એલચીનો ભૂકો અને ગરમ કરેલુ દી નાખી તેના લાદુ વાળવા અથવા થાળીમા દી ચોપડી લાદુ ઢારી હેવો. તેના ઉપર દીને ગરમ કરી ઢારવું, દી ઢરી જાય એટલે ચોસતા પાડવા.

બાજરા લોટ

સામગ્રી :- કાંટરો, ઘઉનો લોટ, ધી, પીસેલી સાકર, એલચી બદામનો ભૂકો

રીત :- ગ્રાબાવાળા લાડુની રેસેપીની જેમ જ છે ફક્ત શેકેલો લોટ શેકાઈ જાય ત્યારે કાંટલો નાખવો અને પીસેલી સાકર, એલચીનો ભૂકો અને બદામની કાતરી નાખી કાંટરાના લાડુ વણવા. શીયાળામા આ લાડુ તાકાત વાળા હોય છે.

બાજરા લોટ

સામગ્રી :- ઘઉનો લોટ એક વાટકો, ધી, સાકર પીસેલી અદધો વાટકો, એલચીનો ભૂકો



રીત :- ઘઉનો લોટ લઈ એમાં ધી અને દૂધની મલાઈ નાખી ગ્રાબો આપવો. બે કલાક પછી અને ચાળણીથી ચાણીને લોટને ધીમાં શેકવો. બદામી કલરનો થાય એટલે નીચે ઉતારી જરા ઠંડુ થાય એટલે પીસેલી સાકર, એલચીનો ભૂકો અને બદામની કાતરી નાખી લાડુ વણવા.

બાજરા લોટ રોટલા કરવા

સામગ્રી :- બાજરાનો લોટ, ધી, ગોળ



રીત :- બાજરાના રોટલા કરવા અને ગરમ ગરમ ભૂસીને ધી અને સુધારેલુ ગોળ નાખવું અને બધુ ભૂસીને એના મૂંઝીયા અથવા લાડવા કરવા.

બાજરા લોટ

સામગ્રી :- ખજૂર કાળી, ધી, પીસ્તા, બદામ, કાજુના ટુકડા, વરખ



રીત :- ખજૂરના બી કાઢી ચાળણીમા બાફવી ૫/૭ મિનિટ. પછી એક કડાઈમાં ધી નાખી ખજૂર બધી સીજવવી અંદર પીસ્તા, બદામ, કાજુના ટુકડા નાખી એક થાળીમા પાથરી ચોસલા કરવા. ઉપર વરખ લગાવવી હોય તો લગાડી શકાય.

દૂધ (દૂધાણા)

સામગ્રી :- દૂધ, ચોખા, સાકર, એલચી, કેસર, બહામ

રીત :- ચોખાને લીજાવી નાખવા. દૂધને ઉકાળવા મુક્કવું. દૂધ ઉકળે એટલે એમા ચોખા નાખી હેવા, સાકર નાખવી, એલચી કેસર નાખવી ને ઉકાળવા મુક્કવું અને બહામની કાતરી નાખવી. જરા ઘણું ખીર બનાવવી.



ઘઉની દીમા

સામગ્રી :- ઘઉની સેવ, ધી, સાકર

રીત :- એક વાસણ ધી લેવું અને સેવ શેકવી. બહામી રંગની શેકાઈ જાય એટલે ગરમ પાણી નાખી સાકર નાખવી હલાવવું અને એલચીનો ભૂકો નાખવો. પછી ધીમા તાપ પર રાખી ગેસ બંધ કરવું. ધીમા તાપે સીજવાનું.



ઘઉનો લોટ

સામગ્રી :- ઘઉનો લોટ, ધી, ખાંડ, રવો, દૂધ, બહામ, એલચી, ચારોળી

રીત :- ઘઉનો લોટ અને રવો ભેગો કરી, મૂઠી વાળવા પુરતું ધીનું મોણ નાખી, દૂધથી લોટ બાંધી, તેના મૂકિયા બનાવવા. ધીમા ધીમા તાપે બહામી રંગના તળવા પછી તેને ખાંડી, લાટુ ચાળવાની મોટા કાણાંની ચાળાણીથી ચાળીને ભૂકો બનાવવો પછી તેમા દળેલી ખાંડ, સાધારણ ગરમ ધી અને એલચીનો ભૂકો નાખી હલાવી, થાળીમાં ધી ચોપડી ઢારી હેવો. હરવા આવે એટલે ધીનું ગરમ કરી ઉપર ઠારવું. ઉપર છોલેલી બહામની કાતરી અને ચારોળી ભલભરાવી હેવા.



દાઢાણા

સામગ્રી :- ગુંદર, રવો, ધી, કોપરું, દળેલી ખાંડ, બહામ, સૂંદ, પિસ્તા

રીત :- ગુંદર ધીમાં કુલાવી થાળીમાં વાડકીથી ખાંડને તૈયાર કરવો. રવાને ધીમાં બહામી રંગનો શેકવો. કોપરાને છીઇની થોડા ધીમા સાંતળવું, બધું ભેગું કરી દળેલી ખાંડ બહામ-પિસ્તાનો મોટો ભૂકો, ખસખસ, ખાડેલી સૂંદ-એલચીનો ભૂકો નાખી બાકી રહેલું ધી ગરમ કરી અંદર નાખી બરાબર હલાવી, થાળીમા ધી ચોપડી ગુંદરપાક ઢારી હેવો. ઉપર થોડી બહામ-પિસ્તાની કાતરી અને ચારોળી ભલભરાવી હેવાં.





સામગ્રી :- ચણાનો લોટ, દળેલી ખાંડ, ધી, એલચી ૧ ચમચો દૂધ

રીત :- ચણાના લોટમાં એક ચમચો દૂધ અને એક ચમચો ધી નાખી ધ્રાબો દેવો. પછી હાથથી મસળી, ચાળાણીથી ચાળી રવાદાર ભૂકો જનાવવો. પેણીમા ધી મૂકી, લોટ ધીમા તાપે શેકવો. સુરાંધ આવે બદામી રંગનો થાય ને ફૂલી જાય એટલે ઉતારી લેવો. સાધારણ હંડો પડવા આવે એટલે દળેલી ખાંડ અને એલચીનો ભૂકો નાખી થાળીને ધી ચોપડી ઢારી દેવો. છોલેલી બદામની કાતરી અને ચારોળી ભભરાવવી. દરે એટલે ચોસલા પાડવા.




સામગ્રી :- તલ, ગોળ, ધી

રીત :- તલને શેકવા ગોળમાં બે ચમચા પાણી નાખી જડી ચાસણી કરવી. એકદમ પાકી ચાસણી થાય એટલે તલ નાખી પેઢા ઉપર ધી ચોપડી પાથરવું ને વેલણથી વણવી અને પછી એના કટકા કરવા.



સામગ્રી :- અડફનો લોટ, માવો, તળેલું ગુંદર, બદામ પીસ્તા, સુંધ પાવડર, સાકર, એલચી, જયફળ, જવંત્રી, ધી

રીત :- લોટ કરકરો લેવાનો એને થોડું દૂધ ધી ગરમ કરી ધ્રાબો આપી થાળીમાં દબાવી રાખવું. ચાળીને ગરમ ધીમાં ગુલાબી શેકવું એમા માવો ખમણુંને નાખી ૫-૭ મિનીટ શેકવું. ગેસ પરથી ઉતારી બધા જ મસાલા નાખવા. સાકરમાં ૧/૨ કપ પાણી નાખી ૧ તારની ચાસણી બનાવવી. જરા હંડી થાય એટલે બધી વસ્તુ મીક્ષ કરી લાડુ બનાવવા (વાળવા).



સામગ્રી :- કાળા તલ, શીંગ, ગોળ, ગુંદર, સુંધ પાવડર, બદામનો પાવડર

રીત :- શીંગને શેકી ફોતરા કાઢી પાવડર કરવો. તલને શેકીને એનો ભૂકો કરવો. ગુંદને તળીને હાથેથી મસળી પાવડર કરવો. ગોળમાં ૧ ચમચી ધી, ૧ ચમચી પાણી નાખી ચાસણ કરવી એમાં એક એક વસ્તુ ઉમેરવી. હલાવીને મીક્ષ કરવું.



બાજુરા

સામગ્રી :- આદુ, ગુંદર તળેલું, સાકર અથવા ગોળ, ધી, ખસખસ,
બદામ પીસ્તા, એલચી, જયફણ



રીત :- કોપડું ખમણીને ધીમે તાપે પાંચ મીનીટ શેકવું. ખસખસ,
બદામ, પીસ્તા ધીમા શેકવા. આદુ ખમણી ધીમા ધીમા તાપે શેકવું.
સાકરમાં ૨ ટી-સ્પૂન ધી, ૧ ટી સ્પૂન પાઇંગ નાખી ચાસણી કરવી.
બબત્સ થવા આવે પછી ૨ મીનીટ રહીને ગેસ બંદ કરવું. આદુ નાખી મીક્ષ કરવું. પછી ૧-
૧ વસ્તુ નાખીને મીક્ષ કરી ટ્રેમાં પાથરી કાપા પાડવા.

કરસાણ

- સાબુદાણા વડા
- ખાંડવી
- પનીર સેન્ડવીચ
- દહીવડા
- મેંદૂવડા
- બટેટા વડા
- કેળા વડા
- આલુ પરોઠા
- કાચા કેળાના મૂઠિયા
- કોબીજ મૂઠિયા
- પાતરા
- કાંણ વડા
- બીટ વટાણાની કટલેટ
- વટાણાની કયોરી
- ભાખરવડી
- દૂધીના મૂઠિયા
- કાચા કેળાની પેટીસ
- ફરાળી બટેટાની પેટીસ
- મોનીટા કોન (કેનેઘ્સ)
- મગની દાળના ભજ્યા
- બકાલાના ભજ્યા
- લીલી મેથીના ભજ્યા
- ત્રણ ભાગી દાળના ઢોકળા
- મગની છલટી દાળના ઢોકળા
- ગ્રીન પાનના ભજ્યા
- બ્રેડ રોલ
- બટેટાના સમોસા
- ભાતના ભજ્યા
- ગોટા
- મગની દાળની કયોરી
- હાંડવો
- પૌંચા વધારેલા
- ચોખાનું ખીચું

ફાફડા

સામગ્રી :- સાખુદાણા, શીંગદાણા, કોથમીર, આઢુ મરચા પીસેલા, મીઠું, બટેરા

રીત :- સાખુદાણા ભીજવી નાખવા, એમાં બાફેલા બેટેટાનો ભૂડો, શીંગદાણાનો રેકેલો ભૂડો, કોથમીર, પીસેલા મરચા, મીઠું, બધા મીક્સ કરી. ગોલ ગોલવાળી ડાખીને તળવા. સાથે ટોમેટો સોસ અથવા સાકરવાળી દહીં સાથે ખાવું.



ફાફા

સામગ્રી :- ચણાનો લોટ, ખાટી છાશા, મીઠું, હળદર, પીસેલા મરચા

રીત :- એક વાટકી ચણાનો લોટ હોય તો બે વાટકી ખાટી છાશા લેવી બેઉ મીક્સ કરી ઊરવી ને ગરણીથી ગાણી લેવું. એમાં મીઠું, હળદર પીસેલા મરચા, નાખી કુકરમાં બાફેવું. ૫/૭ સીટી મારાવી પછી ઢંડુ થાય એટલે granite platform પર પાથરવું. ઢંડુ થાય કે કાપી રોલ વાળવા. થાણીમાં ગોઠવવું એન પર રાઈ જુરું, મરચા, કઢીપતો, કોથમરી નાખી પીરસવું.



ફાફા ટેસ્ટે

સામગ્રી :- પનીર, પાઉં, કાકડી, ટોમેટો, કાંદા, કોથમીર, બટેરા, લાલ મરચો, મીઠું

રીત :- પનીરને smash કરી એમાં ઉપર આપેલ બધી સામગ્રી મીક્સ કરવી, પછી Breadની ઉપર બધું મુકી ઉપર બીજી Slice નાંખી. તવા પર બટર નાખી ટેસ્ટ કરવો.



ફાફા ટેસ્ટે

સામગ્રી :- છલટી દાળ, મીઠું, પીસેલા મરચા

રીત :- છલટી દાળને ૬/૮ કલાક ભીજવી, પછી ધોઈ છેલટા કાઢી કુંડી, ધોકાથી પીસવી વડા તરવા અને એનો રાઈના ફૂરીયા નવશેડા પાણીમાં નાખીએ એમ વડા બોળવા બરાબર પાણી કાઢી દબાવી એક થાણીમાં ગોઠવવા ઉપર દહીં ખજુરની ચટાણી, લાલ મરચો, જુરો, કોથમીર નાંખી પીરસવું.





સામગ્રી :- અડદાળ, પીસેલા મરચા, મીઠું, તેલ

રીત :- અડદાળને પાણીમાં ૪ થી ૫ કલાક ભીજવી નાખવી. પછી પાણી કાઢી દાળ પીસવી. એમાં મીઠું, હિંગ, પીસેલા મરચા નાખી. વચમા કાણું પાડી વડા તળવા. સાથે નાળિયેરની ચટની સાથે ખાવા.



સામગ્રી :- બટેટા, કોથમીર, લસણ, આદુ મરચું પીસેલા, ચણાનો લોટ, ચપરી સોડા, મીઠું, અડદની દાળ, તેલ

રીત :- બટેટા બાફીને માવો બનાવવો, પછી કડાઈમાં થોડું તેલ લઈ એમાં રાઈ, જુરો, લસણ, પીસેલા હળદર, મરચાનો વધાર કરી માવાએ નાખવું, કોથમરી સુધારીને નાખવી. ચણાના લોટમાં સોડા, મીઠું નાખી ઓગળવું એમાં વડા નાખી તળવા સાથે લસણની કોરી ચટણી બનાવવી.



લસણ ચટણી :- સુડો કોપણું, મીઠું, લાલ મરચા, હલકે હાથે મીક્સ કરવું ને ડબ્બી ભરી લેવી.



સામગ્રી :- કાચા કેળા, લીંબુ, સાકર, ગરમ મસાલો, કોથમીર, મરચા પીસેલા, ચણાનો લોટ

રીત :- કાચા કેળા બાફી માવો બનાવવો. એમાં લીંબુ, સાકર, ગરમ મસાલો, કોથમીર, મરચા પીસેલા, નાખી ગોલ ગોલ વડા બનાવી. ચણાના લોટમાં બોળી તળવા. ચણાના લોટમાં અજમો, લાલ મરચા, હળદર નાખી ઓગળવું. સાથે ખજુર આમલીની ચટણી અને ગ્રીન ચટનીની સાથે ખાવું.



સામગ્રી :- બટેટા, કોથમરી, ઘઉંનો લોટ, વધાર માટે, રાઈ, જુણું, મીઠું

રીત :- બટેટા બાફી માવો બનાવવો એમાં રાઈ, જુરાનો વધાર કરી મીઠું અને કોથમરી નાખી ગોલ ગોલ બોલ બનાવી. ઘઉંની નાની રોટલી કરી એમ બોલ નાખી વણવી અને પરોઠાની જેમ સીજવવું.



બાજુરી લોટ

સામગ્રી :- કાચા કેળા, કોથમીર, ગરમ મસાલો, સાકર, લીંબુ, પીસેલો મરચો, હળદર, હિંગ.

રીત :- કાચા કેળા બાઝી માવો બનાવવો. એમાં ઉપર આપેલ બધી સામગ્રી નાખી માવો બનાવવો અને નાના મૂઢિયાવાળી તેલમાં તળી લેવા અને ચટની સાથે ખાવું.



બાજુરી લોટ

સામગ્રી :- કોખી, શ્રીન, કોથમીર, બાજરીનો લોટ, ચણાનો લોટ, ઘઉનો લોટ, તેલ, મીઠું, પીસેલો મરચો

રીત :- કોખી સુધારી નાખવી. કોથમરી સુધારી નાખવી, બાજરનો લોટ, એમાં થોડો ઘઉનો અને ચણાનો લોટ નાખવું. તેલ, મીઠું અને પીસેલો મરચો નાખી. બંધુ મીક્સ કરી હલકે હાથે લોટ બાંધવું અને મૂઢીયા વાળી બાફવા અને વધારીને ખાવું. વધારમાં રાઈ, જુદું, તલ, કઢીપત્રો અને કોથમીર નાખવી.



બાજુરી લોટ

સામગ્રી :- પાતરાના પાન, ગોળ, આમલી, મસાલાના ધાણા, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, હિંગ, ચણાનો લોટ, મોણ (તેલ), મીઠું

રીત :- પાતરાના પાનને ધોઈ પછી લુછી નાખવા અને એના રેખા કાઢી નાખવા. પછી ઉલટ એટલે રેખા કાઢ્યાના ભાગ ઉપર ચણાનો લોટનો પીરું તૈયાર કરી લગાડવાનું એકએક એવા ૪ પાનનો layer પછી વાળીને રોલ તૈયાર કરી બધા પોણો કલાક બાફવા ઠંડા થાય એટલે કરી તળવા અથવા વધારવા. ચણાના લોટમાં ગોળ આમલીનું પાણી, લાલ મરચું, હળદર, મોણ, મસાલાના ધાણા, ગરમ મસાલો, મીઠું બંધું પાન ઉપર લગાવી શકીએ એવું ખીરું બનાવવું. વધારમાં કઢીપત્રો, તલ, કોથમીર નાખવી.



બાજુરી લોટ

સામગ્રી :- મગની છેલટીદાળ, ૨ ચભમી રાઈ, લીંબુના કુલ ચપટી, પ્રમાણસર આંબલીનું પાણી અથવા છાસ, લાલ મરચા ચપટી, મીઠું

રીત :- મગની છેલટીદાળ ૬/૮ કલાક ભીજાવી. પછી એને ધોઈ એના છેલટા કાઢી દાળ પીસવી કુરી ધોકાથી અને એના મોટા મોટા ભજ્યા બનાવવાને એક તશમય રાખવાનું પછી રાઈ ને ૪/૫ કલાક ભીજાવી પાણી કાઢી રાઈને કુરી ધોકાથી પીસવી. ફીરૂં થાય ત્યાં સુધી પછી રાઈની પેસ્ટને પાણીમાં નાખી ઉકાળવું, એમાં ઉપર આપેલ બધી સામગ્રી નાખવી અને એમાં બધા ભજ્યા નાખી બોળી રાખવા. જેમ વધુ બોળેલા રહે તેમ વધુ ટેસ્ટી લાગે.





સામગ્રી :- બીટ, વટાણા, કાચા કેળા, આદું મરચાની પેસ્ટ, મીઠું, કોથમીર, રવો

રીત :- કાચા કેળાને બાણીને માવો બનાવવો. એમાં મીઠું આદું મરચાની પેસ્ટ, કોથમીર, બીટના બાકેલા જીણા જીણા ટુકડા, બાકેલા વટાણા. જુથે આપી રવામાં રગ્ડોળીને તળવી. એટલે કટલેટ તૈયાર મીઠી ચટણી, ટામેટો સોસ અને ગ્રીન ચટણીથી ખાવી.



સામગ્રી :- વટાણા, કોથમીર, આદું મરચાની પેસ્ટ, ગરમ ભસાલો, ચપટી સાકર, સૂકી નાળિયેરની ભમણા, લીંબુ અથવા આમૂચર, મેંદો, મોણ, મીઠું

રીત :- વટાણાના કાચા દાણાને મીક્સરમાં પીસી નાખવું પછી કડાઈમાં જરાક તેલ નાખી અંદર આદું મરચાની પેસ્ટ નાખી પૌસેલા વટાણા નાખવા ને મીઠું નાખી શેકવું જરા ૧૦ મીનીટમાં રંધાઈ જાય જરા હુંકુ થવા રાખવું. એમાં કોથમીર સુધારેલી, સાકર, સૂકી નાળિયેર, લીંબુ અથવા આમૂચર, મીઠું, ગરમ ભસાલો નાખી. હુંકે હાથે મીક્સ કરી માવો તૈયાર કરવો. મેંદાના લોટમાં મીઠું, મોણ નાખી લોટ બાંધવું. પછી પૂરી વાહી એમાં આ માવો ભરી ક્યોરીને જેમ વાળી તૈયાર કરી ધીમે તાપે તળવી નહીં તો કાચી રહેશે.



સામગ્રી :- કોથમીર, સૂકુ કોપડું, તેલ, રાઈ, હીંગ, તલ, મીઠું, સંકુ મરચૂ, ઘાણા જુઢાં, હળદર, ખાંડ, લીંબુ, ગરમ ભસાલો, કિસમિસ અથવા કાજુનો ભૂકો, ઘઉનો લોટ, ચણાનો લોટ



રીત :- જે પ્રમાણે ભાખરવડી બનાવવી હોય એ પ્રમાણે સંભાર બનાવવો. પણ સાધારણ રીતે બે વાટકી જીણી સમારેલી કોથમીર હોય, તો બે વાટકી જીણું છીણોલું સૂકુ કોપડું જોઈએ. એક ચમચો તેલ પેણીમાં મૂકી એમાં રાઈ, હીંગનો વધારી કરી કોપડું કોથમીર વધારી હેવા. પા વાટકી જીટલા તલ નાખવા. પ્રમાણસર મીઠું, સંકુ મરચૂ, ઘાણાજુઢાં, હળદર, એકાદ ચમચી ખાંડ નાખવા અને લીંબુ નિયોવવું. ગરમ ભસાલો પણ નાખી શકાય. પછી સંભાર હુલાવવો. કોથમીર સૂક્કાઈ જાય અને સંભાર છૂટો પડે ત્યારે ઉતારવો. બે ભાગ ઘઉનો લોટ અને બે ભાગ ચણાનો લોટ લેવો. તેમાં ભાખરી જેવું મોણ નાખી થોડું મીઠું, હળદર, નાખી ભાખરી માટે જેવો લોટ બાંધો. નાની રોટલી વણવી સૂકુ સંભારો ભરી વીંટો વાળીને ઉપરથી બસોબર બંધ કરી આખો તળવો અને એના નાના ટુકડા કરી ખાવા.



બૂજા બૂજા

સામગ્રી :- દૂધી, ચણાનો લોટ, ઘઉનો લોટ, સાકર, લીંબુ, ગરમ મસાલો, કોથમરી, મીઠું, આદું ભરચાની પેસ્ટ

રીત :- દૂધીને ડીશ કરી દાખીને બધું પાણી કાઢી લેવું. એમાં ચણાનો લોટ અને ઘઉનો લોટ અને ઉપર આપેલ બધી સામગ્રી નાખવી અને હલકે હાથે મૂઠિયા વાળીને બાફવાને ગરમ ગરમ આવા.



બાંસા બાંસા

સામગ્રી :- કાચા કેળા, કોથમીર, નાળિયેરની ખમાણ, આદું, ભરચાની પેસ્ટ, મીઠું, સાકર, લીંબુ, આરાલોટ, ડિસમિસ

રીત :- કાચા કેળાને બાંસીને માવો બનાવવું જરા પણ ટુકડા ન રહેવા જોઈએ એમાં આરાલોટ માવામાં નાખી દેવું. પ્રમાણસર મીઠું નાખવું ને સાઈડમા રાખી દેવું. પછી કોથમરી ઝીણી સુધારવી, નાળિયેરની ખમાણ કરવી, એ બેઉ મીક્સ કરી એમાં ડિસમિસ આદું, ભરચાની પેસ્ટ, સાકર, લીંબુ, મીઠું બધું મીક્સ કરી પછી માવામા ખાડો કરી એમાં પૂરણ ભરવું અને બરોબર પેક કરી તળી લેવું.



બટેટા બટેટા

સામગ્રી :- બટેટા, કોથમીર, નાળિયેરની ખમાણ, આદું, ભરચાની પેસ્ટ, મીઠું, સાકર, લીંબુ, આરાલોટ, ડિસમિસ

રીત :- બટેટાને બાંસી માવો બનાવવું. જરાપણ ટુકડા ન રહેવા જોઈએ, એમા પ્રમાણસર મીઠું નાખવું ને સાઈડમાં રાખી દેવું. પછી કોથમીર ઝીણી સુધારવી, નાળિયેરની ખમાણ કરવી એ બેઉ મીક્સ કરી એમા ડિસમિસ, આદું ભરચાની પેસ્ટ, સાકર, લીંબુ, મીઠું બધું મીક્સ કરી પછી બટેટાના માવાનો બોલ બનાવી એમા ખાડો કરી આ પૂરણ ભરવું અને બરોબર પેક કરી આરાલોટમાં રંગદોળીને તળી લેવું.



ટેક્સી ટેલી (ટેક્સિ)

સામગ્રી :- કાચા કેળા અથવા બટેટા, આદુ મરચાની પેસ્ટ, ચાંદાનો લોટ, કાંદા, કાકડી, કોથમીર, સેવ, ટમેટો, ગ્રીન ચટણી, ખજુરની ચટણી, લસણાની ચટણી, મોનીટા કોન

રીત :- કાચા કેળા અથવા બટેટાને બાંધી અંદર આદુ મરચાની પેસ્ટ નાખવી. ચાંદાના લોટમા પાણી નાખી ઘટ પેસ્ટ બનાવવી. પછી મોનીટા કોન તૈયાર મળે છે એમાં કેળા અથવા બટેટાનું પૂરણ ભરી પેસ્ટ લગાવીને તુરત તળવું અના ઉપર ટમેટો, કાંદા, કાકડીના નાના નાના ટુકડા રાખવા ઊપર મીઠી ચટની, તીખી ચટની, લસણાની ચટની, ઉપર સેવ અને કોથમીર નાખી ખાવું આ ગરમ ગરમ કરી ખાવા, હંડા નરમ થઈ જશે. જમવા બેસો ત્યારે તળવાને ખાવા ફટાફટ થઈ જાય છે. જૈન બનાવવા હોય તો કાચા કેળાનો માવો નાખવો ને કાંદા અને લસણાનો ઉપયોગ ન કરવો તો પણ સારા લાગે છે.



ફેલ્ડ ફેલ્ડ ફેલ્ડ

સામગ્રી :- મગની છલટી દાળ, આખા ધાણા, આદુ મરચાની પેસ્ટ, હિંગ, મીઠું, મરીના દાણા

રીત :- મગની છલટી દાળ પલાળવી. ૬/૮ કલાક પછી કુંડી ઘોકથી પીસીએ તો વધુ સારુ એ ખીરામા મીઠું, હિંગ, આખા ધાણા, મરીના દાણા નાખી ખીરું તૈયાર કરવું જરા અધકયરી પીસીએ તો ભજ્યા વધુ સારા લાગશે. પછી નાના નાના ભજ્યા બનાવી તળવાને મીઠી ચટણી સાથે ખાવા.



ફેલ્ડ ફેલ્ડ ફેલ્ડ

સામગ્રી :- ભકાલો એટલે શાક (અમુક જેના ભજ્યા બનાવી શકીએ), તૂરિયાના, કાકડીના, ડાગરના, સીમલા મરચાના, બટેટાના, કાચા કેળાના, પાંકા કેળાના, ચાંદાનો લોટ, કોથમીર, મરીના દાણા, લાલ મરચું, મીઠું, હિંગ, ધાણા, જીડું

રીત :- ચાંદાના લોટમાં મીઠું, લાલ મરચું, હિંગ, ધાણા જીડું, કોથમરી અને ગ્રમાણસર મરીના દાણા, પાણી નાખી નહીં ઘણું અને નહીં પતલું ખીરું બનાવવું. એમા ઊપર આપેલ શાકના ભજ્યા બનાવી શકાય.





સામગ્રી :- લીલી મેથી, પાકા ગરેલા કેળા, ચાણાનો લોટ, મીહું, લાલ મરચું, ધાણાજીડું

રીત :- ચાણાના લોટમાં લીલી મેથી જીણી સુધારીને નાખવી એમાં પ્રમાણસર પાકા ગરેલા કેળા નાખવા, એમાં મીહું લાલ મરચું, ધાણાજીડું નાખી ખીરું જરા ઘણું કરીને ભજ્યા બનાવવા મીઠી અથવા તીખી ચટની સાથે સારા લાગે.



સામગ્રી :- મગની છેલટી દાળ, ચાણાની દાળ, અણદની દાળ, ફણસી, વટાણા, આદુ મરચા, કોથમીર, મીહું

રીત :- મગની છેલટી દાળ એક વાટકી ભીજવી અને ચાણાની અને અણદની અઠધી અઠધી વાટકી ૬ કલાક ભીજવી. બધી દાળ ભીજાઈ જાય એટલે મીક્સરમાં પીસી લેઈ બધી મીક્સ કરી લેવી. પછી ફણસીના નાના ટુકડા કરવા અને વટાણાને બેઉ સોડા નાખી બાફવા એટલે ગ્રીન કલર જ થાય. પછી દાળના ખીરામાં ફણસી વટાણા નાખવા, આદુ મરચાની પેસ્ટ નાખી, કોથમીર સુધારીને નાખવી. પછી થાળીમાં તેલ ચોપડી આ ખીરું પાથરવું અને ઢોકળાની જેમ બાફવા બફાઈ ગયા છે કે નહીં એમાં ચાકુ નાખવું ખીરું ન ચોટે એટલે થઈ ગયા એમ સમજવું. બાફેલા ગરમ ગરમ સારા લાગે. હંડા થઈ ગયા હોય તો તલ, કઢીપતો, રાઈ, જુરાના વધાર કરી વધારવા ઉપર કોથમીર ભભરાવી અને કાશ્મીરી લાલ મરચું નાખવું. મગની છેલટીદાળ વધુ હોય તો ઢોકળા ગ્રીન કલરના થાય નહીં તો પીળા થાય.



સામગ્રી :- મગની છેલટીદાળ, મીહું, આદુ મરચા, કોથમરી

રીત :- મગની છેલટીદાળને મીનીમ ૬/૮ કલાક પલાળવી પછી અને ઘોરી છલટા કાઢી દાળને કુંડી ઘોકામાં પીસવી. ખૂબ એકરસ પીસવી. પછી એમાં હીંગ, મીહું, આદુ, મરચાની પેસ્ટ નાખવી. એક તપેલી લઈ એમાં પાણી નાખી ગેસ પર મૂકવું અને તપેલીના માપનો છીબો લેવા પહેલા ૧ મીનીટ ઉધો ઢાંકવું પછી સીધું કરી ખીરું પાથરવું અને કોથમરી ભભરાવી અને છીબુ ઢાકવું અને ૫ થી ૭ મીનીટમાં ઢોકળા તૈયાર. તવીતાથી કાપા પાડી ગરમ ધી સાથે ખાવું. બીમાર માણસ માટે આ ઢોકળા ખૂબ સારા.





સામગ્રી :- અજમાના પાન, મૂળાના પાન, મેથીના પાન, કોથમીરના પાન, લીલા કાંદાને પાન, ચણાનાનો લોટ, મીઠું, લાલ મરચું, ઘાણાજું.

રીત :- ચણાના લોટમાં મીઠું, લાલ મરચું, ઘાણાજુંને પાણી નાખી ખીરું બનાવું પછી જે જે પાનના ભજ્યા બનાવવા હોય એ પાન બોડી બોડીને તળવા એટલે ભજ્યા તૈયાર સાથે મીઠી અને તીખી ચટણી બનાવવી.



સામગ્રી :- બ્રેડ, બટેટા, કોથમીર, વધાર માટે રાઈ, જીરું, લસણ, પીસેલા મરચા

રીત :- બટેટા વડાનો માવો બનાવી બ્રેડને પાણીમાં બોળી હલકા હાથે બોળી પાણી કાઢી માવો નાખી રોલ વણવો ને ધીમા તાપે તળવું.



સામગ્રી :- બટેટા, વટાણા, કુદીનું, કોથમીર, ગ્રીન મરચા, આમચૂર, પીસેલા મરચા, મીઠું, મેંદો

રીત :- બટેટાને બાફી સ્મેસ કરવા એમા બાફેલા વટાણા નાખવા પછી કુદીનું, કોથમીરને મરચા લીંબુ, મીઠુંની ચટણી નાખવી. આમચૂર નાખવું, મેંદાનો લોટ બાંધી. પૂર્ણવાળી વચ્ચમા ખાપા વાળી માવો ભરી સમોસાનો શેપ આપી તળીને ખાવું. મેંદાને ઘઉને મીક્સ કરી લોટ બાંધવું ને પછી મોટી મોટી રોટલી જેવી કાચી પાકી શેકીને રાખી દેવી. પછી વચ્ચમા કટ કરી સમોસાનો શેપ આપી લાઈથી ચીટકાવવું અને ધીમે તાપે તળવા.



સામગ્રી :- ભાત, દહીં અથવા ખાટી છાસ, લાલ મરચું, ચણાના લોટ, મીઠું પ્રમાણસર, હળદર, ઘાણા જું.

રીત :- ભાતમાં બધો મસાલો નાખવો. તેમાં ચણાના લોટ મીક્સ કરી ખીરું તૈયાર કરવું એક વાસણમાં તેલ ગરમ કરી નાના નાના ભજ્યા મૂક્ખવાં. ભાત વધારે પડી હોય તો તેનો ઉપયોગ ભજ્યા બનાવવા કામ આવી જાય. એમાં કાંદાના ટુકડા નાખવા હોય તો નખાય.





સામગ્રી :- ચાણાનો જડો લોટ, ઘઉનો જડો લોટ, વાટેલા લીલા મરચા, ચાપટી હિંગ, મરીનો ભૂફો, તજનો ભૂફો, લવિંગનો ભૂફો (યા ગરમ મસાલો), હળદર, લાલ મરચું, ખાંડ, તેલ, મીઠું

રીત :- એક વાસણમાં બને લોટ ભેગા કરવા. તેમાં મીઠું વાટેલા લીલા મરચાં, હિંગ, મરીનો ભૂફો, ગરમ મસાલો, ખાંડ નાખવાં, પાણી નાખી ખીનું તૈયાર કરવું એક વાસણમાં તેલ ગરમ કરી. ગરમ તેલમાં ગોટા મૂકવા. ધીમા તાપે તળવા એટલે ગોટા વચ્ચેમાં કાચા ન રહે.



સામગ્રી :- મગની દાળ, લાલ મરચું, વાટેલા લીલા મરચા, હળદર, ગરમ મસાલો, લીંબુ નોરસ, બુનું ખાંડ, કાજુના ટુકડા, દ્રાક્ષ, મેંદી અને ઘઉનો લોટ, તેલ પ્રમાણસર, મીઠું પ્રમાણસર

રીત :- મગની દાળ ૨ કલાક પાણીમાં પલાણી, ચાળણીમાં મૂકી. ફૂકરમાં અધકચરી બાફવી. બાફેલી દાળમાં બધો મસાલો નાખવો અને બરાબર હલાવવી. પૂરણ હુંકું કરવું, મેંદામાં મીઠું અને તેલ નાખી પૂરી જેવો લોટ બાંધવો. લોટના નાના લુચા કરી, પૂરીબણી, મગની દાળનું પૂરણ ભરી કચોરી વાળવી. ગરમ તેલમાં કચોરી તળવી.



ફોટો (I)

સામગ્રી :- ખાટા ઢોકળાનો લોટ, ખાટી છાસ, મેથીના દાણા

રીત :- ખાટી છાસ નવશેડી ગરમ કરી મેથીના દાણા નાખી ખાટા ઢોકળાનો લોટ નાખી આથો હેવો. જ્યારે આથો આવે એટલે એમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ હળદર કોથમીર, વટાળા નાખવા હોય તો. નોનસ્ટીક પેનમાં તેલ નાખી. રાઈ જરા તલનો વધારી કઢીપત્તો, કોથમરી નાખી એક મોટો ચમચો આથો નાખી ઉપર ઢાંકી હેવું. મીડિયમ ગેસ રાખવું પછી બીજુ બાજુ ઉથલાવું અને ૫ મિનીટમાં હંડવો તૈયાર. નાના નાના હંડવો બનાવાથી વચ્ચેમાં કાચો ન રહે.



બાજુદાં | પાણિયાં

સામગ્રી :- જડા પૌંચા, મીઠું, લીંબુ, સાકર, કઢીપત્તો, કોથમીર, તેલ, રાઈ, જીરુ, ટમેટો, હળદર, વટાણા



રીત :- જડા પૌંચાને ચાણીને થોડીક વાર પાણીથી ધોઈ પાણી કઢી એમજ રહેવા દેવા ૧૦ મિનીટ પછી પૌંચાની ઉપર મીઠું, સાકર, લીંબુનો રસ, કઢીપત્તો, કોથમરી સુધારેલી ટમેટાના નાના ટુકડા નાખવા અને કાઈમાં તેલ નાખી રાઈ, જીરુ અને હળદર વટાણા નાખી પછી ઉપર પૌંચા નાખવા ને હલકે હાથે હલાવવા. ઉપર સેવ નાખી ખાઈ શકાય.

બાજુદાં પાણિયાં

સામગ્રી :- ચોખાનો લોટ ૧ કપ, વાટેલા લીલા ભરચાં, જીરું, તેલ, ખારો અથવા ખાવાના સોડા, મીઠું



રીત :- ૧ કપ લોટ હોય તો દોઢ કપ પાણી ગરમ કરવું. પાણી ઉકળે ત્યારે તેમાં વાટેલા ભરચાં, જીરું, ૨ ટી.સ્પૂન તેલ અને ખાવાના સોડા નાખવા ગઠા ન થાય એ માટે તેલ નાખવું જરૂરી છે. લોટ નાખી ઢાંકી દેવું. ૫ મિનિટ પછી વેલાણથી બરાબર હલાવી. ઘીમા તાપે સીજવા દેવું. ગરમ ગરમ તેલ અને લાલ ભરચા સાથે પીરસવું.

સૂક્ષ્મ નાટ્યા

- ચેવડો (જીણા પૌંઆનો)
- તીખા ગાંઠિયા
- ચકરી (૧)
- ચકરી (૧)
- મેથી મસાલા પૂરી
- ભેલની પૂરી
- ગોપા પૂરી
- કાચા કેળાની વેફર
- તળેલી ચણાની દાળ
- (જડા પૌંઆનો) ચેવડો
- ગાંધ્યા સક્કરપારા
- સલોની
- મકાઈનો ચેવડો
- બાજરીના વડા

ચાંદ (ચાંદિયા, ચાંદિયા)

સામગ્રી :- જીણા પૌંચા, દાળિયાની દાળ, શીંગ, કઢીપતો, મીઠું, હળદર, પીસેલી સાકર, સ્કૂક કોપરાની કાતરી, કાજુના ટુકડા, કીસમીસ



રીત :- પૌંચાને તહે સૂકી નાખવા. પછી ખાલી કડાઈમાં શેકવા. જરા કડક થાય એટલે ઉતારી એક થાળીમાં રાખવા. પછી કડાઈમાં તેલ નાખી એમાં શીંગ નાખવાને કઢીપતો નાખવો. બરોબર તળાઈ જાય એટલે દાળિયાની દાળ નાખવી જરાક ભાઉન થાય એટલે મીઠું, હળદર, કાજુના ટુકડા અને કિસમિસ નાખી ઉપર પૌંચા નાખી મીઠું અને પીસેલી સાકર નાખી હુલકે હાથે હલાવવું.

ચાંદિયા (ચાંદિયા)

સામગ્રી :- ચાણાનો લોટ, મીઠું, લાલ ભરચું, અજમો, તેલ



રીત :- ચાણાના લોટમાં મીઠું, લાલ ભરચું અને અજમો નાખી લોટ બાંધવો. પછી ગાંધિયા પાડવાના સંચાથી ગાંધિયા પાડવા અને સેવ પાડવી હોય તો અજમો ન નાખવો.

ચાંદિયા (૧)

સામગ્રી :- ઘઉનો લોટ, મીઠું, જીરું, પીસેલા ભરચા, તેલ



રીત :- ઘઉનો લોટ એક ટુકડામાં કાઢી કુકરમાં પોટલી બાંધી બાફવો અને પછી હંડુ કરી ચારણીથી ચાળી એમાં મીઠું, જીરું, પીસેલા ભરચા, તેલ નાખી લોટ બાંધવો અને પાટલા ઉપર ચકરી પાળી તેલમાં તળી લેવી.

ચાંદિયા (૨) (Instant)

સામગ્રી :- જુવારનો લોટ, મીઠું, જીરું, પીસેલ ભરચા, તેલ



રીત :- જુવારના લોટમાં મીઠું, પીસેલા ભરચા અને જીરું નાખી લોટ બાંધવો અને પછી ચકરી સીધી કડાઈમાં તળવી.

ચાંદિયા (૩)

સામગ્રી :- મેથીની ભાજુ, ઘઉનો લોટ, પીસેલા ભરચા, મીઠું, તેલ, મોણ



રીત :- ઘઉનો લોટ લેવો એમાં મેથીની ભાજુ સુધારી નાખવી. એમાં પીસેલા ભરચા, મીઠું, તેલ, મોણ એ બધું નાખી લોટ બાંધવો અને નાની નાની પૂરી વળવી અને કાપા પાડી થોડીવાર પેપર ઉપર સ્કૂકવીને પછી મીડીયમ તાપે તળવી.

બાજુરા

સામગ્રી :- મેંદા અથવા ઘઉંનો લોટ, મીઠું

રીત :- ઉપર આપેલ લોટ લઈ એમાં મીઠું નાખવું અને ગરમ પાણીથી લોટ બાંધવું અને નાની નાની પૂરી નાખવી કાપા પાડવા અને મીડીયમ તાપ પર તળવી.



બાજુરા ભૂજા

સામગ્રી :- મેંદાનો લોટ, મીઠું, મરીનો ભૂજો જાડો

રીત :- મેંદાના લોટમાં મીઠું, મોણા અને મરીનો જાડો ભૂજો નાખવો અને ગરમ પાણીથી લોટ બાંધવું અને વળી કાપા પાડવાને પેપર પર સૂક્ષ્મવી પછી મીડીયમ તાપ પર તળવી એકદમ (કરકરી) થાશો.



બાજુરા ચાંદા

સામગ્રી :- કાચા કેળા, મીઠું, તેલ, મરીનો ભૂજો

રીત :- કાચા કેળાને છોતીને કેળાની ખમણીથી કેળાની ચીપ્સ તેલમાં પાડવી એમાં મીઠાવાળું પાણી નાખવું એટલે વેફર કડક થાય. પછી ઢંડી થાય એટલે મરીનો ભૂજો લંબેરવો.



બાજુરા ચાંદા પણ

સામગ્રી :- ચાણાની દાળ, મીઠું, લાલ મરચા, હળદર, સોડા

રીત :- ચાણાની દાળને રાતે સોડા નાખી પલાળવી. પછી સવારે ચાળણીમાં પાણી કાઢીને નિતારી પછી એક કપડા ઉપર સૂક્ષ્મવી. પાણી સોસી લે જ્યારે કોરી લાગે ત્યારે મીડીયમ તાપ પર તળવી બધી તળાઈ જાય ત્યારે મીઠું, લાલ મરચું, હળદર નાખી હલકા હાથે ભેળવું અને એરટાઇટ ડબ્બામાં ભરવી.



બાજુરા પણ (ચાંદા)

સામગ્રી :- જડા પૌંચા, મીઠું, મરચું, હળદર, તેલ, કઢીપત્તો, શીંગ

રીત :- જડા પૌંચાને તેલમાં ઝારાથી તળી લેવા ને એક થાળીમાં રાખવા. પછી બધા તળોલા પૌંચા ઢંડા થઈ જાય એટલે મીઠું, લાલ મરચું, હળદર નાખી હલકે હાથે ભેળવવું. એમાં તળોલા શીંગ અને કઢીપત્તો પણ નાખી શકાય.



ચેંદ્ર પાણી (લોટ)

સામગ્રી :- મેંદો, ધી, ખાડ અથવા સાકરની ચાસણી, તેલ

રીત :- મેંદાના લોટમાં ધીનું મોણ નાખવું અને જોઈતા પ્રમાણમાં પાણી લઈ તેમાં ખાડ ઓગાળવી. એ ખાડના પાણીથી લોટ બાંધી મોટી રોટલી-જડી કે પાતળી જેવી જોઈએ તેવી વણીને સક્કરપારા પાડી ધીમા તાપે તળી લેવા. ક્યારેક સાકરની ચાસણી વધી હોય એ પણ એ માટે વાપરી શકાય.



ચેંદ્ર મીઠું

સામગ્રી :- મેંદો, મીઠું, મોણ

રીત :- મેંદાનો લોટ લેવો એમાં મીઠું અને મોણ નાખી ગરમ પાણીથી લોટ બાંધવો. જડી રોટલી વણી એમાં લાંબી લાંબી કાપી તળી લેવી. ધીમા તાપે તળવી.

ચેંદ્ર માર્ગી

સામગ્રી :- મકાઈ પૌંચા, મીઠું, લાલ ભરચું, શીંગ

રીત :- મકાઈ પૌંચા તળી લેવાને સાઈડમાં રાખવા. એમાં મીઠું, લાલ ભરચા અને તળેલા શીંગ નાખવા. કઢીપત્તો તળેલો નાખવો પછી હલકે હાથે ભેરવું.



ચેંદ્ર માર્ગી લોટ

સામગ્રી :- બાજરાનો જડો લોટ, ઘઉનો ઝીણો લોટ, લાલ ભરચું, હળદર, ધાળા, જુંદ, ગરમ ભસાતો, ખાડું દહી, તલ, અજમો, ધાળા, લીલા ભરચા, મીઠું

રીત :- પાણી ગરમ કરવું. બંને લોટ લેગા કરી તેમાં બધો ભસાતો નાખવો. ભરચા વાટીને નાખવા. ૨ ટેબલ સ્પૂન તેલ પાણી અને સાજીના કૂલ ગરમ કરીને નાખવા. ગરમ પાણીથી કઠણ લોટ બાંધવો. નાના લુંચા લઈ, પાણીથી થેપી, વડા કરવા અને ગરમ તેલમાં તળવા.



રોજિંદા ગરમ પીણા

- ઉકાળો
- મસાલાવાળો દૂધ
- એલચીવાળો દૂધ
- હળદરવાળો દૂધ
- કોફી
- ગુંદરની રાબ
- મગનું પાણી
- બાજરાના લોટની દૂધવાળી રાબ
- બાજરાના લોટની છાસવાળી રાબ
- ગોળવાળી ઘઉંના લોટની રાબ
- અસેરિયાવાળી રાબ
- તજ લવિંગનો કાળો
- ચાય
- અજમાનો કાળો
- આરાઝટના લોટની કંચ
- સૂંઠની રાબ

ગરમ પીણા



(બે માણસો માટે)

સામગ્રી :- દૂધ એક કપ, ચાનો મસાલો ચપટી, પાણી અદદો કપ,
સાકર ૪ ચમચી

રીત :- અદદું દૂધ અને અદદું પાણી એમાં ચાનો મસાલો અને સાકર
નાખી ઉકાળવું અને ગાળીને પૌંવામાં ઉપયોગ કરવું.



(ચાર માણસો માટે)

સામગ્રી :- દૂધ ૫ કપ, સાકર ૧૦ ચમચી, પીસ્તા, બદામ, એલચી,
કેસર

રીત :- દૂધમાં સાકર નાખવી અને ઉપર આપેલ ડ્રાયફૂટ પીસીને
નાખવું હોય તો પણ ચાલે. આ ડ્રાયફૂટને મિક્સરમાં પીસી એક ડિબ્બા
ભરી ફીજમાં મૂકવું. અચાનક બનાવું હોય તો આ મસાલો નાખી
મસાલાવાળો દૂધ તૈયાર (સાકર મીઠાશ જોઈએ એટલી)



સામગ્રી :- દૂધ ૧ કપ, સાકર બે-ત્રણ ચમચી, એલચી જયફળનો
ભૂલો

રીત :- દૂધમાં સાકર નાખી. એલચી જયફળનો ભૂલો નાખી ઉકાળવું
અને રાતે પીવા સાંનું.



સામગ્રી :- દૂધ ૧ કપ, સાકર પા ચમચી, હળદરની ભૂડી

રીત :- દૂધમાં સાકર નાખી. હળદર ચમચી નાખી ઉકાળવું અને ગરમ
ગરમ પીવું.



સામગ્રી :- કોફી (Nescafe), દૂધ ૧ કપ, સાકર ૨ ચમચી, પાણી
પ્રમાણસર પા કપ

રીત :- દૂધમાં સાકર અને પ્રમાણસર પાણી નાખવું હોય તો, એમાં
કોફીની ભૂડી નાખી ઉકાળવું અને ગાળીને પીવું. કોલ કોફીમાં હંડો દૂધ
લઈ કોફી નાખી બોસમાં ફરાવવું.





સામગ્રી :- ગુંદર, સાકર, એલચીનો ભૂંકો, બહામ

રીત :- ગુંદરને કડાઈમાં કોરી શેકવી અને એક થાળીમાં કાઢવી. એક કડાઈમાં થોડું ધી નાખવું અને શેકલો ગુંદર જે કુલેલું હોય અને વાટકાથી ચચરી નાખવું અને ધીના વધારમાં નાખી ઉપર પાણી ને સાકર નાખી હલાવવું, એલચીનો ભૂંકો નાખવું અને બહામ કાતરી નાખવી.



(ચાર માણસો માટે)

સામગ્રી :- મગ, ગોળ, જીરું, લીમડો, મરચં

રીત :- મગને છૂટા બાઝી જે પાણી નીકળે તેને એક તપેલીમાં કાઢવું અને એક કડાઈમાં તેલ નાખી જરાનો વધાર કરવો. એમાં કઢીપત્તો અને કોથમીર, ગોળ નાખી મગનું પાણી બનાવવું.



એક માણસ માટે

સામગ્રી :- બાજરાનો લોટ બે નાની ચમચી, દૂધ એક વાટકો, મીઠું, પાણી પા વાટકી

રીત :- એક નાની તપેલીમાં પ્રમાણસર પાણી લઈ એમાં બાજરાનો લોટ નાખી હલાવવું ગાડા ન રહેવા જોઈએ એમાં મીઠું અને દૂધ નાખી હલાવવું અને ગાળીને પીવું. આ રાબ સુવાવડ પ્રસંગે અથવા શરદી થઈ હોય તો બહુ જ સારી.



સામગ્રી :- બાજરાનો લોટ ૨ ચમચી, મીઠું, છાસ (મોણી) ૧ વાટકો, પાણી પા વાટકી

રીત :- એક નાની તપેલીમાં પ્રમાણસર પાણી નાખવું. એમાં બાજરાનો લોટ નાખી હલાવવું ગાડા ન રહેવા જોઈએ એમાં મીઠું અને છાસ નાખી હલાવવું અને ગાળીને પીવી ગરમ ગરમ પીવાથી શરદી ઓછી થઈ જાય અને સુવાવડવાળી માટે તો વધુ સારી.



બાળ રસથાળ

સામગ્રી :- ઘઉનો લોટ, ગોળ, ધી
રીત :- એક કડાઈમાં ધી નાખી ઘઉનો લોટ શેકવો એમાં પાણી અને ગોળ સુધારીને નાખવો આ રાખ જરા ઘટ કરવી.



બાળ રસથાળ

સામગ્રી :- અસેરીયો, દૂધ, સાકર, એલચીનો ભૂકો
રીત :- ખાલી પાણીમાં અસેરીયો ઉકાળવો, બીજી તપેલીમાં દૂધમાં સાકર અને ઉકાળેલો અસેરિયો નાખી ઉકાળવું. એલચીનો ભૂકો નાખવો. ગરમ ગરમ પીવી.

બાળ રસથાળ

સામગ્રી :- તજ, લવિંગ, ગોળ, પાણી બે વાટકા
રીત :- એક તપેલીમાં પાણી લેવું એમાં તજ, લવિંગના ટુકડા નાખવા અને ગોળ નાખી ઉકાળવું. ખૂબ ઉકાળવું અને ગાળીને પીવું. શરહી અથવા તાવ આવ્યો હોય તો આ કાળો બહુ જ સારું.



ચાર માણસ માટે

સામગ્રી :- ચાય પાન, ૪ ચમચી, ચાય હરીપતી પાન, સાકર, ૨ વાટકા દૂધ, પાણી બે વાટકી, કેસર, ઈલાયચી

રીત :- દૂધ, પાણી, સાકર, પાન, એલચી, કેસર નાખવી હોય તો, ચા મસાલો બધું મીક્સ કરી ઉકાળવું. બરોબર ઉકાળીને ટેસ્ટ કરી લેવું. સાકર જેવી મીઠી ચા જોઈએ તેટલી અને પાન જેવી કડક જોઈએ એવી.





(એક માણસ માટે)

સામગ્રી :- અજમો, ગોળ, પાણી

રીત :- એક તપેલીમાં પાણી લઈ એમાં અજમો નાખી, ગોળ નાખી ઉકાળવું અદ્યા અડધ થાય, ત્યાં સુધી ઉકાળવું અને ગરણીથી ગાળીને પીવો આ કાળો (generally) સુવાષડવાળીને સવારે અને રાત્રે જરૂર હોય તો અપાય.



સામગ્રી :- આરાડટ, દૂધ, ખાંડ, જુદું, મીઠું

રીત :- અડધા કપ પાણીમાં એક નાની ચમચી આરાડટનો લોટ બરોબર ભેળવી દેવો અને અડધો કપ દૂધ નાખી ઉકાળવું. પ્રમાણસર ખાંડ નાખવી. એમાં જુદું, મીઠું નાખી શકાય. એકલા પાણીમાં પણ એ બનાવી શકાય. આ કાંજુ ખાસ કરીને જેને ઝાડા થયા હોય તેને માટે સારી.



(ચાર માણસો માટે)

સામગ્રી :- સુંહનો ભૂકો, ધી, ગોળ, પાણી, એલચી, બદામ, કેસર

રીત :- ચાર કપ રાબ કરવી હોય તો એક મોટો ચમચો સુંહનો ઝીંડો ભૂકો લેવો અને બે ચમચા ધીમાં થોડો શેકી લેવો અને પછી પાણી નાખવી. તેમાં પ્રમાણસર ગોળ નાખવો. બે-ત્રણ એલચીનો ભૂકો નાખવો અને બદામ પણ નાખી હોય તો નાખવી. ગમે તો અડધી ચમચી પીપરામૂળનો ભૂકો અને અડધી ચમચી ભરી પણ નાખી શકાય. થોડું કેસર પણ નાખી શકાય. આ રાબ શરદી માટે સારી પણ વારંવાર પીવી નહિ. કેમકે ઘણી ગરમ પડે છે. જે દેશમાં ખૂબ હંડી પડતી હોય ત્યાં આ રાબ પીવાથી શરીરમાં ગરમાટો રહે છે.



તાજ અથાણાં (Instant)

- કેરી-મેથી
- ટીડોમાં-મેથી
- કાકડી-મેથી
- કોબીના ડાઇ

તાજ અથાણાં (Instant)

- સામગ્રી અને રીત આશરે
-

ઘોંઠાં

૧ કાચી કેરીને છોલીને નાના ટુકડા કરી તેમાં ૨ ટી-સ્પૂન મેથીનો ભસાલો અને ૧ ટેબલ સ્પૂન તેલ નાખી મિક્સ કરવી.



ટીડોળા-ઘોંઠાં

ટીડોળાને ગોળ સમારીને તેમાં મેથીનો ભસાલો અને તેલ નાખી મિક્સ કરવો.



ઘોંઠાં+ઘોંઠાં

કાકડીને ગોળ સમારીને તેમાં મેથીનો ભસાલો અને તેલ નાખી મિક્સ કરવી.



ઘોંઠાં ડાઢ

મેથી, કોખીના ડાઢાને જીણા સુધારી એમાં મેથીનો ભસાલો, તેલ નાખી મિક્સ કરવું. મેથીનો ભસાલો એટલે અથાણામાં સંભાર નાખીએ, એ ભસાલો વાપરીએ.

લીલા મરચાના અથારાં

- મરચાનો ઠેસો
 - આથેલા મરચા
 - ચાણાના લોટવાળા લીલા મરચા
 - સીમલા મરચાના સંભારીયા
 - ખમણું મરચા
 - સાંતળેલા મરચા
-

ચામગ્રી રસ

સામગ્રી :- લીલા મરચા, મીઠું, લસણ

રીત :- લીલા મરચાં, મીઠું અને લસણાની કણી બધું નાના બાઉલમાં ગ્રાઇન્ડ કરી પછી રાઈ જીરાનો વધાર કરવો આ લસણવાળો ઠેસો બાજરાના રોટલા આગળ ખવાય. શીયાળામાં ખવાય, ગરમ ન લાગે.



ચામગ્રી રસ

સામગ્રી :- આથવા જેવા મરચા પા કિલો, રાઈના કુરિયા ૧૦૦/૧૦૦ ગ્રામ, મેથીના ફાળા, તેલ, લીંબુ, સાકર, ગોળ, હળદર, મીઠું, મરીના દાણા

રીત :- મરચાને લાંબા ચીરી બે કટકા કરવા બધાને મીઠું નાખી ચોળવા એટલે બી બધા નીકળી જશો. પછી એમાં રાઈના કુરિયા, મેથીના ફાળા, તેલ, સાકર પ્રમાણાસર અને ગોળ, હળદર, મરીના દાણા અને લીંબુનો રસ બધું મીક્સ કરી હલકે હાથે ભૂસવું અને ૧ દિવસ બહાર રાખવું જેથી ગોળ ઓગળી જાય પછી બરણી ભરી ફીજુમાં રાખવું એટલે મરચાનો ગ્રીન કલર જ પડ્યો હોય.



ચામગ્રી રસ

સામગ્રી :- ચાણાનો લોટ, લીલા મરચા, મીઠું, હળદર, લીંબુ, સાકર, તેલ, રાઈ, જીરા, હીંગ

રીત :- એક કડાઈમાં તેલ જરા વધારે લેવું. એમાં રાઈ, જીરાનો વધાર કરવો. એમાં હળદર નાખવી, હીંગ નાખવી વધાર કરવું તળ તળ આવજ આવે એટલે મરચાના ટુકડા, સાકર, લીંબુનો રસ, મીઠું ને પાણી પ્રમાણાસર નાખવું. પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાણાનો લોટ નાખતા જાવ ને ચમચાથી હલાવતા જાવ કડાઈથી ગઠો છુટો થઈ જાય એટલે મરચા તૈયાર.





સામગ્રી :- સીમલા મરચા, ચણાનો લોટ, લાલ મરચા, હળદર, મીઠું, ગરમ મસાલો, થોડુંક મોણ, સાકર, લીંબુ, સૂકી ખમણા, શિંગાણાણાનો ભૂકો



રીત :- ચણાના લોટમાં ઉપર આપેલ બધી સામગ્રી નાખી હલકે હાથે ભેળવવું ન જેવું કડાઈમાં લોટ રેકવું પછી સીમલા મરચાના બે ટુકડા કરી અંદરથી બીયાં કાઢી નાખવા અને લોટ ભરી બાફવા. બફાઈ જાય એટલે હંડા કરવા. પછી કડાઈમાં વધાર કરી ઉપર સૂકી ખમણા, કોથમીર નાખી બાઉલમાં કાઢવા.



સામગ્રી :- ખમણા નાળિયેરની, સાકર, મીઠું, લીંબુ, હળદર, રાઈ, જીરું, લીલા મરચાં

રીત :- નાળિયેરની ખમણા કાઢી તૈયાર કરવી. કડાઈમાં તેલ નાખી રાઈ જીરનો વધાર કરવો. હળદર નાખવી એમાં લીલ મરચાના નાના નાના ટુકડા નાખવી એમાં લીંબુનો રસ, મીઠું નાખવું ને નાળિયેરની ખમણા નાખી હલાવવી. ખમણાવાળા મરચા તૈયાર.



સામગ્રી :- લીલા મરચાં, તેલ, રાઈ, જીરું, મીઠું, હળદર, ઘાણાજીરું



રીત :- સાંતળવા જેવા મરચા લેવાં. વધાર માટે થોડું તેલ કડાઈમાં લેવું એમાં રાઈ, જીરું, હળદરનો વધાર કરવો એમાં મરચાં નાખી સાંતળવા. બાઉલમાં કાઢી ઉપર ઘાણાજીરું નાખવું.



બારમાસી અથારાં

- ગૂંદાનું અથારાં
- ગાયું અથારાં
- કેરીનું અથારાં
- કેરીનો છુંદો
- આંદું, હળદર અને લીંબુનું અથારાં

બૂજું રસ

સામગ્રી :- ગુંડા ૨૫૦ ગ્રામ, ૨ ટેબલ સ્પૂન મેથીનો મસાલો, ૧૦૦ ગ્રામ તેલ, ૧ કેરી

રીત :- મેથીના મસાલામાં ૧ કેરી છીણીને નાખવી. ગુંડાના ઠળિયા કાઢવા અને મસાલો ભરવો. તેલમાં ગુંડા વધારવા. ધીમા તાપે થવા દેવા, ચડી જાય એટલે ઉતારી લેવા.



અથાણું દસેક દિવસ રહે છે. વધારે સમય રાખવું હોય તો ભરેલા ગુંડાં બરણીમાં મૂકી. તેમાં ગરમ કરી ઠંડું પાડેલું તેલ નાખવું. અથાણું દૂબેલું રહે તેટલું તેલ રાખવું.

બાજું રસ

સામગ્રી :- ૩ કિલો કેરી, હળદર, મેથીના કુરિયા, રાઈના કુરિયા, મરચું, હિંગ, ૨ કિલો ગોળ, ખારેક, ખાંડ, સરસિયું

રીત :- રાજાપુરી કેરીને ધોઈને છાલ સાથે ચોચ્ચ માપના નાના ટુકડા કરવા. તેને મીઠા અને હળદરથી ચોળીને એક દિવસ રહેવા દેવા. પછી આ ટુકડા કપડા ઉપર પહોળા કરી ર થી ૩ કલાક સુકવવા દેવા. એક કથરોટમાં વચ્ચે મીઠું તેના ફરતે મેથીના કુરિયા, પછી રાઈના કુરિયા, તેને ફરતે સહેજ મરચું, હળદર, હિંગ, નાખવા સરસિયું ગરમ કરી કથરોટમાં વચ્ચે નાખવું. બધો મસાલો ભેગો કરવો.




મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂકો, ખાંડ, મરચું અને કેરીના ટુકડા નાખવા. અછવાડિયા સુધી હલાકતા રહેવું. મીઠા, હળદરનું જે પાણી વધે તેમાં ડાંડા કાઢીને ખારેક નાખવી. બરાબર કુલી જાય એટલે ઠળિયા કાઢી ઊભી ચીરી કરી અથાણામાં નાખવી.

બાજું રસ

સામગ્રી :- કાચી કેરી, મેથીના કુરિયા, મીઠું, હિંગ, લાલ મરચાનો ભૂકો, હળદર, તેલ

રીત :- પહેલા કેરીને ધોઈ બરાબર લૂણીને દરેકના આઠ-આઠ ટુકડા કરો. મેથીને શેકીને ઢળી લો હવે કેરીના ટુકડા હીંગ, મરચું, હળદર, મીઠું, ઢળેલી મેથી બધું એક બરણીમાં બરાબર મીક્સ કરીને ઢાંડી રાખો. બીજા દિવસે તેલ બરાબર ગરમ કરી, ઠંડું થાય એટલે કેરીના ટુકડામાં રેડી દો. આ અથાણું વર્ષો સુધી ઉપયોગમાં લઈ શકાય છે.



ાંણ તુંબા

સામગ્રી :- ૨ કિલો કાચી કેરી, ૨ કિલો ખાંડ અથવા ગોળ, જુરું, હિંગ, મીઠું, લાલ મરચનો ભૂકો



રીત :- પહેલા કેરીને ધોઈને લૂછીને એની છાલ ઉતારી છીણી નાખો. છીણીને હથેળીથી દબાવીને કેરીનું પાણી નિતારી લો. હવે કેરીની છીણા, હિંગ, મીઠું, મરચું, જીરાનો ભૂકો, ખાંડ અથવા ગોળ ભેળવી બરણીમાં ભરી ઉપર મલમલનું કપડું બાંધી હો. આ છુંદાને અઠવાડિયા સુધી તડકામાં રહેવા હો. જ્યારે ખાંડની ચાસણી બની જાય અને છીણનો રંગ સોનેરી બને ત્યારે છુંદો તૈયાર થઈ ગયો છે એમ સમજવું. આ છુંદો બાળકોને ખૂલું ભાવે છે.

ાંણ ટુંબા ટાંકું ટુંબા

સામગ્રી :- ૨૦ નંગા લીંબુ, ૧ કિલો લીલી હળદર, આંખા હળદર, લીલું આદુ, લાલ મરચું, હિંગ, ત્રાશ કિલો ખાંડ, મીઠું



રીત :- દરેક લીંબુના ટુકડા કરો. આંદું તથા હળદર છોલીને એના ગોળ ટુકડા કરો. એક કાચની બરણીમાં લીંબુ, આંદું તથા હળદરના ટુકડામાં મીઠું ભેળવીને એક મહિના સુધી ઢાંકીને રહેવા હો. વર્ચ્યે વર્ચ્યે થોડા થોડા સમયે હલાવતા રહેવું. જ્યારે લીંબુની છાલ ગળી જાય. ત્યારે બરણીમાંથી બધું મિશ્રણ કાઢી લો. એનું પાણી જુદું રહેવા હો. બધા ટુકડાને એક કલાક માટે પંખા નીચે કોરા થવા મૂકો. હવે એક સ્ટીલની કથરોટમાં તૈયાર મિશ્રણ, ખાંડ, હિંગ, લાલ મરચું વગેરે સમસ્ત ભેળવી બીજી બરણીના લરો. બરણીને ઢાંકી ત્રાશ-ચાર દિવસ સુધી તડકામાં રાખી મૂકો. આ અથારું એક વરસ સુધી રાખી શકાય છે.

ચટણી

- કોથમીરની ચટણી
 - દાળિયા શીંગની સૂકી ચટણી
 - ચાળાની દાળ અને અડણની દાળની ચટણી
 - લસણાની સૂકી ચટણી
 - કોથમીરને પાલકની ચટણી
 - કોથમીરને કુદ્દીનાની ચટણી
 - લીલાં કોપરાની ચટણી
 - કોપરા લસણાની ચટણી
 - કોપરા કાંદાની ચટણી
 - આમલી/ખજૂર ચટણી
 - કાચી કેરીની ચટણી
 - લસણાની ચટણી
 - પાકા ટમેટાની ચટણી
 - કાચા ટમેટાની ચટણી
 - કોપરા અને ચાળાદાળની ચટણી
 - તલ કોપરાની ચટણી
 - દૂધીની છાલની ચટણી
 - ગાંઠિયાની ચટણી
 - નાળિયેરની ચટણી
 - લાલ મરચાંની ચટણી
 - ભીડાની ચટણી
-

ચટણી



સામગ્રી :- કોથમીર, લીલાં મરચાં, આદુ, લીંબુ, મીઠું

રીત :- કોથમીર જીણી સમારી તેમાં પ્રમાણસર લીલા મરચાં, આદુનો કટકો, થોડું જુંં, પ્રમાણસર મીઠું નાખી. જીણી વાટવી. તેમાં પ્રમાણસર લીંબુ નિયોવવું.



સામગ્રી :- કાચા શીંગા, દાળિયાની દાળ જરા વધુ લેવી, જુંં, લાલ મરચાં, કાશીરી મરચાં, મીઠું

રીત :- કાચા શીંગાને શેકીને ઠંડા કરવા. ઠંડા થાય એટલે છોતરાં કાઢી દાણા સાઈડમાં રાખવા. પછી દાળિયાની દાળને શેકવી. પછી બેઉ મીક્સરમાં ગ્રાઇન્ડ કરવાં. એમાં જુરાનો ભૂડો, લાલ મરચાને મીઠું નાખવવું અને હલકે હાથે મીક્સ કરવું કાશીરી મરચાં નાખવા હોય તો જરાક શેકીને શીંગાને દાળિયાદાળ સાથે પીસવા. એમાં સુંદું ટોપરું અને તલ પણ નાખી શકાય.



સામગ્રી :- ચણાદાળ, અડદાળ (સરખેભાગે લેવી) જુંં, મીઠું, લાલ મરચું

રીત :- ચણાદાળ અને અડદાળ બેઉને ધીમે તાપે શેકવી પછી ઠંડી થાય એટલે એમાં જુંં, મીઠું અને લાલ મરચું નાખી મીક્સરમાં ગ્રાઇન્ડ કરવું. આ ચટણી ઈડલી અને ડોસા અને ઉપમા સાથે ખવાય અને સૂકી ચટણીની જેમ ખવાય.



સામગ્રી :- લસણ, સુંદું ટોપરુંની ખમણ, મીઠું, લાલ મરચાં

રીત :- લસણ ફેલી પીસી નાખવું. પછી એક બાઉલમાં લઈ એમાં સુંકા ટોપરાની ખમણ નાખવી. પ્રમાણસર મીઠું અને લાલ મરચાની ભૂડી નાખી બધું હલકે હાથે મીક્સ કરી બેળવી નાખવું.



સામગ્રી અને રીત

સામગ્રી :- કોથમીર, પાલક ભાજુ, લીલા મરચા, આદુ, લીંબુ, ભાવનગરી ગાંઠીયા

રીત :- કોથમીર અને પાલક ભાજુ બેઠિ ઘોઇ સુધારીને લીલા મરચાં, આદુ, મીઠું, લીંબુ નાખવું અને પ્રમાણસર ભાવનગરી ગાંઠીયા નાખવા. બધું મિક્સરમાં પીસી નાખવું. ગાંઠીયાથી ચટણી ઘણું થાય.



સામગ્રી અને રીત

સામગ્રી :- કોથમીર, કુદ્દિનો, લીલા મરચા, આદુ, લીંબુ, મીઠું, દાળિયા અથવા ગાંઠીયા

રીત :- આ રીત કોથમરી અને પાલકની ચટણીની જેમ ૫ પણ પાલક ને બદલે કુદ્દિનો નાખવો.



સામગ્રી અને રીત

સામગ્રી :- લીંબુ કોપરો (શ્રીઝણ), કોથમીર, લીલા મરચા, આદુ, લીંબુ, મીઠું દહીં, સાકર, દાળિયા

રીત :- કોપરાની ખમણ કરવી, એમાં કોથમરી, લીલા મરચા, આદુ, લીંબુ, મીઠું, દાળિયા, થોડીક સાકર, દહીં નાખવી. પ્રમાણસર મીઠું નાખવું. આ ચટણીને રાઈ, જીરુંને અડફાળનો વધાર કરવો હોય તો કરો અને ચટણી ઈડલી ઢોસા સાથે ખાઈ શકો.



સામગ્રી અને રીત

સામગ્રી :- કોપરો, લસણની કળી, લીલા મરચા, લીંબુ, મીઠું

રીત :- કોપરાની ખમણમાં લસણની કળી, લીલા મરચાં, લીંબુ, મીઠું, નાખવું, કોથમરી નાખવી ને મિક્સરમાં પીસી લેવો. આ ચટણી જરાક પતલી બનાવવી બેડરોલ યા બટેટા વડા સાથે ખવાય.



સામગ્રી અને રીત

સામગ્રી :- કોપર, કાંદા, કોથમરી, લીલા મરચાં, લીંબુ, મીઠું, દાળિયા

રીત :- કોપરાની ખમણમાં કાંદાના નાના નાના ટુકડા કરી એમાં કોથમરી, લીલા મરચાં, મીઠું, દાળિયા, લીંબુ નાખી મિક્સરમાં પીસવી આ ચટણી કચોરી, પેટીસ સાથે ખવાય.



□ □ □ / □ □ □ □ □

સામગ્રી :- ખજૂર/આમલી, જુદું, લીલા મરચા, મીઠું

રીત :- ખજૂરના બી કાઢી કુકરમાં ધોઈ બાફવી. બાફવા મૂકો ત્યારે જ મીઠું, જુદું, લાલ મરચાં નાખી દેવા. ન્યારે હંડી થાય ત્યારે મીક્સરમાં પીસીને ગાળી લેવું ને ડિબ્બો ભરી ફીજુમાં મુકવું ન્યારે બોર્ડ ત્યારે પતલી કરી ખાઈ શકાય. આમલીની બનાવી હોય તો ખજૂરને બદદે આમલી નાખીને બેઉ થોડી થોડી નાખી બનાવવી હોય તો પણ થાય.



□ □ □ □ □

સામગ્રી :- કાચી કેરી, ગોળ, મીઠું, લાલ મરચાં, જુદું, દાળિયા

રીત :- કાચી કેરીના છીલકા ઉતારી લેવા. નાના નાના ટુકડા કરવા. એમાં મીઠું લાલ મરચાં, જુદું, દાળિયા નાખવા હોય તો ગોળ જરા સરખું નાખવું, નહીં તો ખાટી લાગશે. પછી મીક્સરમાં પીસી લેવી. આ ચટણી ફીજુમાં મૂકવી. ઘણા દિવસ બગડતી નથી.



□ □ □ □ □

સામગ્રી :- લસણા, લીલા મરચા, જુદું, મીઠું, ભાવનગરી ગાંઢીયા

રીત :- લસણા ફેલ્લી એમાં લાલ મરચાં, મીઠું, જુદું, ભાવનગરી ગાંઢીયા બધું ભેગું કરી મિક્સરમાં પીસવો ને ડીપ ફીજરમાં ઘણા દિવસ રાખી શકાય. બગડતી નથી. આ ચટણી, ભેળ, રંગડા પેટીસમાં ખવાયને કોઈ શાકમાં વાપરવી હોય તો આ ચટણી નાખી શકાય.



□ □ □ □ □

સામગ્રી :- પાકા ટમેટાં, લીલા મરચાં, મીઠું, દાળિયા, સાકર અથવા ગોળ

રીત :- પાકા ટમેટાંના ટુકડા કરવા અને એમાં મીઠું, દાળિયા, સાકર અથવા ગોળ લાલ મરચયું બધું મીક્સરમાં પોસી લેવું આ ચટણી જરા ઘટ રાખવી અને જરૂર પડે તો ગરણીથી ગાળી લેવી, ટમેટાની છાત ન આવવી જોઈએ. સોસ ખલાસ થઈ ગયો હોય તો emergencyમાં આ ચટણી સારી લાગે છે.



□ □ □ □ □

સામગ્રી :- કાચા ટમેટા, મીઠું, સાકર, રાઈ, જુદું, દાળિયા

રીત :- કાચા ટમેટાના ટુકડા કરી એમાં મીઠું, સાકર, દાળિયા નાખી પીસવા પછી એમાં રાઈ, જુરાનો વધારે કરવો ને પછી ખાવી.





સામગ્રી :- સૂકું કોપરું, ચાણાની દાળ, તલ, મીઠું, તેલ, મરચું, હળદર, ખાંડ, રાઈ, હિંગ, આખા મરચા



રીત :- સૂકું કોપરાને છીણી થોડા તેલમાં શેકી લેવું. ચાણાની દાળને પાણીમાં થોડો સોડા નાખી એક રાત પલાળી રાખી પછી દાળને નીતારી, કોરી કરી તેલમાં થોડી થોડી નાખી તળવી. પછી કોપરાનું છીણ અને ચાણાની દાળ લેગી કરી તેમાં મીઠું, મરચું, હળદર, શેકલા તલ અને થોડી દળેલી ખાંડ નાખી હુલાવી તૈયાર કરવું. થોડા તેલમાં રાઈ, હિંગ અને મરચાનો વધાર કરી ચટણી વધારવી. હંડી પડે એટલે બરણીમાં ભરી લેવી.



સામગ્રી :- તલ, સૂકું કોપરું, કાજૂ, મીઠું, મરચું, હળદર, દળેલી ખાંડ, તેલ, રાઈ, હિંગ, મરચા



રીત :- તલને થોડું પાણી છાંટી દાબી રાખવા પછી કોથળા ઉપર ઘસવા. થોડીવાર કપડાં ઉપર છૂટા કરી જટકી તેના છોડા કાઢી તલ્લાઈ કાઢવી. તેને સાધારણ શેકી લેવી. અથવા તો તલને કોરા શેકવા. કોપરાને છીણી તે છીણને થોડા તેલમાં શેકી લેવું. પછી બન્ને વસ્તુ લેગી કરી તેમાં મીઠું, મરચું, હળદર થોડી દળેલી ખાંડ નાખી તેલમાં રાઈ, હિંગ અને મરચાનો વધાર કરી ચટણીને વધારી લેવી. હંડી પડે એટલે બરણીમાં ભરી લેવી.



સામગ્રી :- દૂધીની છાલ, કોપરાનું છીણ, તલ, શીંગદાળા, ખસખસ, મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ, હિંગ, લીમડાના પાન, અનારદાળા

રીત :- દૂધીની છાલને ઘોઈ કરી લાંબી સમારવી. પછી તેલમાં તળી ચાળણીમાં કાઢી લેવી, જેથી કોરી પડે. કોપરાનું છીણા, ખસખસ અને તલને શેકવા. શીંગદાળાને શેકી, છોતરાં કાઢી ભૂંડો બનાવવો. પછી બધું લેગું કરી, મીઠું, હળદર થોડી દળેલી ખાંડ થોડા વાટેલા અનારદાળા નાખી એક ચમચી તેલમાં રાઈ, હિંગ અને લીમડાના પાનનો વધાર કરી ચટણી વધારવી.



ગાંઠિયા

સામગ્રી :- ગાંઠિયા (પાપડી, ભાવનગરી), લીંબુ, ઘાણાજું, ખાંડ, લાલ મરચું, મીઠું પ્રમાણસર

રીત :- ગાંઠિયાનો ભૂકો કરવો. તેમાં ખાંડ, લીંબુ, લાલ મરચું, ઘાણાજું, મીઠું અને પાણી નાખી મિક્સરમાં ફ્રેન્ચ કરવું.



નાળિયેરની ખમણા

સામગ્રી :- નાળિયેરની ખમણા, મીઠું, લીલા મરચાં, લીમડાના પાન, દાણીયાની દાળ, લીંબુ, સાકર, કોથમીર, દહીં, મોશ, રાઈ, અડદ દાળ, જું, કાશ્મીરી મરચું

રીત :- નાળિયેરની ખમણા અથવા નાના નાના ટુકડા લેવા એમાં ઉપર આપેલ બધું બાઉલમાં નાખી મિક્સરમાં ફ્રેન્ચ વંદું અને એક કાર્ડિમાં તેલ નાખી રાઈ, જું અને અડદાળની દાળનો વધારે કરવો કાશ્મીરી મીરચી નાખી આ ચટણી ઈંડલી, ઢોસા, ખાટા ઢોકળાં અને ફરસાણા સાથે સરસ લાગે.



શેક્લા

સામગ્રી :- લાલ મરચા (કાશ્મીરી), શીંગદાણા શેક્લા (ગાંઠિયા પણ ચાલે), તલ, લીંબુ, મીઠું

રીત :- શીંગદાણાને શેક્લાને ફોરાં કાઢવા અને ભૂકો કરી સાઈડ પર રાખવો. લાલ મરચા (કાશ્મીરી)ને પાણીમાં ૮/૧૦ કલાક પલાળવા અને બાઉલમાં નાખવા. બી કાઢીને પછી તલ, શીંગનો ભૂકો ૪ ગાંઠિયા, લીંબુ અને મીઠું બધું ભેગું કરી મિક્સરમાં પીસવું અને પાણી નાખી જરા ઘડું કરી ફીડરમાં રાખવી. આ ચટણી લેલમાં, શાકમાં, પાઉભાજુમાં નખાય, પેંજબી શાકમાં આ ચટણી નાખવાથી કલર લાલ સરસ આવે છે ને લસણવાળી બનાવી હોય તો લસણ ઉમેરવું.



ભીડા

સામગ્રી :- ભીડા, લીલા મરચાં, અડધો કપ દહીં, અડધો ચમચી હળદર, જું, મેથી પાઉદર, હિંગ, મીઠું, તેલ

રીત :- ભીડાને ઘોર્ડ લુછી નાખો. ગરમ તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળો. લીલાં મરચાં તળીલો. દહીં સિવાય બધા મસાલા, ભીડા તથા મરચાંને લેળવી ગ્રાઇન્ડરમાં પીસી લો. તેમાં દહીં અને મીઠું નાખો. ચટણી તૈયાર છે. ભાત તથા રોટલી સાથે પીરસી શકાય.



રાયતા

- બુંદીનો રાયતો
 - ફુટનો રાયતો
 - કંદાનો રાયતો
 - બીટનો રાયતો
 - કાકડીને ટમેટોનો રાયતો
 - પાકા કેલાનો રાયતો
 - કાકડીનો રાયતો
-

રાયતા



સામગ્રી :- બુંદી, દહીં, મીઠું, રાઈ, જીરું, કઢીપત્તો, અડદાળ, કોથમીર



રીત :- દહીને એકદમ ઝેરવી એકરસ કરવી. એમાં બુંદી (સાદી) નાખવી. બુંદીને થોડા જ પાણીમાં બે-ત્રણ મિનીટ ગેસ પર રાખી ગરમ કરી બાફવી એટલે બુંદીમાંથી તેલ નીકળી જાય ને ગળણીથી ગાળી બુંદી દહીંમાં નાખવી પછી કડાઈમાં થોડું બે-ત્રણ ટીપા તેલ લઈ એમાં રાઈ, જીરું, કઢીપત્તો, અડદ દાળ નાખી વધારવું અને દહીંમાં નાખવું ને હલાવવું પછી જીણી કોથમીર સુધારી, ઘોઇને નાખવીને, પ્રમાણસર મીઠું નાખવું પછી હલકે હાથે હલાવવું અને ફીજુંમાં રાખી દેવું અને અડધો કલાક રહી ખાવું.



સામગ્રી :- કુટ (નારંગી, મોસંબી, અનનસ), દહીં, સાકર



રીત :- દહીને એક રસ ઝેરવી એમાં ઉપર આપેલ કુટ સમારી નાખવા અને જરૂર પડે તો સાકર કે મીઠું નાખવું નહીં તો નહીં. અનનસના ટુકડા હોથ તો સરસ લાગે છે.



સામગ્રી :- કાંદો, દહીં, મીઠું, તેલ, રાઈ, જીરું, હિંગ



રીત :- દહીને એકરસ ઝેરવી. એમાં વધાર કરી નાખવું અને કાંદાના નાના ટુકડા કરી નાખવા. (કાંદા જીણા સમારવા)



સામગ્રી :- બીટા, મીઠું, દહીં



રીત :- બીટને બાફવું અને દહીને એકરસ કરી ઝેરવી. એમાં મીઠું નાખવું અને બાફેલા બીટની ખીસ કરવી, બીટ પ્રમાણસર નાખવું એટલે દહીંમાં કલર ઓવર ન થઈ જાય. બીટ બહુજ કલર છોડે.

દાહીનું કરણી રસ

સામગ્રી :- કાકડી, ટમેટો, દહીં, મીઠું, કોથમીર

રીત :- દહીને જેરવી એકરસ કરવી. એમાં મીઠું, કોથમીર નાખવી જીણી સુધારવી. એમાં કાકડીના ચોરસ ટુકડા કરવા અને ટમેટોમાંથી વચ્ચે ગર્ભ કાઢી નાખવો એના નાના ટુકડા કરી નાખવા. બધી એક સરખું કરી ખાવું.



દાહીનું કાંઈ રસ

સામગ્રી :- પાકા ડેલા, સાકર, મીઠું, દહીં, લાલ મરચાં ભૂંકી, કોથમરી

રીત :- દહીને જેરવી એકરસ કરવી. એમાં પ્રમાણાસર સાકર અને મીઠુંને લાલ મરચી નાખવી અને જીણી કોથમરી નાખવી. પછી પાકા ડેલાના ગોલ ગોલ ટુકડા નાખીને હલકે હાથે હલાવવું ને freeze વાળું ઠંડું રાયતો ખાવો સરસ લાગે છે.



દાહીનું કાંઈ રસ

સામગ્રી :- કાકડી, દહીં, મીઠું, કોથમીર, સાકર

રીત :- દહીને જેરવી એકરસ કરવી. એમ મીઠું, કોથમરી અને સાકર નાખી એક સરખું કરવું. કાકડીને ખીસ કરી એમાંથી પાણી કાઢી નાખવું અને એ ખમણ એમાં મીકસ કરવું આ રાયતો ઠંડો બહુજ સરસ લાગે.



કચુંબર

- કચુંબરનો મસાલો
- ગાજરનું કચુંબર
- કોબી - ટમેટાનું કચુંબર
- ટમેટા કાંદાનું કચુંબર
- મોગરીનું કચુંબર
- બટેટાનું કચુંબર
- લીલી હળદર અને આદુ કચુંબર
- કાકડીનું કચુંબર
- વટાળાનું કચુંબર
- કાકડીનું કચુંબર
- ટમેટા, કેરી, કાંદાનું કચુંબર

બાજુદાં રસ

સામગ્રી :- દાળિયા, શીંગદાણા, કોપરાનું ખમણ, તલ, વરિયાળી, જીરું, મરી, સૂક્ષ્માં આખા મરચાં, અનારદાણા, તમાલપત્ર



રીત :- દાળિયાને થોડા તેલમાં શેડી લેવા. કોપરાનું ખમણ કરી, થોડા તેલમાં શેકવું. શીંગદાણાને શેડી છોતરા કાઢવા. તલને સાધારણ શેકવા. વરિયાળી, જીરું, મરી, તમાલપત્ર અને સૂક્ષ્માં મરચાને અલગ તેલમાં સાંતળવા પછી બધું ભેગુ કરી, અનારદાણાં નાખી, ખાંડી, બરણીમાં મસાલો બરી રાખવો, સીજનમાં જે શાકભાજી અથવા ફળ મળતા હોય તેનું કચુંબર બનાવી, તેમાં ૧ ચમચ્યો તૈથાર કરેલો મસાલો, મીઠું અને ખાંડ નાખવાં પછી અનુકૂળતા પ્રમાણે લીલો મસાલો નાખવો.

બાજુદાં રસ

સામગ્રી :- ગાજર, લીલી હળદર, આંબા હળદર, આદુ, મીઠું, લીંબુનો રસ, લીલા મરચાના કટકા, લીલા ધાણા, ખાંડ, તલ, રાઈ, જીરું, લીમડાના પાન



રીત :- લાલ ગાજરનો વચ્ચેનો કઠણ ભાગ કાઢી છીણી લેવા. તેમાં લીલી હળદર, આંબા હળદર અને આદુને છોલી તેની કટકી, લીલાં મરચાના કટકા, લીલા ધાણા, મીઠું, લીંબુનો રસ અને થોડી ખાંડ નાખી એક ચમચ્યો તેલમાં રાઈ, હિંગ અને લીમડાના પાન નાખી વધાર કરવો.

બાજુદાં - રસ

સામગ્રી :- કોબી (ગ્રીન) ટમેટો, સાકર, મીઠું, મરીનો ભૂકો, કોથમરી

રીત :- કોબીના ગ્રીન લઈ જીણી સુધારવી એમાં ટમેટાના નાના નાના ટુકડા નાખવા એમાં સાકર, મીઠું, મરીનો ભૂકો અને કોથમરી નાખી ફીજમાં રાખી ખાવું. હંડુ સાંદુ લાગે છે.

બાજુદાં - રસ

સામગ્રી :- પાકા ટમેટો, સફેદ કાંદા, મીઠું, ખાંડ, લીલા મરચાના બારીક કટકા, લીલા ધાણા, ધાણા જીરું, મરીનો ભૂકો



રીત :- પાકા ટમેટાને ઘોરી નાના કટકા કરવા. તેમાં બે સફેદ કાંદાને છીણીને નાખવા. મીઠું, ખાંડ અને મરચાના ટુકડા બારીક, લીલા ધાણા, ધાણા

દુંગું દુંગું

સામગ્રી :- મોગારી (ગ્રીન), મીઠું ખાંડ, લીલા મરચાના કટકા, કચુંબરનો મસાલો, લીલા ધાણા.

રીત :- મોગારી ઝીણી સમારી, મીઠું નાખી ચોળી પાણી કાઢી નાખવું, તેમાં મીઠું, ખાંડ, લીલા મરચાના કટકા, એક ચમચો કચુંબરનો તૈયાર હોય તો મસાલો અને લીલા ધાણા નાખવા.



દુંગું દુંગું

સામગ્રી :- બદેટા બાકેલા, ગ્રીન ચટની, મીઠું

રીત :- બાકેલા બદેટાના ટુકડા કરવા એમાં મીઠું પ્રમાણસર અને ગ્રીન ચટની નાખી મીક્સ કરી Toothstick થી ખાવી. ઉપર કોથમરી અને કોપરું ભંભેરવું.



દુંગું દુંગું

સામગ્રી :- લીલી હળદર, આદુ, આંબા હળદર, મીઠું, લીંબુ


રીત :- લીલી હળદર, આદુ અને આંબા હળદરના ઝીણા કટકા કરવા એમાં મીઠું અને લીંબુનો રસ સરખો નાખવાં અને બરણી ભરી ફીડમાં રાખવું, ઘણા દિવસ બંગાડતું નથી.



દુંગું દુંગું

સામગ્રી :- કાકડી, દાળિયાની દાળ, મીઠું, ગ્રીન ચટણી, સાકર

રીત :- કાકડીના ટુકડા કરવા એમાં સાકર, દાળિયાની દાળ જરા કણી કણીવાળી અને ગ્રીન ચટણી નાખી હલકા હાથે હલાવવું અને ફીડમાં મૂકી રાખવું.



(દુંગું) દુંગું દુંગું દુંગું

સામગ્રી :- વટાણા, જરૂર, મીઠું, તેલ, કોથમરી

રીત :- વટાણાને સોડાથી બાફી લેવા અને પાણી કાઢી કોરા કરવા. એક કાદાઈમાં તેલ નાખી જરાનો વધાર કરવો એમાં વટાણા નાખી થોડું મીઠું નાખી હલાવવું અને કોથમરી ભંભેરવી. ગરમ ગરમ ખાવું.

દુંગું દુંગું

સામગ્રી :- કેરી, કાંદા, ટમેટા, કોથમરી, મીઠું, મરી અથવા લાલ મરચું

રીત :- કેરી, કાંદા, ટમેટાના નાના નાના ટુકડા કરવા અને ઝીણી કોથમરી સુધારીને નાખવી. એમાં મીઠું અને મરીનો લૂકો અથવા લાલ મરચું નાખી કચુંબર ખાવું.



સૂક્ષ્મવાણી

- મરચાંની સૂક્ષ્મવાણી (૧)
 - મરચાંની સૂક્ષ્મવાણી (૨)
 - ગુવાર-કોટીબાની સૂક્ષ્મવાણી
 - શક્કરટેટીની કાયલી
 - સાખુદાળા બટેટાની ચકરી
 - કારેલાની સૂક્ષ્મવાણી
 - ટેટીના બી
 - ઝેરાવડી
-



સામગ્રી :- લીલા લાંબા મરચા, સાબુદ્ધાણા, મીઠું, ઘાણા જીરું

રીત :- લીલાં લાંબા મરચાને ઘોઈ, ઉભા ચીરી, બી કાઢી નાખવાં. સાબુદ્ધાણાને ખાટી છાશમાં પલાળી રાખવા, બરાબર પોચા થાય એટલે થાળીમાં છૂટા કરી રાખવા. ફૂલી જાય એટલે મીઠું અને ઘાણા જીરું નાખી, મરચાની અદર ભરવા અને તડકામાં સૂક્ખવી દેવા. બરાબર સૂક્ખાઈ જાય એટલે ડબ્બામાં ભરી લેવા. જરૂર હોય ત્યારે તેલમાં તળવા.



સામગ્રી :- લીલા મરચા, મીઠું, તલ, ઘાણા જીરું, લીંબુનો રસ

રીત :- લીલા મરચાને ઘોઈ, ઉભાં ચીરી તેમાંથી બી કાઢી નાખવા. મીઠું, તલ, ઘાણા જીરું અને લીંબુનો રસ બધું લેગું કરી મરચામાં ભરવું પછી તડકામાં સૂક્ખવી દેવા.



સામગ્રી :- કુમળી ગવાર, કોઢીમડાં

રીત :- ગવારને તડકે સૂક્ખવી બરાબર સૂક્ખાઈ જાય એટલે બરણીમાં ભરવું જોઈએ ત્યારે તેલમાં તળી ઉપર મીઠું, લાલ મરચું, હળદર, ઘાણા જીરું નાખવું. કોઢીમડાંના ગોળ પાતીકા કરી છાશમાં મીઠું નાખી તડકામાં સૂક્ખવી. કાચલી પેક ડબ્બામાં ભરી લેવી.



સામગ્રી :- શકરટેટીની છાલને તડકામાં સૂક્ખવી દેવી. બરાબર સૂક્ખાય એટલે તેલમાં તળી ઉપર મીઠું અને સર્જું મરચું ભલભાવવું.

રીત :- મોગરી ઝીણી સમારી, મીઠું નાખી ચોળી પાણી કાઢી નાખવું. તેમાં મીઠું, ખાંડ, લીલા મરચાના કટકા, એક ચમચો કચુંબસનો તૈયાર હોય તો મસાલો અને લીલા ઘાણા નાખવા.



સાબુદ્ધાણા

સામગ્રી :- સાબુદ્ધાણા, બટેટા, મીઠું, આદુ, મરચા

રીત :- સાબુદ્ધાણા ભીજવી નાખવા અને બટેટા બાંધી કશ કરવા. બાંદેલા બટેટાના માવામાં સાબુદ્ધાણા મીઠું અને આદુ મરચા નાખી માવો બનાવી ચકરી પાડી તડકે સૂકવી. કદક થઈ જાય એટલે બરણી ભરવી અને જ્યારે જોઈ ત્યારે તેલમાં તળી ખાવા.



કારેલા

સામગ્રી :- કારેલા, મીઠું

રીત :- કારેલાને છોતી ગોળ સમારી મીઠું લગાડીને તડકે સૂકવવા. જરૂર પડે ત્યારે તેલમાં તળી ખાવા.

ટેટીના

સામગ્રી :- ટેટીના બીને ઘોઇને તડકે સૂકવવા અને જરૂર પડે ત્યારે તેલમાં તળી ખાવા.

ચોખાનો

સામગ્રી :- ચોખાનો લોટ, પાપડખાર, મીઠું, પાણી

રીત :- ૧ ૧/૨ કપ પાણી ઉંકળવા મૂકવું. ૧ ૧/૨ કપ પાણીમાં ચોખાનો લોટ ઓગાળવો. પાણી ઉંકે એટલે લોટ નાખવો. મીઠું અને ખારો નાખવો. ઢાંકી ધીમા તાપે ચડવા દેવું. લોટ ચડી જાય પછી નીચે ઉતારી લેવો. તડકે પ્લાસ્ટિક મૂડી ગોટી વડીઓ એવી રીતે મૂકવી કે ઉપર અણી જેવું સૂકાઈ જાય પછી બોટલમાં ભરવી. તેલમાં તળીને વાપરવી.

મુખ્યવાસ

- સોપારી
- મીઠાવાળી વરિયાળી
- અજમો
- તલ
- સૂવા
- સૂવા, વરિયાળી, તલ, ઘાણાદાળ

કચ્છી મુખવાસ



શકલી સોપારી પહેલા ઝીણી સમારી લેવી. પછી એમાં વરિયાળી, તજ, લવિંગ, એલચી, જેટીમધ ભોઈતા પ્રમાણમાં થોડા થોડા લઈને બધું સાથે ખાંડી નાખવું અને મોટી ચાળણીશી ચાળી લઈ બાટલીમાં ભરી ઢેવું.



વરિયાળાના પ્રમાણમાં એકાદ બે ચમચા પાણીમાં મીઠું ઓળાળી તે પાણીમાં વરિયાળીને રંગાળી હેવી અને અડધો કલાક રહેવા દઈ પછી શેકવી..



મુખવાસ તરીકી અજમો શેકીને ખાવો, કારણ એ ગરમ હોવાથી ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે તેમ જ વાયુ થતો નથી. પેટમાં દુખતું હોય તો અજમો ખાવાથી મરી જાય છે. અજમો વીળીને સાફ કરી મીઠા-લીંબુવાળો કરીને ધીમે ધીમે તાપે શેકી લેવું. કોપણું, તલ, વરિયાળી પણ એની સાથે બેળવવા હોય તો બેળવી શકાય.



તલ પણ મીઠું અને લીંબુવાળા કરી શેકવા. મુખવાસ તરીકી ખાવાથી દાંતને ચોખણું તલનું તેલ લાગે અને તેથી દાંત મજબૂત રહે અને દુખે નહિ.





સૂવામાં મીઠું અને લીંબુનો રસ અને હળદર નાખી ભૂસી લેવું પછી પાણી સ્ક્રાઇટ જાય ત્યારે શેકી લેવું એમાં અજમો પણ શેકીને ખાવું.



ફૂલ, વાણિયા, તલ, ઘાણાદાળ બધાને અલગ અલગ મીઠું અને હળદર પાણીમાં મિક્સ કરી બધામાં લેળવી અલગ અલગ થોડું સ્ક્રાઇને બધાને અલગ અલગ શેકી નાખવા અને ઠંડા થઈ જાય પછી હલકા હાથે થોડું ભૂસીને પછી બધું મિક્સ કરી એક એરટાઈટ ડબ્બામાં મૂકી દેવું.



ચીલડાના બીને સ્ક્રાઇને તડકામાં કડક કરવા. સ્ક્રીન જાય ત્યારે મીઠું, હળદર મિક્સ કરી સ્ક્રાઇને પછી ધીમે તીપે શેકી લેવું ને પછી ખાવામાં ઉપયોગ કરવું.



મસાલા બનાવવાની રીત



સામગ્રી :- સૂક્ષ્મ ધાળા, જીરુ, તજ, લવિંગ, મરી, મસાલાની એલચી, દગડકૂલ, શાહજીરુ, તમાલપત્ર, બાદિયા



રીત :- આ દરેક વસ્તુને સાફ કરી, ધીમાં શેકી ખાંડી, ચાળી, મસાલો બનાવવો. પછી પેક બરણીમાં ભરી લેવો. આ મસાલો કેરો થાય છે તેથી વધારે દિવસ રહી શકે છે.



સામગ્રી :- સૂંદ, કાળામરી, એલચી, લવિંગ, તજ



રીત :- ઉપર આપેલ બધી સામગ્રી તડકે સૂંદવી અથવા કોરી કડક શેકી મિક્સરમાં પીસી ચાળણીથી ચાળીને બરણી ભરી લેવી.



સામગ્રી :- બદામ, પિસ્તા, ચારોળી, એલચી, સૂંદ, જાયફળ, કેસર



રીત :- ઉપર આપેલ સામગ્રી બધું ખાંડી યા મિક્સરમાં પીસી ચાળી પેક શીશીમાં ભરી લેવું.



સામગ્રી :- ચણાની દાળ, મેથી, લીમડાના પાન, સુંદ કોપરું, મરી, સૂક્ષ્મ ધાળા, હિંગ, જીરુ, હળદરનો ગાંધિયો



રીત :- ચણાની દાળને ધીમે તાપે બદામી રંગની શેકવી. કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. બધી વસ્તુ તેલમાં જુદી જુદી શેકવી. પછી ખાંડી, ચાળી, ચણાના લોટમાં લેળવી, હલાવીને પેક બરણીમાં ભરી લેવો. રસમ બનાવતી વખતે ૧ ચમચી મસાલો નાખવો.



દુષ્પાણ રસથાળ

સામગ્રી :- સુંકું કોપરું, તલ, શીંગદાણા, સૂકા મરચાં, તજ, લવિંગ, મરી, ખસખસ, મસાલાની એલચી, ઘાણા, જુડું, વરિયાળી, અનારદાણા

રીત :- કોપરાને છીણી થોડા તેલમાં શેકી લેવું, શીંગદાણાને શેકી, છોતરા કાઢી, ભૂકો બનાવવો. ખસખસ અને તલને શેકવા, તજ, લવિંગ, મરી, ઘાણા, જુડું, વરિયાળી અને સૂકા મરચાંને થોડા તેલમાં જુદા જુદા શેકવા. બધું ભેગું કરી ખાંડી, ચાળી તેમાં કોપરાનું ખમણ ખાંડીને નાખવું, તલ, ખસખસ, શીંગદાણાનો ભૂકો અને ખડેલા અનારદાણા નાખી હવાવી મસાલો તૈયાર કરી, કાચની બરણીમાં ભરી લેવો. કોઈપણ કોરા શાક અથવા રવૈધાના લોટમાં આ મસાલો નાખવાથી સ્વાદિષ્ટ બને છે.



સામગ્રી :- સિંધવ, સંચળ, જુડું, હળદર, મરચા, હીંગ, સુંકું

રીત :- બધું બારીક દળાવી, ચાળી, કાચની બરણીમાં ભરી લેવું.



સામગ્રી :- ઘાણા, જુડું, ખસખસ, સૂકા આખા મરચાં, તલ, રાઈ, મરી, મેથી, હળદરના ગાંઠિયા

રીત :- બધી વસ્તુને રતાશ પડતી શેકી, ખાંડી, ચાળી, પેક બરણીમાં ભરી લેવી.



સામગ્રી :- ઘાણા, જુડું, લવિંગ, તજ, એલચી

રીત :- ઘાણાને રતાશ પડતા શેકી, તેમાં જુડું, તજ, લવિંગ અને એલચી નાખી, બારીક ખાંડી, ચાળીને તૈયાર કરવું. કાચની પેક બરણીમાં દાબી દાબીને ભરવું ઉપર મીઠાનો થર પાથરી દેવો. આથી લાંબા સમય સુધી બગાડશે નહિ.



65

અવનવો કર્છી રસથાળ

NOTES



જસ્મીન જ્યંત છેડા

મૂક સમાજસેવક પિતાશ્રી પદમશીલાઈ પાસેથી સેવાનો
અને આર્થિક માતા પ્રેમીલાભેન અને
માતા સમાન સાસુમા લક્ષ્મીભેન પાસેથી મળેલ તાતીમ
અને સંસ્કારો ભાવિ પેઢી સુધી પહોંચાડવા ઉત્સુક
જસ્મીન જ્યંત છેડાએ અંગેલ માધ્યમની શાળા અને
કોલેજમાં રાસ ગરબા, રમત ગમત, ટ્રોઇઝમાં ઈનામ
મેળવતા બેચતર ઓફ આર્ટ્સ (B.A.) ની પદવી મેળવી.
અંગેલ માધ્યમમાં ભાણવા છતાં સામાજિક વ્યવહારની ભાષા
ગુજરાતીમાં પણ પ્રભુત્વ છે તેની પ્રતીતિ કરાવે છે આ પુરુષક.
જ્ઞાતિ સંસ્થા તેમજ લાયન્સ કલબ ઓફ મુલુંડમાં
પણ સપોર્ટિંગ કાર્યકર્તા તરીકે ઈનામ મેળવ્યા છે.
લાયન લેડી ઓક્સિલરીમાં સંક્રિય કાર્યકર્તા.
કોઈપણ હોદા પર રહ્યા વગર નિઃસ્વાર્થ સેવા કરવાની હોંશ.
અનાથ તેમજ પ્રતિકુળ વાતાવરણમાંથી આવતા
બાળકોને પ્રેરણા અને ટયુશન આપી ગ્રેજ્યુઅશન કરાવ્યું છે.